https://archive.org/details/bk1396/page/n0/mode/1up

2010-03 -Patidar Saurabh (1396)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

માર્ચ-૨૦૧૦

પાટીદાર સૌરભ

ત્રિવાર્ષિક લવાજમ રૂા.૩૦૦

કચ્છ ભાજપના
ઉપપ્રમુખપદે
દેવજી માવજી લીંબાણી

સનાતનીઓ
હવે લડશે
આખરી લડાઈ

સુવર્ણ જયંતિ એક્સપ્રેસ
નાઉ ઓન રાઈટ ટ્રેક.....

realpatidar.com

https://archive.org/details/bk1396/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 7, 9, 11, 25, 31, 35.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v18.py

https://archive.org/details/bk1396/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.23 14:53:10 +05'30'

realpatidar.com

માર્ચ-૨૦૧૦

પાટીદાર સૌરભ

ત્રિવાર્ષિક લવાજમ રૂ.૩૦૦

કચ્છ ભાજપના
ઉપપ્રમુખપદે
દેવજી માવજી લીંબાણી

સનાતનીઓ
હવે લડશે
આખરી લડાઈ

સુવર્ણ જયંતિ એક્સપ્રેસ
નાઉ ઓન રાઈટ ટ્રેક.....

realpatidar.com

realpatidar.com

realpatidar.com

https://archive.org/details/bk1396/page/n4/mode/1up

realpatidar.com

પાટીદાર સૌરભ

માસ : માર્ચ-૨૦૧૦ અંક : ૧
સળંગ અંક-૨૧૭ વર્ષ : ૧૯

● તંત્રી ●
સી. કે. પટેલ.

● સંપાદક ●
નીતા પટેલ

● વિશેષ પ્રતિનિધિ ●
હરીલાલ પટેલ

● છાયા ચિત્રકાર ●
રાજુ પારસીયા
અનિલ સોની

● કલા નિર્દેશક ●
જીગ્નેશ પટેલ

● મુદ્રક અને પ્રકાશક ●
નીતા પટેલ
પાટીદાર પ્રકાશન, નખત્રાણા - કચ્છ

● મુદ્રણ સ્થળ ●
એલાઈડ ઓફસેટ, ગોમતીપુર
અમદાવાદ

● કાર્યાલય ●
પાટીદાર સૌરભ
માધવ કોમ્પલેક્ષ,
નખત્રાણા (કચ્છ) ૩૭૦૬૧૫
ફોન : ઓફિસ : ૨૨૨૭૦૬
ઘર : ૨૨૨૪૦૦
email : patidarsaurabh@yahoo.co.in

● લવાજમ ●
ત્રિવાર્ષિક : રૂ. ૩૦૦

સ્વાધ્યાય

Whenever I felt a pain of despair... I would sit myself down and think about it in the Light of Eternity. It did not take long to disappear. Eternity clears the mind.

રશિયન કવિ બહુ જ સુંદર વાત કહે છે. દુઃખ અને નિરાશાનો અનુભવ દરેક જણને થાય છે. ડગલે ને પગલે આ ક્રૂર જગતમાં દુઃખનો કે નિરાશાનો સામનો કરવો પડે છે. પણ માણસને હતાશ થવું ન પાલવે. જો એક ટ્રેન ચૂકી જવાય અને ઘરે જઈને સૂઈ જઈએ તો કોઈ દિવસ નિયત મુકામે પહોંચી જ ન શકાય. દુઃખને થકવી નાખવું હોય તો ચાલતા રહો. ઉપરની પંક્તિમાં રશિયન કવિ બહુ જ મૂલ્યવાન વાત કરે છે. તે કહે છે કે, 'દુઃખવાળું જીવન હોય તો પણ એ જીવન અનંત છે. એકાદ નિષ્ફળતા કાંઈ જીવનની અનંતતાનો અંત આણી શકે નહીં. દુઃખ તો અનાદિ અને અનંત છે. દુઃખ તો પસાર થઈ જવા માટે આવ્યું છે. આવતી કાલે કે પરમ દિવસે તે જતું રહેશે.'

❑

realpatidar.com

https://archive.org/details/bk1396/page/n5/mode/1up



realpatidar.com

https://archive.org/details/bk1396/page/n6/mode/1up

realpatidar.com

તંત્રીલેખ

પીઠ પાછળ ઘા કરવાની નીતિ મોગલકાળથી ચાલી આવે છે

૨૭મી ફેબ્રુઆરી, ૨૦૧૦ને શનિવારના પાટીદાર વિદ્યાર્થી ભવન નખત્રાણાના સંકુલમાં જે કંઈ બન્યું, સમાજના ૫૦ વર્ષના સ્વર્ણિમ ઈતિહાસને ઝાંખપ લગાડનારું હતું અને તેને વખોડવા માટે જ્ઞાતિના કોઈ પણ સભ્ય પાસે કદાચ શબ્દો પણ નહીં હોય !

કેન્દ્રીય સમાજ દ્વારા રચાયેલ સમાધાન સમિતિની ચાલુ બેઠકમાં જે રીતે સનાતન સંપ્રદાયની વર્તમાન ચળવળમાં અગ્રીમ ભૂમિકા ભજવી રહેલા રમેશભાઈ વાગડીયા બેંગલોરવાળાને પકડવા અમદાવાદની પોલીસ આવી તે બધું કોર્ટના ફરમાન મુજબનું હોવા છતાં આવી પરિસ્થિતિ નિર્માણ કરવા માટે ક્યા પરિબળો સક્રિય હતા તેનો અહેસાસ કેન્દ્રીય સમાજને પણ કદાચ પહેલી વખત થઈ ગયો છે.

સમાધાનની વાતો કરવી અને પીઠ પાછળ ખંજર હુલાવવા એ મોગલકાળથી આપણા દેશમાં ચાલતું આવ્યું છે એટલે કોઈ કહે કે આમાં કંઈ નવાઈ પામવા જેવું નથી પણ આ વખતે કેન્દ્રીય સમાજ દ્વારા બોલાવાયેલ સમાધાન બેઠક વખતે જ આ 'ઘા' કરી કેટલાક તત્ત્વોએ કેન્દ્રીય સમાજને પણ ખુલ્લો પડકાર જ ફેંક્યો છે. હવે આ પડકારને કેન્દ્રીય સમાજની વર્તમાન નેતાગીરી કઈ રીતે ઝીલે છે તે જોવાનું રહે છે.

સ્વર્ણિમ મહોત્સવના ભવ્ય આયોજન માટે હજુ ૧૫ દિવસ અગાઉ જ મળેલ કેન્દ્રીય સમાજની ખાસ સામાન્ય સભામાં માંડ માંડ ઉભું થયેલ સુમેળભર્યું વાતાવરણ આવી હરકતોને કારણે ડહોળાઈ ગયું છે અને હવે આખરી લડાઈ લડવાના મૂડમાં ધીમે ધીમે સમાજનો બહોળો વર્ગ આવી રહ્યો છે.

૨૭મીની રાત્રે જે રીતે જ્ઞાતિના યુવાનો વિદ્યાર્થી ભવનના સંકુલમાં ઉમટી પડ્યા તે જોઈ જ્ઞાતિના મોવડીઓને એક ચોક્કસ સંદેશો મળી જ ગયો છે કે બહુમતિ વર્ગના ભોગે હવે ખોટા માણસોની આળપંપાળ બંધ નહીં થાય તો પરિણામ સારા નહીં આવે. અને જે કંઈ પરિણામો આવે તે માટે મોવડીમંડળ જ જવાબદાર રહેશે.

સમાજ માટે જાત ઘસી નાખેલ જ્ઞાતિના વડીલોને એ વાતનું પારાવાર દુઃખ થયું છે કે સમાજના વડા મથક પાટીદાર વિદ્યાર્થી ભવનમાં આ રીતે પોલીસને પ્રવેશ કરવો પડ્યો છે. આ સમાજને પોતાની ગણતા લોકો કોઈ કાળે આવી હરકતો કરી ન શકે તે હવે સ્પષ્ટ થઈ ગયું છે. જે લોકો આ સમાજને પોતાની સમાજ તરીકે આદર આપતા ન હોય તેમને આ સમાજમાં રહેવાનો પણ અધિકાર નથી.

પાટીદાર વિદ્યાર્થી ભવનમાં યુવાનોના આક્રોશને કારણે પરિસ્થિતિ વણસતી જોઈ કેન્દ્રીય સમાજના કેટલાક ટ્રસ્ટી સહિતના હોદ્દેદારો જે રીતે અંધારામાં 'ઓઝલ' થઈ ગયા તે પણ વખોડી કાઢવા પાત્ર છે. પ્રમુખશ્રીની મદદમાં રહી સમગ્ર મામલો થાળે પાડવા સક્રિય ભૂમિકા ભજવવાને બદલે રણમેદાન છોડીને નાસી જનાર આવા અગ્રણીઓને હોદ્દા પર રહેવાનો કોઈ જ અધિકાર નથી.

મીલીટરીમાં આ રીતે પીઠ બતાવતા સૈનિકને તેનો વડો કઈ સજા આપે છે તે બધાને ખ્યાલ હશે જ. મોડે મોડે પણ પ્રમુખ શ્રી રામજી કરમશીએ આ ઘટમાળમાંથી કંઈક તો ધડો લીધો હશે જ. આટલું પણ, આ તબક્કે કાફી છે !

■

realpatidar.com

https://archive.org/details/bk1396/page/n7/mode/1up

2010-03 -Patidar Saurabh (1396)



https://archive.org/details/bk1396/page/n8/mode/1up

realpatidar

આક્રોશ

Backstabbing by Satpanthis - Betrayal during mediation efforts #History

કેન્દ્રીય સમાજના વડા મથકમાં પ્રથમ વખત પોલીસનો પ્રવેશ

સમાધાન બેઠક વખતે જ પીઠ પાછળ ઘા થતાં સનાતનીઓ લાલઘૂમ

સમાજમાં ચાલી રહેલા સાંપ્રદાયિક વિવાદોને ઉકેલવા કેન્દ્રીય સમાજ દ્વારા રચવામાં આવેલ સમાધાન સમિતિની બેઠક નખત્રાણા પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે ચાલી રહી હતી તે ચાલુ બેઠકે જ સતપંથવાળા દ્વારા અગાઉ બેંગલોરવાળા રમેશભાઈ વાગડીયા પર થયેલ એક કેસમાં બીનજામીનપાત્ર વોરંટની બજવણી માટે અમદાવાદ પોલીસ આવી પહોંચતા સમગ્ર સમાજમાં ધમાચકડી મચી ગઈ હતી.

કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી રામજી કરમશી નાકરાણી અને અન્ય વરિષ્ઠ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં તા. ૨૭-૨-૧૦ના સાંજના સમયે યોજાઈ રહેલ આ બેઠકમાં અચાનક અમદાવાદ પોલીસની એન્ટ્રી થતાં સમગ્ર સમાજમાં હડકમ્પ મચી ગઈ હતી અને વાતાવરણ ભારે ગરમા ગરમીવાળું બની ગયું હતું.

સતપંથી ભાઈ મણીલાલ કાનજી છાભૈયા દ્વારા ૨૦૦૫માં સનાતન ધર્મ પ્રચાર સમિતિ સાથે સંકળાયેલા કચ્છમાં ખોંભડીમોટીના હાલે બેંગલોર રહેતા રમેશભાઈ વાગડીયા, તેમના પિતા માવજીભાઈ વાગડીયા અને દાદા રતનશી બાપા ઉપર પીરાણામાં આવી મારામારી કરવાની પોલીસ દફતરે નોંધાયેલા અગાઉના કેસમાં કોર્ટ દ્વારા કાઢવામાં આવેલ બીનજામીનપાત્ર પકડ વોરંટની બજવણી માટે અમદાવાદની પોલીસ નખત્રાણા આવી પહોંચતા આ બબાલ સર્જાઈ હતી.

પાટીદાર વિદ્યાર્થી ભવનના હોલમાં ચાલુ મિટિંગે પોલીસ આવી પહોંચતાં ભારે હોબાળો મચી ગયો હતો અને આ વાતની ખબર વાયુવેગે સમગ્ર કચ્છમાં થઈ જતાં નખત્રાણા તાલુકાના ગામે ગામથી સનાતની યુવાનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડતાં પરિસ્થિતિ વણસી જાય તેવા સંજોગો સર્જાયા હતા.

સમાધાન સમિતિની બેઠકમાં સતપંથવાળા દ્વારા સનાતનીઓ પર થઈ રહેલા ખોટા પોલીસ કેસો બીનશરતી ધોરણે પાછા ખેંચવાનો મુદ્દો મુખ્ય હતો અને તેમાં રમેશભાઈ વાગડીયાના કેસનો પણ સમાવેશ થતો હતો. પણ જે બાબતના સમાધાન માટે કેન્દ્રીય સમાજ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી તેમાં આ રીતે સમગ્ર કાર્યવાહીને તોડી પાડવાનો પ્રયાસ થતાં સમગ્ર ભારતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને કેન્દ્રીય સમાજની ઢીલી નીતિને કારણે જ પરિસ્થિતિ આટલી હદે વણસી રહી છે તેવો સ્વીકાર સમાજમાં હવે સાર્વત્રિક બની રહ્યો છે તેવું દેશભરમાંથી મળી રહેલા અહેવાલો સૂચવી રહ્યા છે.

નખત્રાણા સહિત કોટડા (જ), વિરાણી, દેવીસર, અંગીયા... ગામે ગામથી યુવાનો અને સમાજના અગ્રણીઓ આ સમાચાર સાંભળી જે વાહન મળ્યું તે લઈ વિદ્યાર્થી ભવન તરફ દોટ મૂકતાં રાત્રે વિદ્યાર્થી ભવનના સંકુલમાં લડી લેવાના મૂડમાં જે રીતે માહોલ ઉગ્ર બનતો ગયો તે જોઈ કેન્દ્રીય સમાજની નેતાગીરી પણ હેબતાઈ ગઈ હતી અને શું ઉકેલ લાવવો તેની ગડમથલમાં સૌ પરોવાઈ ગયા હતા.

પાટીદાર વિદ્યાર્થી ભવનનો ઉગ્ર માહોલ જોઈ કેટલાક લોકો સીફતપૂર્વક ત્યાંથી 'સરાવી' ગયા હતા તેમાં કેન્દ્રીય સમાજના ટ્રસ્ટી સહિતના ટોચના હોદ્દેદારોનો પણ સમાવેશ થતો હોઈ લોકોમાં આવી નમાલી નેતાગીરી સામે આક્રોશ ફેલાયો હતો. કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી રામજી કરમશી નાકરાણી, મહામંત્રી શ્રી મોહનભાઈ ધોળુ અને વરિષ્ઠ ટ્રસ્ટી શીવદાસભાઈ પટેલ સિવાયના આગેવાનો 'નૌ દો ગ્યારહ' થઈ ગયા હતા !

યુવાનોનો આક્રોશ એટલો બધો તીવ્ર હતો કે ગમે ત્યારે કોઈ પણ અજૂગતી ઘટના બની શકે તેમ હતી. ડૉ. શાંતિલાલ સેંઘાણી જેવા સ્થાનિક અગ્રણીઓએ યુવાનોને માંડ માંડ સમજાવી પરિસ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો પણ જેમની ખરા સમયે પરિસ્થિતિ કન્ટ્રોલ કરવાની જવાબદારી હતી તે નેતાઓ ક્યારે અંધારાનો લાભ લઈ ઓગળી ગયા તેની કોઈને ખબર જ નહોતી પડી !

કેન્દ્રીય સમાજની નેતાગીરીને પણ સનાતની યુવાનોના આક્રોશનો પહેલી વખત જ આવો પરચો મળતાં અત્યાર સુધી સતપંથ-સનાતન પ્રશ્ને ચલાવેલ લોલંલોલ હવે સમાજમાં ચાલશે નહીં તેનો અણસાર સ્પષ્ટ રીતે આવી ગયો હતો. આગળના દિવસોમાં કેન્દ્રીય સમાજની નીતિ અને વર્તનમાં પણ આ બાબતનું સ્પષ્ટ પ્રતિબિંબ પડશે તેવો વિશ્વાસ ૨૭ મીની ઘટના બાદ લોકો રાખી રહ્યા છે.

૨૭ મીની રાત્રે જ આ વાતની જાણ વાયુવેગે સમગ્ર ભારતમાં થઈ જતાં નખત્રાણા રહેતા સગા-સંબંધી કે મીડીયા સાથે સંકળાયેલાઓને ફોન કરી સમગ્ર ઘટના અંગે સાચી હકીકત જાણવા લોકોએ ભારે રસ દાખવ્યો હતો. લોકોએ આ ઘટનાને વખોડી કાઢતાં હવે આવા પરિબળોને કડક હાથે ડામી દેવા અને 'દૂધ દહીમાં પગ' રાખતા નેતાઓને ખુલ્લા પાડવાનો સમય આવી ગયો હોવાનું સ્પષ્ટ રીતે જણાવેલ.

ખાસ કરીને કેન્દ્રીય સમાજના મુખ્ય મથક પાટીદાર વિદ્યાર્થી ભવનના સંકુલમાં જે રીતે, જે કારણે પોલીસને પ્રવેશ કરવો પડ્યો તેને લઈ સમગ્ર ભારતમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ ઘટનામાં જવાબદાર જ્ઞાતિના માણસો પર કેન્દ્રીય સમાજ હવે શું કાર્યવાહી કરે છે તેના પર બધાની મીટ

realpatidar.com

https://archive.org/details/bk1396/page/n9/mode/1up

2010-03 -Patidar Saurabh (1396)

realpatidar.com

મંડાઈ છે.

દરમ્યાન, અમદાવાદ પોલીસે સ્થાનિક પોલીસને મદદ લઈ બીનજામીનપાત્ર વોરંટના આધારે રમેશભાઈ વાગડીયાની ધરપકડ કરી હતી પણ તેમની તબીયત અચાનક લથડતાં તાબડતોબ દેવાશિષ હોસ્પિટલ ખાતે રાત્રે જ ભરતી કરવામાં આવ્યા હતા. રાત્રે અને બીજા દિવસે રવિવારે આખો દિવસ રમેશભાઈ વાગડીયાની તબીયતના ખબર અંતર પૂછવા માટે ટોચના નેતાઓ સહિત લોકોએ દિવસભર ભારે ધસારો કર્યો હતો.

કિંગ ફિશરમાં એર હોસ્ટેસ બનતાં કુ. નેહલ ભગત

બેંગ્લોર :

અત્રેની શ્રી અશોક ટીમ્બર ટ્રેડીંગ કંપનીવાળા શીવજી ગોપાલ ભગત કચ્છમાં ખોંભડીમોટીની પૌત્રી કુ. નેહલ ભગતે King Fisher Airlinesની ગ્રાઉન્ડ સ્ટાફ એરહોસ્ટેસ બનીને ભગત પરિવારનું તેમજ ભાવિ ભરથાર ચિ. તરૂણકુમાર ડાહ્યાભાઈ હળપાણી પરિવાર સહિત સ્થાનિક મૈસુરરોડ સમાજનું ગૌરવ વધારેલ છે.

ઉત્પાદક : સર્વ પ્રકારના રાઉન્ડ તથા સ્કેવર એમ.એસ. (લોખંડના) પાઈપ

શ્રી રામ ટ્યૂબ્સ

પુરસોત્તમ ડી. દિવાણી : ૯૪૨૩૦૪૨૭૧૬
ઈશ્વર ડી. દિવાણી : ૯૪૨૩૨૮૫૦૧૭
રાજેશ એલ. દિવાણી : ૯૪૨૩૮૨૪૬૭૨
લખન એ. દિવાણી : ૯૮૬૦૭૭૦૭૧૪
અમૃત એલ. દિવાણી : ૯૪૨૩૨૭૧૪૯૬



કે.પી.ટી. સામે,
જયસિંગપુર-શિરોલ રોડ,
શિરોલ - ૪૧૫૧૦૩.
તા.શિરોલ. જિ.કોલ્હાપુર.
ફોન : 02322-221315

FINELINE 079 26577520

Khetabhai N. Chauhan
M. 98220 61640
Shailesh K. Chauhan
M. 94230 41258

Manufactures of
RCC Door Frames,
Window Frames,
Compound Poles
and Allied Material

Shri
Ambica
Cement Articles



At. Po. Balinga, Tal. Karveer, Dist Kolhapur - 416010
Ph. : (0231) (O) 2437646 (R) 2368045



FINELINE (079) 26577520

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1396/page/n10/mode/1up

2010-03 -Patidar Saurabh (1396)

Sanskar Dham #History - Sanatan Dharm

સંસ્કારધામની સનાતનધર્મ જાગૃતિ સભામાં જોરદાર માંગ

કેન્દ્રીય સમાજ મુળ સનાતની સમાજ તરીકેની ઓળખ ટકાવી રાખે

શ્રી અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ દ્વારા તા. ૧૧-૨-૨૦૧૦ના શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન - સંસ્કારધામ દેશલપર મુકામે સનાતન ધર્મ જાગૃતિ અભિયાન સભાનું આયોજન કરવામાં આવેલ જેમાં કચ્છના ૧૪૪ ગામોના સનાતન સમાજના પ્રતિનિધિઓ, ગુજરાત-સાબરકાંઠા વિસ્તારના ભાઈઓ સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં સનાતની ભાઈઓએ હાજરી આપી હતી.

વડીલ શ્રી જેઠાલાલ લાલજી ચોપડાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ ચિંતન સભામાં (૧) કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં આપણો મુળ વૈદિક સનાતન હિન્દુધર્મ જાગૃતિ એવમ્ કચ્છ કડવા પાટીદાર સમાજ અને જ્ઞાતિનો ઈતિહાસ અને (૨) આપણી કેન્દ્ર સમાજની મુળ સનાતની સમાજ તરીકેની ઓળખ ટકાવી રાખવા બાબત વિશેષ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

સભામાં ઉપસ્થિત સર્વેના વિચારો અને મંતવ્યો લીધા પછી આ સભામાં સર્વાનુમતે નીચે મુજબના ઠરાવો પાસ કરવામાં આવ્યા હતા.

(૧) શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ જે આપણી કેન્દ્રીય સમાજ છે તેની સ્થાપના પીરાણા સતપંથ મતનો ત્યાગ કરેલા વડીલોએ કે જેમને સનાતન ધર્મનો અંગીકાર કર્યા પછી કરી હતી. તેથી તે પુરવાર થાય છે કે આપણી કેન્દ્રીય સમાજ સનાતની સમાજ તરીકેની ઓળખ ધરાવે છે. આ કેન્દ્રીય સમાજનો ધર્મ સનાતન વૈદિક હિન્દુ ધર્મ છે અને તેની સ્થાપનાનો મુખ્ય હેતુ સનાતની ભાઈઓના હિતોની રક્ષા કરવા માટેનો જ છે.

(૨) કેન્દ્રીય સમાજનો સ્વર્ણિમ મહોત્સવ સનાતન ધર્મીઓનો મહોત્સવ છે. કારણ કે આ સમાજની સ્થાપના પીરાણા સતપંથ સમાજથી વિરુધ્ધ જઈને આપણા સુધારક પૂર્વજો દ્વારા કરવામાં આવી હતી. એટલા માટે થઈને આ સ્વર્ણિમ મહોત્સવમાં દરેક સનાતની ભાઈઓએ અચુક ભાગ લેવો જોઈએ. જ્યારે સનાતન હિન્દુ ધર્મ સિવાયના અન્ય ધર્મીઓનો આ મહોત્સવ નથી એટલે તેમને આમાં બીલકુલ ભાગ લેવા ન દેવો જોઈએ. તેથી કરીને આ સભા અત્રે ખુલ્લુ ઠરાવે છે કે આવા સતપંથીઓ જ્યાં સુધી આપણા મુળ હિન્દુ સનાતન ધર્મના પ્રવાહમાં ન ભળી જાય ત્યાં સુધી કેન્દ્રીય સમાજના સ્વર્ણિમ મહોત્સવ અથવા તો તેના જેવા અન્ય કોઈ પણ કાર્યક્રમોમાં બીલકુલ ભાગ લેવા ન દેવો જોઈએ.

(૩) કચ્છના તમામ ગામો તેમજ કચ્છ બહારના ગામોમાં વસતા સનાતની ભાઈઓની સમાજોમાં કેન્દ્રીય સમાજ અંતર્ગત જ્ઞાતિ રીત રીવાજોની ધાર્મિક ૧૮ અને ૧૯મી કલમોનું ચુસ્તપણે પાલન કરવાની અને કરાવવાની કેન્દ્રીય સમાજની પ્રાથમિક ફરજ છે. એથી આ સભા ઠરાવે છે કે આપણી કેન્દ્રીય સમાજે કલમ ૧૮ અને ૧૯નું ઉલંઘન કરતા સમાજના સભ્યો ઉપર સામાજિક અસહકાર જેવા કડક દંડનીય પગલાં લેવા જોઈએ.

(૪) આ સભામાં એ પણ જાણવા મળ્યું છે કે પીરાણા સતપંથીઓના જાહેર કાર્યક્રમોમાં એવા નાટકો અને નાટીકાઓ ભજવાય છે તેમાં બાવા ઈમામ શાહે આપણા પૂર્વજોની હિન્દુના પ્રતિક રૂપ જનોઈઓ ઉતરાવતા હોય તેવા પાત્રોની રજુઆત કરવામાં આવે છે. અત્રે આ સભા આવા હિન્દુ સનાતન ધર્મને લાંછનરૂપ કાર્યક્રમોને સખતાઈથી વખોડી કાઢે છે. કારણ કે આવા લોકો ન કેવળ આપણી સનાતન સમાજનું અહિત કરે છે પણ સાથે સાથે સમગ્ર હિન્દુ સમાજનું પણ જાણી જોઈએ અપમાન કરી રહ્યા છે. એથી આ સભા અત્રેથી કેન્દ્રીય સમાજને અનુરોધ કરે છે કે, આવા સનાતની હિન્દુ વિરોધી તત્ત્વો સામે લાલ આંખ કરી સખતમાં સખત પગલાં લે.

(૫) સમાજના સનાતની ભાઈઓ ઉપર સતપંથ સમાજના ભાઈઓ દ્વારા ફક્ત અને ફક્ત ખોટી રીતે હેરાન કરવાના હેતુ માત્રથી છાસવારે કરવામાં આવતા તદ્દન ખોટા કોર્ટ કેસો તેમજ પોલીસ ફરિયાદો જે છે તે બીન શરતી ધોરણે પાછા ખેંચવાનો આદેશ કેન્દ્રીય સમાજે ત્વરીત આપવો જોઈએ. અને ત્યાર પછી જ કેન્દ્રીય સમાજની સમાધાન સમિતિ જોડે વાટા-ઘાટોની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. એથી આ સભા અત્રે કેન્દ્રીય સમાજનં મજબુતાઈથી અનુરોધ કરે છે કે સ્વર્ણિમ મહોત્સવ પહેલાં આવા કોર્ટ કેસો પાછા ખેંચાવવા બાબત સતપંથીઓ સામે સખ્તાઈથી પગલાં લેવાનો અનુરોધ કરે છે અને ભવિષ્યમાં પણ આવા કોર્ટ કેસો ન થાય તેવી સમાજના ભાઈઓને બાંહેધરી આપે.

(૬) આપણી કેન્દ્રીય સમાજની સ્થાપના સનાતન હિન્દુ ધર્મની તથા સનાતન હિન્દુ ધર્મીઓના હીતોની રક્ષા કરવા માટે અને માટે જ કરવામાં આવી છે. તેમાં શંકાને સ્થાન જ નથી અને હોય પણ નહીં. એટલા માટે કેન્દ્રીય સમાજના આજના ધુરીણોની મુખ્ય ફરજ બને છે કે સમાજના દરેક સભ્યને પીરાણા સતપંથ ધર્મ (કે જે સમગ્ર જ્ઞાતિને હિન્દુપણામાંથી ટાળી દેવા માટે થઈને જવાબદાર હતો)નો ત્યાગ કરાવી પૂર્વજોએ પ્રસ્થાપિત કરેલ સનાતન વૈદિક હિન્દુ ધર્મનો અંગીકાર કરાવવો. તેથી અત્યારે આ સભા કેન્દ્રીય સમાજના અત્યારના આગેવાનોને અને હોદ્દેદારોને વિનંતીપૂર્વક અનુરોધ કરે છે કે આવા આગેવાનોએ પીરાણા સતપંથ સમાજના કાર્યક્રમોની આમંત્રણ પત્રિકામાં નામો

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1396/page/n11/mode/1up

2010-03 -Patidar Saurabh (1396)

realpatidar.com

છપાવીને આવા કાર્યક્રમોમાં જઈને તેમને પ્રોત્સાહન આપવાનું સદંતર બંધ કરે અને આપણી મુળ સનાતન ધર્મી કેન્દ્રીય સમાજ પ્રત્યેની પોતાની નિષ્ઠાનું પાલન કરે.

આ સભા અત્રેથી એ પણ ઠરાવે છે કે ઉપરોક્ત ઠરાવોની મુળ કોપી કેન્દ્રીય સમાજને ત્વરિત રવાના કરે અને તેની નકલો ભારતભરની તમામ ૨૯ ઝોનોને પણ મોકલાવી આપે.

આ મહત્વપૂર્ણ સભામાં સભા અધ્યક્ષ જેઠાલાલ લાલજી ચોપડા ઉપરાંત સર્વ શ્રી ગંગારામ હીરાલાલ સાંખલા (દિલ્હી), દેવજી માવજી લીંબાણી (ભુજ), નાનજી પુંજા દિવાણી (હૈદરાબાદ), કરસનભાઈ પ્રેમજી મેઘાણી (ગાંધીધામ), રામજી ભીમજી ડાયાણી (જોરાવરનગર), અબજી વિશ્રામ કાનાણી (મુંબઈ), હિંમતભાઈ રતનશી ખેતાણી (મુંબઈ), પ્રેમજી ભાણજી કેશરાણી (મુંબઈ), રમેશભાઈ માવજી વાઘડીયા (બેંગલોર), અખઈભાઈ પ્રેમજી માનાણી (નાગપુર), અમૃતલાલ રતનશી રામાણી (ધનસુરા), ધનસુખલાલ માવજી રંગાણી (ધનસુરા), શીવદાસ રતના માવાણી (દહેગામ), પુનમભાઈ ખીમજી ધોળુ (મોડાસા), ડાહ્યાભાઈ જીવરાજ ગોરાણી (મોડાસા) તેમજ ગંગારામભાઈ શીવદાસ રામાણી (ભુજ) સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સભામાં થયેલ ઠરાવો લેખિતમાં કેન્દ્રીય સમાજને પણ ત્વરીત પહોંચાડી દેવામાં આવેલ અને યોગ્ય કાર્યવાહી માટે અનુરોધ કરવામાં આવેલ. કેન્દ્રીય સમાજની તા. ૧૩-૨-૧૦ના મળેલ કારોબારી-આયોજન સમિતિની સંયુક્ત બેઠકમાં પણ આ પત્રનું વાંચન કરવામાં આવેલ.

સનાતન ધર્મ જાગૃતિ અભિયાનની અત્યાર સુધી યોજાયેલ સભાઓમાં સંસ્કારધામની સભાનું મહત્ત્વ ખૂબ જ છે કારણ કે દેશભરમાંથી સનાતન સંપ્રદાયના ટોચના અગ્રણીઓની ઉપસ્થિતિ ઉપરાંત સભામાં સર્વાનુમતે કરવામાં આવેલ ઠરાવો મહત્વપૂર્ણ છે અને પહેલી વખત સનાતનીઓ તરફથી સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે અને કેન્દ્રીય સમાજે પણ તેની નોંધ લેવી પડી હોય તેવું ત્યારપછી મળેલ સમાજની સભાઓના રૂખ પરથી પણ જણાઈ આવે છે.

પાટીદાર સૌરભ જાહેર ખબરના દર

સાઈઝ	એક અંકના	૧૨ અંકના
પા પાનું	૪૦૦ રૂ.	૪૦૦૦ રૂ.
અડધું પાનું	૭૫૦ રૂ.	૭૫૦૦ રૂ.
આખું પાનું	૧૪૦૦ રૂ.	૧૪,૦૦૦ રૂ.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1396/page/n12/mode/1up

realpatidar.com

Swarnim Mahotsav #History

૯ થી ૧૨, ચાર દિવસના સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાશે

મે મહિનામાં નખત્રાણામાં કચ્છ કડવા પાટીદારોનો મહાકુંભ યોજાશે

કેન્દ્રીય સમાજના સ્વર્ણિમ મહોત્સવના આયોજન માટે નખત્રાણા ખાતે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની ખાસ સામાન્ય સભામાં આ મહોત્સવ ૯ થી ૧૨ મે, ૨૦૧૦ ચાર દિવસનો ઉજવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો.

કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી રામજી કરમશી નાકરાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સભામાં સમાજનો સ્વર્ણિમ મહોત્સવ આન, બાન અને શાન માટે ભવ્યાતિભવ્ય ઉજવવાનો દેશભરમાંથી ઉપસ્થિત રહેલ સમાજના પ્રતિનિધિઓની મોટી હાજરીવાળી સભામાં નિર્ધાર કરવામાં આવ્યો હતો.

સ્વર્ણિમ મહોત્સવના ચાર દિવસનો વિગતવાર કાર્યક્રમ ઝીણવટપૂર્વક ઘડવામાં આવી રહ્યો છે પણ પ્રથમ ત્રણ દિવસ સ્વર્ણિમ મહોત્સવના વિવિધ કાર્યક્રમો અને છેલ્લા દિવસે સમાજનું ખુલ્લું અધિવેશન યોજાશે. ૯ થી ૧૨ મે, ચાર દિવસ દરમ્યાન પાટનગર નખત્રામા ખાતે કચ્છ કડવા પાટીદારોનો મહાકુંભ યોજાશે.

સભાના પ્રારંભે જ સુવર્ણ જયંતિ મહોત્સવના વાઈસ ચેરમેન શ્રી જયંતિલાલ લાકડાવાળાએ એડહોક કમિટિની રચનાથી માંડી સુવર્ણ જયંતિ મહોત્સવનો ઉદ્દ્ઘાટન કાર્યક્રમ, દરેક ઝોનમાં થીમ આધારીત કાર્યક્રમ, સમાજના વડીલો દ્વારા સંપર્ક યાત્રા, યુવા ઓલિમ્પીયાડ તથા ગત સામાન્ય સભામાં મુખ્ય દાતાશ્રીઓ ઉદ્દ્ઘાટક દાતાશ્રી તથા ઈતિહાસવિદ્ ગ્રંથના વિવિધ પાનાના દાતાશ્રીઓ અને આગામી સ્વર્ણિમ મહોત્સવના કાર્યક્રમોનું સ્વરૂપ કેવું હશે વગેરે વાતોને વણી લઈ વિગતવાર અહેવાલ પોતાની આગવી શૈલીમાં સભા સમક્ષ રજૂ કરેલ.

ચેરમેન શ્રી ગંગારામભાઈ સાંખલાએ જણાવેલ કે સુવર્ણ જયંતિ મહોત્સવ અગાઉ ત્રણ દિવસનો રાખવો તેવું નક્કી કરેલ પણ તેમાં આપણે જે રીતે કાર્યક્રમનો ઓપ આપવા માગીએ છીએ તે શક્ય ન હોવાથી ગઈ કાલની કારોબારી તથા આયોજનની મળેલ સંયુક્ત મિટિંગમાં આપણો સુવર્ણ જયંતિ મહોત્સવ ત્રણ દિવસના બદલે ચાર દિવસનો કરવાનું ઠરાવવામાં આવેલ છે તેને આ સભા સર્વાનુમતે મંજૂરી આપે તેવી દરખાસ્ત કરેલ જેને ખાસ સામાન્ય સભાએ હર્ષનાદો વચ્ચે સર્વાનુમતે મંજુર રાખેલ.

ગૌરાંગભાઈ ધનાણીએ ચાર દિવસના કાર્યક્રમની રૂપરેખા જણાવેલ. આ સમયપત્રકમાં સ્વર્ણિમ મહોત્સવના વધુને વધુ કાર્યક્રમો સચોટ રીતે દરેક વર્ગને ગમી જાય તે માટે હજુ પણ સંશોધન કરી માઈક્રો પ્લાનિંગ કરવામાં આવશે તેવું જણાવેલ.

કેન્દ્રીય સમાજની સુવર્ણજયંતિ એક્સપ્રેસ હવે સાચા ટ્રેક ઉપર દોડી રહી હોય તેવું લાગે છે.

realpatidar.com

https://archive.org/details/bk1396/page/n13/mode/1up

realpatidar.com

સભાને સંબોધન કરી રહેલા આયોજન સમિતિના ચેરમેન ગંગારામભાઈ સાંખલા

મહામંત્રી શ્રી મોહનભાઈ ધોળુએ અત્યાર સુધી રચાયેલ સમિતિઓ અને તેના કન્વીનરશ્રીઓના નામોની જાહેરાત કરેલ. વિવિધ સમિતિમાં જેમણે પણ સેવા આપવાની હોય તેમણે પોતાના નામો કાર્યાલયમાં નોંધાવવા જેથી જરૂર જણાય તે સમિતિમાં તેમનો સમાવેશ કરી શકાય.

સુવર્ણ જયંતિ મહોત્સવ દરમ્યાન આવતા વિવિધ પ્રસંગના ચડાવા લેવામાં આવેલ જેમાં પત્રિકાના સૌજન્ય દાતા તરીકે શ્રીમતી મુળભાઈ રતનશી રામજીયાણી પરિવાર મદનપુરા હાલે મુંબઈ, કેલેન્ડરના સૌજન્ય દાતા તરીકે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ તથા ઈતિહાસવિદ્ ગ્રંથ વિમોચનના દાતા તરીકે (૧) શ્રીમતી કાંતાબેન કેશરા રામજીયાણી, દેશલપર (મુંબઈ) (૨) શ્રીમતી કુંવરબેન નારણભાઈ નાકરાણી, રત્નાપર મઉ (મુંબઈ)એ સૌથી ઉંચી બોલી બોલીને ચડાવો લીધેલ.

મહોત્સવના અન્ય દાતાઓની પણ સભામાં જ નોંધણી કરવામાં આવેલ. જે દાતાશ્રીઓ લેવાના બાકી છે તે વહેલા તે પહેલાના ધોરણે નોંધવામાં આવશે. પાંચ લાખથી ઉપરના દાતાશ્રીના નામ સી.ડી.માં આવશે જ્યારે એક લાખથી ઉપરના દાતાશ્રીના નામ પાટીદાર વિદ્યાર્થી ભવન નખત્રાણા મધ્યે શીલાલેખમાં સુવર્ણાક્ષરે લખવામાં આવશે. બાકીના દાતાશ્રીઓ માટે સમાજના પ્રમુખ શ્રી રામજીભાઈ નાકરાણીએ અપીલ કરતાં જણાવેલ કે સ્વર્ણિમ મહોત્સવ નિમિત્તે થનાર બચતની રકમ સમાજ દ્વારા ભવિષ્યમાં શૈક્ષણિક હેતુ માટે વાપરવામાં આવશે.

ચેરમેન શ્રી ગંગારામભાઈ સાંખલાએ તેમના વક્તવ્યમાં જણાવેલ કે દરેક ઝોનમાં સાત થીમ આધારીત કાર્યક્રમો યોજવા માટેની સમાજની અપીલને સૌ પ્રથમ ઉત્તર

સમાજની સુવર્ણજયંતિની ઉજવણી અંગે મળેલ ખાસ સામાન્ય સભામાં ભારતભરમાંથી મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉમટી પડ્યા હતા.

realpatidar.com

https://archive.org/details/bk1396/page/n14/mode/1up

realpatidar.com

સ્વર્ણિમ મહોત્સવના નોંધાયેલ દાતાઓ

રકમ	વિગત	દાતાનું નામ
૨૧,૧૧,૧૧૧	ઈતિહાસવિદ ગ્રંથ વિમોચન	(૧) શ્રીમતી કાંતાબેન કેસરા રામજીયાણી, મુંબઈ અને
		(૨) શ્રીમતી કુંવરબેન નારણભાઈ નાકરાણી રત્નાપર, મુંબઈ
૧૫,૫૧,૦૦૦	પત્રિકાના સૌજન્ય	શ્રીમતી મુળબાઈ રતનશી રામજીયાણી પરિવાર, મદનપુરા, મુંબઈ
૧૫,૫૧,૦૦૦	કેલેન્ડર	શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ, નખત્રાણા
૫,૫૫,૫૫૫	ફોટોગ્રાફી અને વિડીઓ સી.ડી.	રવજીભાઈ રામજી ચોપડા ગ્રુપ, મુંબઈ
૫,૦૦,૦૦૦	સહયોગ નિધિ કુપન જાહેરાત	શ્રી ચંદુભાઈ મનજીભાઈ પોકાર, મોરબી
૨,૫૧,૦૦૦	સાંસ્કૃતિક કાર્યક્રમ ઉદ્ઘાટક	(૧) રામ ભરોસે - દેવજીભાઈ રામજીભાઈ ભાવાણી, સુરત
૨,૫૧,૦૦૦	સાંસ્કૃતિક કાર્યક્રમ ઉદ્ઘાટક	(૨) ઉમિયા ભરોસે - હા. નરસિંહભાઈ ભાવાણી, સુરત
૨,૫૦,૦૦૦	કેપ	(૧) ઈશ્વર સો મીલ, હા. મગનભાઈ નાકરાણી, રાયપુર
૨,૫૦,૦૦૦	કેપ	(૨) વૃંદાવન સિરામિક્સ હા. ચંદુભાઈ પોકાર, મોરબી
૨,૫૦,૦૦૦	કેરી બેગ	(૧) શ્રી મહાવીર સો મીલ હા. રામજીભાઈ નાકરાણી, રાયપુર
૨,૫૦,૦૦૦	કેરી બેગ	(૨) શંકર વિજય ટ્રેડીંગ કંપની હા. લાલજીભાઈ ભાવાણી, સુરત
૧,૫૧,૦૦૦	મેઈન ગેટ - દેવાશિષ હોસ્પીટલ પાસે	શ્રી કરસનભાઈ લધાભાઈ દિવાણી, હૈદ્રાબાદ
૧,૫૧,૦૦૦	મેઈન ગેટ-બોર્ડીંગની મેઈન એન્ટ્રી	લાલજીભાઈ શીવજીભાઈ ભાવાણી, સુરત
૧,૧૧,૧૧૧	સહયોગી બપોરના ભોજનના દાતા	રતનબેન વિશ્રામભાઈ પટેલ સર્વોદય ટ્રસ્ટ, મુંબઈ
૧,૧૧,૧૧૧	સહયોગી બપોરના ભોજનના દાતા	સ્વ. લાલજીભાઈ કરસનભાઈ વેલાણી, દુર્ગાપુર
૧,૧૧,૧૧૧	સહયોગી બપોરના ભોજનના દાતા	વાલજીભાઈ ગોપાલભાઈ ભગત, બેંગલોર
૧,૦૧,૦૦૧	સહયોગી બપોરના ભોજનના દાતા	રતનબેન લાલજીભાઈ જાદવાણી, શહાડ (કલ્યાણ)
૧,૦૧,૦૦૧	સહયોગી બપોરના ભોજનના દાતા	લધાભાઈ મેઘજીભાઈ વાસાણી, મુંબઈ
૧,૦૧,૦૦૧	સહયોગી બપોરના ભોજનના દાતા	કંકુબેન કેસરાભાઈ રામાણી, હા. માવજીભાઈ રામાણી નખત્રાણા
૧,૦૧,૦૦૧	સહયોગી બપોરના ભોજનના દાતા	શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, દિલ્હી

આપણો સમાજ હિન્દુ ધર્મને વરેલો સનાતન સમાજ જ છે...

સનાતનીઓ તરફથી દેશભરમાં ચલાવવામાં આવી રહેલ જનજાગૃતિ અભિયાન અને કેન્દ્રીય સમાજને પાઠવવામાં આવેલ વિવિધ પત્રોને લઈ કેન્દ્રીય સમાજ પ્રથમ વખત જ બચાવની સ્થિતિમાં હોય તેવો માહોલ ખાસ સામાન્ય સભામાં જોવા મળ્યો હતો.

જો કે સુવર્ણ જયંતિ મહોત્સવ સમિતિના ચેરમેન શ્રી ગંગારામભાઈ સાંખલાએ સનાતનીઓની લાગણીને ધ્યાનમાં લઈ સભામાં એ બાબતનો ખાસ ઉલ્લેખ કર્યો હતો કે આપણો સમાજ હિન્દુ ધર્મને વરેલો સમાજ છે અને હિન્દુ ધર્મના જ આચાર-વિચાર પાળવા બંધાયેલો છે.

સમાજના નવા સભ્યો બનાવવા માટે કડક ધારાધોરણ અમલી બનાવવાની સનાતનીઓની માંગ અંગે પણ તેમણે ધરપત આપતાં જણાવેલ કે બંધારણમાં સંશોધન કરીને ખાસ સામાન્ય સભાની બહાલી મેળવી તે દિશામાં પણ યોગ્ય કરવામાં આવશે.

સભામાં ઉપસ્થિત મેદનીએ તેમની આ જાહેરાતને 'સનાતન ધર્મની જય', 'લક્ષ્મીનારાયણ ભગવાનની જય' ના નારાથી વધાવી લીધેલ.

ભારત ઝોન તથા રાજસ્થાન ઝોનના ઉપક્રમે દિલ્હી મુકામે તા. ૨૫, ૨૬, ૨૭ જાન્યુઆરીના જે કાર્યક્રમનું આયોજન થયેલ તેની માહિતી આપેલ. અને આવા કાર્યક્રમો દરેક ઝોનમાં થાય તેવી આપીલ કરેલ. આજની સભામાં જે દાતાઓએ દાનની સરવાણી વહેવડાવી તે સર્વે દાતાને ધન્યવાદ આપેલ અને જે દાતાઓ લેવાના બાકી છે તેમાં સમાજના સ્વર્ણિમ મહોત્સવમાં આર્થિક યોગદાન આપી દાતા તરીકે નોંધાવવા અપીલ કરેલ.

તાય ૭-૮-૨૦૦૯ના રોજ સામાન્ય સભામાં થયેલી રજુઆતથી ઉદ્દભવેલા પ્રશ્નોને ઉકેલવા સમાજ સતત પ્રયત્નશીલ છે. તા. ૧૩-૨-૨૦૧૦ના રોજ રાત્રે સનાતની ભાઈઓ તથા સમાજના

realpatidar.com

https://archive.org/details/bk1396/page/n15/mode/1up

realpatidar.com

નીચેના દાતાઓ લેવાના બાકી છે...

૧	ભોજનના દાતા...	મુખ્ય ત્રણ દિવસના દાતા	૫૧,૦૦,૦૦૦
		સહયોગી એક દિવસના દાતા	૧૧,૦૦,૦૦૦
		સહયોગી એકટંક સવારના દાતા (અનલીમીટેડ)	૨૫,૦૦૦
		સહયોગી એક ટંક બપોરના દાતા (અનલીમીટેડ)	૧,૦૧,૦૦૦
		સહયોગી એકટંક સાંજના દાતા (અનલીમીટેડ)	૫૧,૦૦૦
૨	સાઉંડ સિસ્ટમના દાતા		૨,૫૧,૦૦૦
૩	લાઈટ ડેકોરેશનના દાતા ૨,૫૧,૦૦૦x૫ દાતા લેવા (સમાજના બધા સંકુલો સુશોભીત કરવા)		૧૨,૫૫,૦૦૦
૪	મંડપના દાતા :	સભા મંડપ ડોમ સાથે (૫ લાખ x ૩ દાતા)	૧૫,૦૦,૦૦૦
		ભોજનાલય મંડપ (૨,૫૧,૦૦૦ x૩ દાતા)	૭,૫૦,૦૦૦
		અતિથિ વિશ્રામ મંડપ (૧,૫૧,૦૦૦ x૫ દાતા)	૭,૫૦,૦૦૦
૫	બિલ્લા સ્ટિકરના દાતા (૧,૫૧,૦૦૦ x૫ દાતા) નોંધ : નામ ફક્ત બેનરમાં આવશે.		૭,૫૫,૦૦૦
૬	મોમેન્ટોના દાતા (૨.૫ લાખના ૫ દાતા અથવા ૧૧ લાખના એક દાતા)		
	નોંધ : નામ ફક્ત બેનરમાં આવશે.		૧૧,૦૦,૦૦૦
૭	કેપના દાતા (૨.૫૦ લા x૨)		૫,૦૦,૦૦૦
૮	મેઈન ગેટના દાતા (૧.૫૧ લાખx૨ દાતા)	૧ ગેટ કોલેજ પાસે	૧,૫૧,૦૦૦
		૧ ગેટ વિરાણી રોડ	૧,૫૧,૦૦૦
૯	કમાની ગેટના દાતા (અનલીમીટેડ)		૧૫,૦૦૦

આગેવાનો સાથે થયેલ વિચાર વિમર્શમાં સમાજનો સુવર્ણ જયંતિ મહોત્સવ ધામધૂમથી આપણે સાથે મળીને ઉજવીશું તથા બંધારણમાં સુધારા-વધારા કરવાની ચર્ચામાં આપણે બંધારણ સુધારા સમિતિની રચના કરેલ છે તેમાં યોગ્ય સુધારા કરવા માટે આ સમિતિના સુચનો ઉપર અસામાન્ય સભામાં ચર્ચા વિચારણા કરી અંતે નિર્ણય લેવામાં આવશે તેવું ગંગારામભાઈ સાંખલાએ જણાવેલ.

અધ્યક્ષસ્થાનેથી બોલતાં કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી રામજીભાઈ નાકરાણીએ આજની સભામાં જ્ઞાતિજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિત જોઈ આનંદ વ્યક્ત કરેલ. સુવર્ણ જયંતિ મહોત્સવમાં આવતા વિવિધ ચડાવા તથા વિવિધ આઈટમોના દાતા તરીકે નામો નોંધાવેલ તેમને તથા નખત્રાણા કોલેજ માટે રૂા. ૫૧ લાખનું દાન આપનાર શ્રી રતિભાઈ મણીભાઈ રામાણી નખત્રાણા (મુંબઈ)ને ધન્યવાદ આપેલ. આપણે સૌ મળી સાંપ્રદાયિક મતભેદો મીટાવી સંગઠીત બની આપણો સુવર્ણ જયંતિ મહોત્સવ આનંદભેર ઉજવીએ એવી ભાવના પ્રમુખશ્રીએ વ્યક્ત કરેલ.

આગલા દિવસે તા. ૧૩-૨-૨૦૧૦ના સમાજની કારોબારી તથા સુવર્ણ જયંતિ મહોત્સવ આયોજન સમિતિની સંયુક્ત મિટિંગ મળેલ જેમાં દરેક થીમ આધારીત સમિતિઓએ અત્યાર સુધી થયેલ કામગીરીનો અહેવાલ આપેલ. જે અંગેની ચર્ચામાં દરેક ઝોનમાં થીમ આધારીત કાર્યક્રમો સત્વરે યોજવા ચેરમેન શ્રી ગંગારામભાઈ સાંખલા તરફથી અપીલ કરવામાં આવેલ.

સામાન્ય સભામાં દાતાઓના ચડાવા લેવા વખતે ટ્રસ્ટી શ્રી ગોપાલભાઈ પટેલ અને યુવા સંઘના મહામંત્રી ગૌરાંગ ધનાણીએ સમાજના દાતાઓને બરાબર પોરસ ચઢાવેલ જેના કારણે ધારણા કરતાં પણ મોટી રકમના દાતાઓ મળી જતાં સમગ્ર સભામાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયેલ. યુવા સંઘની ટીમે પણ સુંદર સહયોગ આપેલ.

સમાજમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ સાંપ્રદાયિક વિવાદના ઓછાયા તળે યોજાયેલ આ મહત્વપૂર્ણ સભામાં આયોજકોની ધારણા કરતાં પણ મોટી સંખ્યામાં મેદની ઉમટી પડતાં બેઠક વ્યવસ્થા સહિત અન્નપૂર્ણા ભવનમાં પણ થોડી વાર માટે અફડાતફડીનો માહોલ સર્જાયેલ ! વક્તાઓને આ મેદનીમાં ભલે સ્વર્ણિમ મહોત્સવ ઉજવણીનો ઉમંગ દેખાતો હતો પણ કોણ, શા માટે સભામાં આવ્યું હતું તે અંદરખાને બધા જ સમજતા હતા !

■ નિશુ : મમ્મી મારી કિંમત કેટલી છે?

મમ્મી લાડથી બોલી : બેટા તારી કિંમત તો કરોડો રૂપિયાની છે.

નિશુ : તો મમ્મી એ કરોડોમાંથી મને માત્ર પચાસ રૂપિયા જ જોઈએ છે.

realpatidar.com

https://archive.org/details/bk1396/page/n16/mode/1up

realpatidar.com

સુવર્ણ જયંતિ મહોત્સવ ૨૦૧૦
વિવિધ સમિતિઓના કન્વીનરોની યાદી

૧	મુખ્ય સંકલન સમિતિ	ગંગારામભાઈ હીરાલાલ સાંખલા	નવી દિલ્હી	૯૩૧૨૫૫૧૦૯૦
૨	સ્વાગત સમિતિ	રામજીભાઈ કરમશી નાકરાણી	રાયપુર	૯૪૨૫૨૦૮૮૦૨
૩	નાણા સમિતિ	લખમશીભાઈ નાયાભાઈ દિવાણી	કોલકાતા	૯૪૩૩૧૧૯૧૫૭
૪	કાર્યાલય સમિતિ	ઈશ્વરભાઈ માવજીભાઈ ભગત	નખત્રાણા	૯૪૨૯૮૦૯૦૩૩
૫	સ્વયંમ સેવક સમિતિ	જયસુખભાઈ હરજીભાઈ ડાયાણી	ધાવડા	૯૮૨૫૯૬૭૬૧૧
૬	અન્નપૂર્ણા સમિતિ	શ્રી અ.ભા.ક.ક. પાટીદાર યુવાસંઘ	નખત્રાણા	૯૪૨૮૩૦૬૫૬૫
૭	ભોજન વિતરણ વ્યવસ્થા	શામજીભાઈ રામજીભાઈ લીંબાણી	નખત્રાણા	૯૪૨૭૭૬૯૪૩૮
૮	નાણા ભંડોળ	મનસુખભાઈ વિશ્રામભાઈ રૂડાણી	અમદાવાદ	૯૩૨૭૦૧૩૩૯૦
૯	રાશન ખરીદ સમિતિ	ભગવાનભાઈ સામજીભાઈ ધોળુ	નાગલપર	૯૪૨૭૨૬૬૧૧૮
૧૦	આવાસ વ્યવસ્થા સમિતિ	રતીભાઈ અબજીભાઈ લીંબાણી	નખત્રાણા	૯૪૨૭૨૧૧૪૮૧
૧૧	પ્રચાર અને પ્રસાર સમિતિ	કલ્યાણજીભાઈ હીરજીભાઈ છાભૈયા	અમદાવાદ	૯૪૨૬૭૪૩૩૧૧
૧૨	મંડપ લાઈટ ડેકોરેશન સમિતિ	શ્રી અ.ભા.ક.ક.પાટીદાર યુવાસંઘ	નખત્રાણા	૯૪૨૮૩૦૬૫૬૫
૧૩	વાહન વ્યવહાર સમિતિ	સુરેશભાઈ ઈશ્વરભાઈ કાનજીયાણી	વિરાણી મોટી	૯૪૨૭૨૭૩૯૮૫
૧૪	પાણી પુરવઠા સમિતિ	કરસનભાઈ વેલજીભાઈ લીંબાણી	નખત્રાણા	૯૪૨૭૨૫૦૫૧૩
૧૫	આરોગ્ય સમિતિ	ડૉ. પી. જી. પટેલ	નખત્રાણા	૨૮૩૫૨૨૨૧૦૩
૧૬	સ્ટેજ વ્યવસ્થા સમિતિ	કેશુભાઈ ધનજીભાઈ પારસીયા	ભુજ	૯૮૨૫૨૧૧૯૪૯
૧૭	સ્ટેજ સંચાલન સમિતિ	મોહનભાઈ શીવજીભાઈ ધોળુ	નાગલપર	૯૮૨૫૭૭૪૭૭૦
૧૮	સાંસ્કૃતિક સમિતિ	નરસિંહભાઈ દેવજીભાઈ ભાવાણી	સુરત	૯૮૨૫૨૭૦૭૭૯
૧૯	મહોત્સવ સુશોભન સમિતિ	રમેશભાઈ બાબુભાઈ ધોળુ (એડવોકેટ)	નાગલપર	૯૮૨૫૦૫૬૫૧૮
૨૦	સફાઈ સમિતિ	રવીલાલ નારણભાઈ વાલાણી	વેરસલપર	૯૯૦૯૭૨૬૧૯૫
૨૧	સલામતિ સમિતિ	લધારામભાઈ અબજીભાઈ લીંબાણી	આણંદસર	૯૪૨૭૦૩૨૧૯૧
૨૨	સન્માન કાર્યક્રમ વ્યવસ્થા સમિતિ	જયેશભાઈ સોમજીભાઈ છાભૈયા	ભુજ	૯૮૨૫૧૧૨૬૪૩
૨૩	પ્રતિભા શોધ/વડીલોના સન્માન મોમેન્ટો સમિતિ	નરસિંહભાઈ નારણભાઈ સાંખલા	અમદાવાદ	૯૮૨૫૦૪૩૦૩૩
૨૪	કાઉન્ટર કલેક્શન સમિતિ	લાલજીભાઈ હંસરાજભાઈ રામાણી	નખત્રાણા	૯૪૨૭૪૫૦૫૯૯
૨૫	પુછપરછ (ઈન્કવાઈરી) સમિતિ	માવજીભાઈ કેસરાભાઈ ભગત	ભુજ	૯૮૨૫૨૬૭૯૩૪
૨૬	મહિલા સ્વયંમ સેવક સમિતિ	સોનલબેન ઈશ્વરભાઈ સેઠીયા	નખત્રાણા	૯૪૨૭૨૫૦૦૩૫
૨૭	સ્ટોર સમિતિ	ભીમજીભાઈ હંસરાજભાઈ રામાણી	નખત્રાણા	૯૪૨૭૨૫૦૬૪૪
૨૮	વિષય વિચારણી સમિતિ	કાંતીલાલ વાલજી રામાણી	કોટડા(જ)	૯૪૨૭૨૮૮૫૬૬
૨૯	પાર્કીંગ વ્યવસ્થા સમિતિ	હીરાલાલ જેઠાભાઈ નાકરાણી	વિથોણ	૯૪૨૫૭૪૮૩૦૨
૩૦	રજીસ્ટ્રેશન અને રીઝર્વેશન	શ્રી અ.ભા.ક.ક. પાટીદાર યુવાસંઘ	નખત્રાણા	૯૪૨૮૩૦૬૫૬૫

વાસાણી-જબુઆણી-માવાણી પરિવારની જનરલ મિટિંગ દુજાપરમાં યોજાઈ

રવાપર : વાસાણી, જબુઆણી, માવાણી પરિવારની જનરલ મિટિંગ તા. ૧૭-૧-૧૦ના દુજાપર (વડવા) મુકામે અરજણભાઈના પ્રમુખસ્થાને મળેલ જેમાં મોટી સંખ્યામાં પરિવારના ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

દેશ-પરદેશથી આવેલ ભાઈઓને રવાપરવાળા લાલજીભાઈ વાસાણીએ આવકાર્યા હતા. ત્રણે પરિવારના પિતૃદેવ એકજ સ્થાને હોતાં સંપ-સલાહથી કામ આગળ ધપાવવા અને કામ પૂર્ણ થતાં મહોત્સવની તારીખ નક્કી કરવાનું મિટિંગમાં ઠરાવવામાં આવેલ.

નાસીકથી આવેલ રવજીબાપાએ પિતૃદેવની શક્તિ અંગે બધાને ખ્યાલ આપેલ. જયંતિભાઈ (મુંબઈ), વાલજીભાઈ (વાપી), યુવા સંઘના પ્રમુખ શ્રી દામજીભાઈ વગેરેએ પ્રાસંગિક પ્રવચન કરેલ. સભાનું સંચાલન વડવાવાળા જયંતિભાઈએ કરેલ. બપોરનું ભોજન લઈ સર્વે છુટા પડેલ.

realpatidar.com

https://archive.org/details/bk1396/page/n17/mode/1up

https://archive.org/details/bk1396/page/n18/mode/1up

realpatidar.com

ગુજરાત ટીમ્બર મરચન્ટસ ફેડરેશનની બેઠકમાં અનુરોધ

સો મીલો ચાલુ કરાવી દીધી, હવે નર્સરી બાબતે પણ ધ્યાન આપો...

ગુજરાત ટીમ્બર મરચન્ટસ ફેડરેશનની કાર્યવાહક સમિતિની મિટિંગ ફેડરેશનની ઓફિસ, અમદાવાદ ખાતે તા. ૨-૨-૨૦૧૦ મંગળવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે મળી હતી. આ મિટિંગમાં ફેડરેશનના હોદ્દેદારો તથા કાર્યવાહક સમિતિના સભ્યો તથા પેટા સમિતિના સભ્યો અને માજીપ્રમુખશ્રીઓ હાજર રહ્યા હતા.

આ મિટિંગમાં ગત મિટિંગની મિનિટસ મંજુર કરવામાં આવી હતી તથા નવા સભ્યોને દાખલ કરવા ઉપરાંત ૧૧-૨૦૦૯ થી જાન્યુઆરી-૨૦૧૦ સુધીના ત્રણ માસના આવક ખર્ચની વિગતો જણાવી, થયેલ ખર્ચને સમિતિ દ્વારા મંજુર રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ નીચે જણાવ્યા પ્રમાણેના મુદ્દા અંગે ચર્ચા થઈ હતી.

પ્રમુખશ્રી ભાણજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણા સભ્યોના ફોરેસ્ટના પ્રશ્નો જેવા કે સોમીલનું સ્થળફેર-નામફેર તથા અન્ય ફોરેસ્ટના મુદ્દાની કાર્યવાહી ઝડપથી થાય તે માટે ગત મિટિંગમાં એક લીગલ એડવાઈઝરની નિમણૂંક કરવા નક્કી થયેલ. આમ શ્રી એચ.એચ. મજમૂદાર (એડવોકેટ)ની એડહોક નિમણુંક કરેલ છે. શ્રી મજમુદાર એડવોકેટ મિટિંગમાં હાજર રહ્યા હતા. આ એડવોકેટ બાબતે સુરતના સભ્યશ્રી કાંતિભાઈએ પરિચય કરાવ્યો હતો અને જણાવ્યું હતું કે તેમને ફોરેસ્ટના કાયદાનું જ્ઞાન છે અને તેઓએ એડવોકેટ તરીકે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરેલ છે. શ્રી મજમુદાર એડવોકેટે પણ સ્વ પરિચય આપ્યો હતો અને તેમણે કરેલ કામગીરીનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેઓએ ફોરેસ્ટ વિભાગમાં ૩૦ વર્ષ સુધી કાયદાનું કાર્ય કરેલ છે. હાલમાં ફેડરેશનના સભ્યોના જે પ્રશ્નો છે, તેની વિગતો ફેડરેશનની ઓફિસમાંથી મેળવીને આગળની કાર્યવાહી જારી છે. તેમણે આગળ જણાવ્યું હતું કે ફોરેસ્ટ કાયદાના વહીવટમાં જે ત્રુટીઓ છે તે સરકારના ધ્યાન પર લાવવી જરૂરી છે અને તે માટે તેઓ પ્રયત્ન કરશે.

પ્રમુખશ્રીએ આગળ જણાવ્યું હતું કે શ્રી મજમુદાર એડવોકેટને મહિનામાં ૨ (બે) દિવસ એટલે કે પહેલી અને ૧૫ (પંદર) તારીખે (રજા હોય તો બીજા દિવસે) ફેડરેશનની ઓફિસમાં આવીને કામગીરી કરવા જણાવેલ છે અને જે કોઈ સભ્યને ફોરેસ્ટનો કોઈ પ્રશ્ન હોય કે સલાહ લેવાની હોય તો તેઓ નિયત તારીખે ઓફિસમાં આવીને સલાહ સૂચનો લઈ શકશે અને જરૂરી માર્ગદર્શન પણ મેળવી શકશે. હાજર સૌ સભ્યોને આ બાબત ફેડરેશનના સભ્યોના ધ્યાન પર લાવવા જણાવ્યું હતું. પ્રમુખશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે હોદ્દેદારો વન સંરક્ષકશ્રી તેમજ અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રીને તા. ૨૯-૧૧-૦૯ના રોજ મળ્યા હતા અને રજૂઆતો કરીને જણાવ્યું હતું કે માલિકી અને જગા બંને ટ્રાન્સફર થઈ શકે છે. જવાબમાં વન વિભાગ દ્વારા જણાવાયું હતું કે સી.ઈ.સી.એ તા. ૩-૨-૨૦૧૦ના રોજ દિલ્હી ખાતે મિટિંગ રાખેલ છે અને ત્યાંથી આવ્યા બાદ પેન્ડીંગ કેસોનો નિકાલ કરીશું. આ સી.ઈ.ઓ.ની મિટિંગમાં ફેડરેશનના હોદ્દેદારો, સભ્યો પણ જઈ રહ્યા છે તેમ જણાવાયું હતું.

આ સી.ઈ.ઓ.ની મિટિંગમાં ખાસ મુદ્દો ગ્રોઈંગ સ્ટોક અંગેનો છે જેનો રીપોર્ટ રાજ્ય સરકારે સી.ઈ.ઓ.ને મોકલી આપેલ છે. અન્ય ફોરેસ્ટને લગતા પ્રશ્નો અંગેની ચર્ચામાં, કમિટિને સત્તા હોવી જોઈએ અને આવી કમિટિમાં ફેડરેશનના એક પ્રતિનિધિનો સમાવેશ કરવો જોઈએ. જો જરૂરી સત્તા આવી કમિટિને આપવામાં આવે તો સી.ઈ.ઓ. સમક્ષ રજૂઆતો કરવી ન પડે અને સી.ઈ.ઓ. સમક્ષ વારંવાર જવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય નહિ.

ગ્રોઈંગ સ્ટૉક બાબતમાં અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી ખન્ના સાહેબશ્રી સાથે ફેડરેશનના હોદ્દેદારોએ ચર્ચા વિચારણા કરી હતી ત્યારે તેઓશ્રીએ જણાવેલ કે સોમીલો ચાલુ કરાવી દીધી છે પરંતુ ફેડરેશને કોઈ નક્કર કામ બતાવેલ નથી. તેઓનું સૂચન નર્સરી અંગે શું કાર્યવાહી થઈ છે તે જાણવા માટેનો પ્રયત્ન હતો. તેઓએ આ મુદ્દે ખાસ ભાર મૂકીને ફેડરેશન કોઈ નક્કર કાર્યવાહી કરી બતાવે તેવી અપેક્ષા હતી.

આ ચર્ચાના સંદર્ભમાં પ્રમુખશ્રીએ સમિતિને જણાવેલ કે દરેક જિલ્લા લેવલે વૃક્ષારોપણની કામગીરી બતાવવી પડશે અને નર્સરી અંગે પણ ફેડરેશને ગંભીરતાપૂર્વક વિચારવાનું રહે છે. આ બાબતમાં સભ્યોના અભિપ્રાય માંગવામાં આવ્યા હતા. હાજર રહેલ સભ્યશ્રી વલ્લભભાઈ પટેલ (અંકલેશ્વર), શ્રી કાંતિભાઈ (સુરત), શ્રી જયંતિભાઈ (પણસોરા), શ્રી રવજીભાઈ (નંદાસણ), શ્રી બાબુભાઈ માકાણી (અમદાવાદ), શ્રી પરસોત્તમભાઈ પટેલ (નડિયાદ), શ્રી નારણભાઈ વી. પટેલ (વડોદરા), શ્રી ગૌરાંગભાઈ (સુરત), શ્રી રવિન્દ્રભાઈ પટેલ (નડીયાદ), શ્રી મગનભાઈ પટેલ (બારડોલી), માજીપ્રમુખ શ્રી વિશ્રામભાઈ પટેલ (અમદાવાદ), શ્રી જયંતિભાઈ લાકડાવાલા (ફોરેસ્ટ સમિતિ કન્વીનરશ્રી, અમદાવાદ) વિગેરેએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

બધા જ સભ્યોનો એક સૂર હતો કે નર્સરી અંગેનું કામ ઉપાડી લેવું જોઈએ. આ નર્સરીનું કામ ઘણું જ અઘરું (કઠીન) છે અને કોઈ એકલા હાથે કરી શકે નહિ. આ અંગેના સૂચનોમાં પ્રથમ જમીનની

realpatidar.com

https://archive.org/details/bk1396/page/n19/mode/1up

realpatidar.com

જરૂરિયાત રહે. જમીન માટે માનનીય વન મંત્રીગ્રી, વન વિભાગને સાથે રાખી મહેસૂલ વિભાગમાં માનનીય મંત્રીશ્રીને મળવું જોઈએ. જો સુવ્યવસ્થિત નર્સરી બનાવવી હોય તો રૂા. ૧ કરોડ જેટલું ફંડ એકત્રીત કરવું પડે. આવા ફંડ માટે સંસ્થા / કો.ઓ. સોસાયટી / મંડળી / એન.જી.ઓ. પ્રથમ ઊભી કરવી પડે અને ત્યારબાદ રજીસ્ટ્રેશન કરાવીને આગળની કાર્યવાહી વિચારી શકાય. ફંડ ઉપલબ્ધી માટે શેર ફાળો નક્કી કરવો પડે અને આવા રોકાણો માટે સભ્યોને / અન્યને સમજણ આપવી પડે. પ્રાઈવેટ શેર બહાર પાડીને, શેર હોલ્ડર લઈને આ કાર્યવાહી આગળ ધપાવવી જોઈએ તેવું સર્વાનુમતે નક્કી કરવામાં આવેલ. આવી સંસ્થા ફેડરેશન પ્રેરીત અથવા ફેડરેશનના સહયોગથી જ ચલાવવી જોઈએ. આમાં જે ઈન્વેસ્ટમેન્ટ થાય તે સ્વેચ્છાએ કરવું પડે અને તેની સામે નફા-નુકસાન અંગે કોઈ વિચાર કરવો ન જોઈએ.

આ સંદર્ભમાં પ્રથમ એક કમીટી બનાવવી જોઈએ અને કમીટી બનાવવા માટે હોદ્દેદારો નિર્ણય લેશે તેમ નક્કી થયું હતું. આ કમીટી દરેક જિલ્લામાં જઈને એસોસીએશન / સભ્યોને જરૂરી સમજણ આપે. એસોસીએશન પણ તેમના જિલ્લામાં મિટિંગ કરે અને ફેડરેશનની જે કામગીરી થઈ છે તેની સભ્યોને જરૂરી અને યોગ્ય માહિતી આપે.

પ્રમુખશ્રીએ આ ચર્ચાનું સમાપન કરતાં જણાવ્યું હતું કે નર્સરી બનાવવા અંગે સૈધાંતિક સ્વીકાર કરીએ છીએ અને સો ટકા આગળ વધીશું. આપણે ફેડરેશનની ઈમેજ સુધારવાની છે અને લાકડા કાપવાવાળા નહિ પણ લાકડુ વાવવાવાળા છીએ તેમ કરી બતાવવાનું રહે છે.

ફેડરેશન ઓફ ઓલ ઈન્ડીયા ટીમ્બર મરચન્ટસ, સોમીલ ઓનર્સ એન્ડ એલાઈડ ઈન્ડસ્ટ્રીઝની તા. ૨૩,૨૪-૧-૨૦૧૦ના રોજ જયપુર ખાતે મળેલ મિટિંગમાં ફેડરેશનના હોદ્દેદારો / સભ્યને ઉપસ્થિત રહેવા આમંત્રણ હોઈ તેઓ હાજર રહ્યા હતા. આ મિટિંગમાં જે કાર્યવાહી થઈ હતી તેની આછી માહિતી ફોરેસ્ટ સમિતિના કન્વીનરશ્રી જયંતિભાઈ લાકડાવાલાએ સભ્યોને આપી હતી. આ મિટિંગમાં ખાસ મુદ્દો ટી.ડી.એસ. (ટેક્ષ ડીડકટેડ એટ સોર્સ) અંગે ચર્ચવામાં આવ્યો હતો. આ ટેક્ષ શું છે તેની માહિતી માનદ્મંત્રીશ્રી જયંતિભાઈ પટેલે આપી હતી. આ ટેક્ષ કાઢી નાખવો જોઈએ તેવી માંગણી છે આ બાબતમાં સારો એવો ખર્ચ કરવો પડે અને ગુજરાતે તેમાં ૩૦ ટકા શેર આપવો પડશે. કંડલા ટીમ્બર એસોસીએશનએ પણ સહકાર આપવા જણાવેલ છે, તેમ શ્રી જયંતિભાઈ લાકડાવાલાએ જણાવ્યું હતું.

અન્ય મુદ્દા - સોમીલ રૂલ્સ માટે ત્યાં હાજર રહેલ અન્ય રાજ્યના સભ્યોએ એવું મંતવ્ય આપેલ કે સોમીલ રૂલ્સ માટે એક સરખી પોલીસી હોવી જોઈએ. રાજ્ય પોતાની રીતે હિતમાં આવા સોમીલ રૂલ્સ બનાવે છે પરંતુ બધા જ રાજ્યો માટે સોમીલ રૂલ્સ સરખા હોવા જોઈએ.

જયપુર ટીમ્બર મરચન્ટસ એસોસીએશને આ મિટિંગ માટેનું વ્યવસ્થિત આયોજન કરેલ અને આગતા સ્વાગતા પણ સુંદર પ્રકારે કરવામાં આવી હતી તેમ મિટિંગમાં હાજર રહેલ શ્રી જયંતિભાઈ લાકડાવાલાએ જણાવ્યું હતું.

ફેડરેશનના ફંડ રેઈઝીંગને મુદ્દે ચર્ચા થઈ હતી. અમુક સભ્યોનું કહેવું હતું કે ફેડરેશનનો આદેશ થાય ત્યારે ફોલોઅપ કરવું જોઈએ. હજુ સુધી જરૂરી ભંડોળ બાકીના સભ્યો પાસેથી પ્રાપ્ત થયેલ નથી. તો જે તે જિલ્લા / તાલુકા / વિભાગમાં રૂબરૂ જઈ ભંડોળ એકત્રીત કરવું જોઈએ અને હવે આ ભંડોળ એક મહિનામાં જ ફેડરેશનમાં જમા થાય તેવી ચીવટ અને કાર્યવાહી જરૂરી છે તેમ પ્રમુખશ્રી / માનદ્મંત્રીશ્રી દ્વારા જણાવાયું હતું.

કમીટી સમક્ષ પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ તરફથી સુરત ખાતે યુવા ઓલિમ્પીયાડ-૨૦૧૦ના કાર્યક્રમનું જે આયોજન થયેલ તે માટે અમુક ફંડની અપેક્ષા રાખેલ. જે ફંડ મંજુર થયે આપવાનું થશે તો તેવું ફંડ હોદ્દેદારો આપશે તેને સમિતિએ મંજુર રાખ્યું હતું.

માનદ્મંત્રીશ્રીએ સભ્યોને જણાવેલ કે સોમીલ સ્થળફેર / નામફેરના જે કેસો ફેડરેશનને મળેલા હતા તેનું સંકલન કરીને જરૂરી પત્રકો બનાવીને લાગતા વળગતા વન સંરક્ષકશ્રીને અથવા નાયબ વન સંરક્ષકશ્રીને મોકલી આપવામાં આવ્યા છે. જેથી કોઈ કામગીરી બાકી રહેલ છે તેની વિગતો જાણી શકાય. આ પત્રના ઉત્તરો પણ મળવા લાગ્યા છે. કચ્છ અને અમદાવાદ વિભાગ તરફથી થયેલ કાર્યવાહીની ફેડરેશનને જાણ કરવામાં આવી છે તેમ માનદ્મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

નડિયાદ સોમીલ ઓનર્સ એસોસીએશન તરફથી તા. ૧૧-૨-૨૦૧૦ના રોજ નડિયાદ મુકામે સ્વર્ણિમ સંગઠન મહોત્સવનું આયોજન કરેલ છે, તે બાબતે નડિયાદના સભ્યશ્રી રવિન્દ્રભાઈ પટેલે બધા જ સભ્યોને છાપેલ આમંત્રણ પત્રિકા રૂબરૂમાં આપી હતી અનો નડિયાદના સભ્યશ્રી પરસોત્તમભાઈ ડી. પટેલે બધા જ સભ્યોને ઉપસ્થિત રહેવા રૂબરૂ આમંત્રણ પણ આપેલ. ફેડરેશનના પ્રમુખશ્રીએ પણ આ સંગઠન મહોત્સવમાં મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહે તેવી વિનંતી કરી હતી.

ત્યારબાદ મિટિંગ અંગેની કોઈ કાર્યવાહી બાકી ન હોઈ ઉપપ્રમુખશ્રી પ્રવિણભાઈ પટેલે ટૂંકુ ઉદ્દબોધન કરી, સમય ફાળવી સભ્યો હાજર રહ્યા તેમજ મિટિંગની કાર્યવાહી શાંતીપૂર્વક સાંભળી તથા ચર્ચામાં જરૂરી ભાગ લેવા બદલ આભાર વ્યક્ત કરી આજની મિટિંગ પુરી થયેલી જાહેર કરી હતી.

આશા એ જાગતા માણસનું સ્વપ્ન છે.
- સોક્રેટીસ

realpatidar.com

https://archive.org/details/bk1396/page/n20/mode/1up

realpatidar.com

કચ્છ-ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકોએ શ્રધ્ધાંજલિ આપી

સંત શ્રી ગુરુકૃપાદાસજી મહારાજ હિમાલયમાં સાધના કરતા મહાજ્યોતમાં સમાયા

કચ્છ-ગુજરાતના એક મહાન તપસ્વી સંત બાપુજી તરીકે ઓળખાતા હિમાલયની ગોદમાં ગંગામૈયાના તટ પર સતત ૪૦ વર્ષથી તપસ્યા કરી રહ્યા હતા. તેમની વિદાયે ભક્તજનોને હલાવી દીધા છે. પૂ. બાપુજીને જાણે હિમાલયે અને ગંગામૈયાએ પોતાની ગોદમાં સમાવી લીધા.

સંતશ્રી રામદેવી માતાજીની હાજરી હતી. માઘ સ્નાન, કુંભ સ્નાન અને પૂર્ણિમાનું સ્નાન આમ ગંગાજીમાં ત્રિવેણી સ્નાન કરી સપ્ત સરોવર હરિદ્વારમાં ગંગા તટ પર સંતશ્રી રમાદેવીના હસ્તે હજારો ભક્તો અને સંતો મળી તા. ૧-૧-૨૦૧૦ના પંચ ભૌતિક શરીર વિલીન કર્યું હતું.

પૂ. બાપુજીની બે ઈચ્છાઓ હતી. હરિદ્વારમાં જ ગંગા તટ મારું શરીર છૂટે અને હું મારી વ્યક્તિગત સેવા ન કરાવું. આ બંને ઈચ્છાઓ ગંગામૈયાએ પૂરી કરી અંત સમયે પોતાની બધી ક્રિયાઓ પોતાની જાતે કરી અને પદ્માસન લગાવી સમાધીમાં લીન થઈ દેહ છોડ્યો. પૃથ્વી પર એવી ખોટ પડી મહાન તપસ્વી સંત જ્યારે વિદાય લીધી ત્યારે જાણે પ્રકૃતિ પણ રૂદન કરતી હતી.

બ્રહ્મલીન બાબા ગુરુકૃપા દાસજી મહારાજ (બાપુજી)ને શ્રધ્ધાંજલિ આપવા તા. ૧૬-૧-૨૦૧૦ ષોડસીના હજારો સંતો અને ભક્તો આવ્યા હતા. બાપુ ગુરુકૃપાદાસ મહારાજનું પૂર્વાશ્રમનું નામ નાથુરામ ભગત (બાપુજી) હતું.

બ્રહ્મલીન બાબા ગુરુકૃપાદાસ મહારાજને શ્રધ્ધાસુમન અર્પણ કરતા નિવૃત્ત શંકરાચાર્ય ભારત માતા મંદિરના સંસ્થાપક મહા મંડલેશ્વર સત્યમિત્રાનંદ મહારાજે કહ્યું કે, બાબા ગુરુકૃપાદાસ તપસ્વી સંત હતા. જેણે ૪૦ વર્ષ સુધી નિયમિત ગંગા પૂજન સ્નાન કરી ધર્મ અને આધ્યાત્મની સેવા

હરીદ્વારમાં યોજાયેલ શ્રધ્ધાંજલિ સમારોહમાં ઉપસ્થિત સંત-સમુદાય

કરતા મન, વાણી અને કર્મને સમાજ સેવામાં અર્પણ કર્યા. એમના તપોબળના જ પરિણામથી ગંગા પૂજા કરી શરીરનો પરિત્યાગ કર્યો અને એમણે બધા ભક્તોને આહવાન કરતા કહ્યું કે, પૂ. ગુરુદેવના બતાવેલ માર્ગ પર ચાલવા જણાવ્યું હતું.

પૂ. ભાવેશદાસ બાપુ ગુરુકૃપાદાસના 'સંત' જીવન પર પ્રકાશ કરતા કહ્યું કે, કચ્છી આશ્રમના સંસ્થાપક સંત ઓધવરામ મહારાજની પ્રેરણાથી વીસ વર્ષની આયુમાં દીક્ષા લઈ ધર્મ - સેવાનો શુભારંભ કર્યો અને સપ્ત સરોવર ક્ષેત્રમાં તે પહેલા સંત હતા જે નિમયિત ગંગાજીની સેવા કરતા હતા.

પૂ. વિરક્ત મંડળીના મંડલેશ્વર શ્રી સ્વામી ભાગવતાનંદ મહારાજે કહ્યું કે પૂ. બાપુ તપસ્વી ગુપ્ત સંત હતા. શાંત અને ઓછું બોલતા અને સંતોની જાતે સેવા કરતા. ગંગાજી અને સંતો પ્રતિ અપાર નિષ્ઠા હતી.

શ્રી ગુરુકૃપા કુટિરના પરમાધ્યક્ષ સંત શ્રી રમાદેવી માતાજીએ બાપુને ભક્તવત્સલ સંત બતાવતા કહ્યું કે, તે ભક્તો અને સંતોને ભગવાનનું સ્વરૂપ માની આજીવન એની સુવિધા ઉપલબ્ધ કરવામાં પ્રયત્નશીલ રહ્યા. બાપુનું જીવન જ પ્રેરણાદાયક હતું. સેવા, મૌન રહેવું અને નામ સ્મરણ (જપ) આ એમના મુખ્ય આચરણો હતા. પૂ. બાપુના તો જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા પડે.

પૂ. મહામંડલેશ્વર હરિચેતનાનંદ મહારાજે કહ્યું કે, પૂ. બાપુજી એટલા નિરાભીમાનો હતા. આટલા મહાન હોવા

realpatidar.com

https://archive.org/details/bk1396/page/n21/mode/1up

2010-03 -Patidar Saurabh (1396)

realpatidar.com

છતાં સાધુ જીવન જીવતા.

પૂ. ઓધવરામ મહારાજનો પૂ. બાપુજી ગુરુકૃપાદાસ મહારાજે ઘણા સત્સંગ કર્યા હતા. પૂ. વાલરામ મહારાજ તથા પૂ. યશોદામાની સાથે તો સતત સત્સંગ કર્યો હતો અને પૂ. હરિદાસજી મહારાજની સાથે પણ અત્યાર સુધી અવાર-નવાર સત્સંગ કરતા.

પૂ. બાપુજીએ હરિદ્વારના પંચ કુંભ સ્નાન કર્યા. પ્રથમ ૧૯૬૨માં, બીજું ૧૯૭૪, ત્રીજું ૧૯૮૬, ચોથું ૧૯૯૮, પાંચમું ૨૦૧૦માં કુંભ સ્નાન કરી અને વિદાય લીધી. આવા યુગ પુરુષને પુરા ગુજરાત કચ્છ હિમાલયના કોટી કોટી પ્રણામ તથા શ્રધ્ધાસુમન તેમના ચરણોમાં અર્પણ કર્યા હતા.

સાધ્વી ભક્તિદેવી સ્વામી રામાનંદજી સુ. શ્રી ભારતીદીદી, સ્વામી લલીતાનંદજી તેમજ લક્ષ્મણભાઈ રતિભાઈ, ધનારામભાઈ, દયારામભાઈ, કવિભાઈ, મનુભાઈ, દામોદરભાઈ, અમૃતભાઈ, છગનભાઈ તથા અન્ય ભાઈઓએ શ્રધ્ધાસુમન પૂ. બાપુ ગુરુકૃપાદાસ મહારાજના ચરણોમાં અર્પણ કર્યા હતા.

કલોલના સમૂહલગ્નમાં ૨૪ નવયુગલો જોડાયા

ગાંધીનગર - મહેસાણા જિલ્લા કચ્છ કડવા પાટીદાર સમાજ સમૂહલગ્ન આયોજન સમિતિ દ્વારા વસંત પંચમીના કલોલ મુકામે યોજાયેલ નવમા સમૂહલગ્નોત્સવમાં ૨૪ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.

આયોજન સમિતિના પ્રમુખ શ્રી નાનજીભાઈ હળપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ સત્કાર સમારોહમાં કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખ શ્રી મનસુખભાઈ રૂડાણી, યુવા સંઘના પ્રમુખ શ્રી જયંતિલાલ લાકડાવાળા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવદંપતિઓને આશીર્વચન આપવા સાથે દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

નોટરી બનતા ભૂપેન્દ્ર પોકાર

નરોડા ખાતે છેલ્લા ૧૯ વરસથી વકીલાતનો વ્યવસાય કરતા ભૂપેન્દ્ર ડી. પટેલની ગુજરાત સરકારે નોટરી તરીકે નિમણુંક કરી છે.

નરોડા નવયુગ યુવક મંડળના માનદ્‌મંત્રી તરીકે સેવા આપતા ભૂપેન્દ્રભાઈ પટેલ પત્રકાર પણ છે અને ઘરેલુ હિંસાથી સ્ત્રીઓને રક્ષણ આપવા અંગેનો કાયદો ૨૦૦૫ વિશે તેમણે પુસ્તક પણ બહાર પાડેલ છે. ભારતના બંધારણ અંગે તેઓ હાલમાં સંશોધન કરી રહ્યા છે.

સાંગલીના સમૂહલગ્નમાં જોડાતાં ચાર નવયુગલો

સાંગલી-મીરજ પાટીદાર સમાજ દ્વારા વસંતપંચમીના યોજાયેલ ૧૦મા સમૂહલગ્ન સમારોહમાં ચાર નવયુગલો જોડાયા હતા. સાંગલી મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી જેઠીબેન વાઘડિયા તેમજ સમાજના મહામંત્રી રતિલાલ મનજી સાંખલાએ નવદંપતિઓને આશીર્વચન આપ્યા હતા. દાતાઓ તરફથી કન્યાઓને વિવિધ ભેટ-સોગાદો આપવામાં આવી હતી.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1396/page/n22/mode/1up

realpatidar.com

॥ શ્રી ઉમિયાયે નમઃ ॥

આગોતરાં આમંત્રણ

વ્હાલા જ્ઞાતિજનો,

"ભાઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું" કવિ દાદની માર્મીક કલમે લખાયેલ આ ભજનને મમળાવીએ તો જગતને બહુ જ મોટો સંદેશ આપી જાય છે. એમ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને કેટલાક આયામો આનુવાંશિક રીતે પ્રાપ્ત થતાં જ રહ્યા છે. ભારત વર્ષના ઈતિહાસમાં ડોકીયું કરીએ તો આ સમાજનો અતિત કેટલીક બાબતોમાં અતિ ઉજળો છે. આ બધું જ ઘડતર વિના સંસ્કારીકતા અને આધ્યાત્મીક વિના શક્ય જ નથી.

સમાજના પચાસ વર્ષનો આ પડાવ સ્વર્ણિમ વર્ષ તરીકે આપણે સૌ ઉજવી રહ્યા છીએ. આ પડાવ થકી આપણું સાર્વભૌમત્વ ઉભું કરવાની નેમ આપણા વડીલો એ ઘડી, સમાજ તમામ દિશાએથી મજબૂત બને તેવી કલ્પના કંડારવામાં આવી છે. ઊંચી કલ્પનાની ઉડાન વડે માનવી તમામ ક્ષિતિજોને પાર કરી શકે છે. જેમ ૨૦૦૭ના બિઝનેસ સેમિનારના ઘડતર વડે સમાજમાં આર્થિક વાઈબ્રેશન (સ્પંદન) ઉભું થયું, સમગ્ર સમાજ આર્થિક રીતે જેટ ગતિએ ઊંચે જવા થનગની રહ્યો છે.

બસ, આવી જ કોઈ વિચારધારા વડે સ્વર્ણિમ પર્વના પડાવથી આપણે પોતાનું ગામ નહિ, શહેર નહિ, અરે.... રાજ્યથી બહાર દેશ-વિદેશમાં ઓળખ ઉભી કરી, લોક જીભે રમતું થાય તેવા વિદ્વાનો, વૈજ્ઞાનિકો, ઔદ્યોગીક સાહસવીરો, સંગીતકારો, રમતવીરો, રાજશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, રાજનેતા, વહીવટીય ઉચ્ચ અધિકારી જેવાં વિરલ રાષ્ટ્રીય ફલકની સનિષ્ઠ પ્રતિભાઓને જોવાનું સ્વપ્ન આ સમાજ જોઈ રહેલ છે.

આ પ્રસંગે અંતિમ તબ્બકાના કાર્યક્રમો નવીન રીતે અનોખા અંદાજથી ઉજવાય તે માટે સમાજના વડીલોએ કમર કસી છે તેમાં ભળ્યો છે આપ સૌ જ્ઞાતિજનોનો અદકેરો ઉત્સાહ.....

આ સ્વર્ણિમ મહોત્સવ જાજરમાન રીતે ઉજવવાનો પડકાર આપણી સામે છે. આ પડકાર યુધ્ધ નથી પણ યજ્ઞ છે, "અશ્વમેઘ યજ્ઞ" આપણે સૌએ શક્તિ પ્રમાણે યોગદાન આપીને આ યજ્ઞને દિગ્વીજયમાં પરિવર્તીત કરવાનો છે. આપણા સૌનું હીર બતાવવાનો અનમોલ મોકો આ સ્વર્ણિમ મહોત્સવ રૂપે ખમીરવંતી જ્ઞાતિને ખમીર બતાવવાનો રૂડો અવસર સાંપડ્યો છે.

આવો આપણે સૌ સાથે મળીને આપણા સ્વર્ણિમ મહોત્સવને યુગ મહોત્સવ તરીકે સ્થાપિત કરીએ. તો *"હાલો ભેરૂ પાંજે કચ્છડે પાંજા મલકમાં"* ચાર દિવસના ઐતિહાસિક ઉત્સવના સાક્ષી બનવા અને આનંદ ઉત્સવને માણવા આપ સૌ જ્ઞાતિજનોને તા. ૯ - ૧૦ - ૧૧ - ૧૨ મે , ૨૦૧૦ના રોજ નખત્રાણા પધારવા ભાવભીનાં આગોતરાં આમંત્રણ.....

લી.

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ	સુવર્ણ જયંતિ મહોત્સવ આયોજન સમિતિ
પ્રમુખ : રામજીભાઈ કે. નાકરાણી	*ચેરમેન :* *ગંગારામભાઈ એચ. સાંખલા*
ઉપપ્રમુખ : મનસુખભાઈ વી. રૂડાણી	*વા. ચેરમેન :* જયંતિ કે. રામાણી
ઉપપ્રમુખ : દેવજીભાઈ આર. ભાવાણી	*મહામંત્રી :* મોહનભાઈ એસ. ધોળુ

realpatidar.com

https://archive.org/details/bk1396/page/n23/mode/1up

realpatidar.com

સ્વર્ણિમ મહોત્સવના ચાર દિવસીય કાર્યક્રમ (સૂચિત)

તા. ૯-૫-૨૦૧૦, રવિવાર

સવારે ૦૮.૩૦ કલાકે	ઝોન પ્રસ્તુતિકરણ (૨૯ ઝોનના હોદ્દેદારો અને કારોબારી સભ્યો દ્વારા પરેડરૂપ ઝાંખી)
સવારે ૦૯.૩૦ કલાકે	ઉદ્‌ઘાટન કાર્યક્રમ અગ્રણીય રાજકીય મહાનુભાવોના પ્રવચનો ઇતિહાસ વિદ ગ્રંથ વિમોચન રાજ્યના મુખ્ય સફળ ઉદ્યોગપતિની પ્રેરણારૂપ જીવનઝાંખી સ્વયં પ્રવચનરૂપે
બપોરે ૧૨.૩૦ કલાકે	ભોજન
બપોરે ૩.૦૦ કલાકે	પ્રતિભાશોધ થીમ અંતર્ગત વિશિષ્ટ સન્માન
બપોરે ૩.૩૦ કલાકે	આરોગ્ય થીમ આધારીત કાર્યક્રમ
સાંજે ૫.૦૦ કલાકે	શૈક્ષણિક થીમ આધારીત જીંવત કાર્યક્રમ
સાંજે ૭.૦૦ કલાકે	રાત્રી ભોજન
રાત્રે ૮.૩૦ કલાકે	સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સન્માનોનો કાર્યક્રમ બાળકો અને યુવા દ્વારા કલા આધારીત સાંસ્કૃત્તિક કાર્યક્રમ - ઝોન દ્વારા

તા. ૧૦-૫-૨૦૧૦, સોમવાર

સવારે ૮.૩૦ કલાકે	મુખ્ય સમારોહ, ઊંઝા, વાઢાય, સીદસર, સંસ્થાઓના મહાનુભવો ની ઉપસ્થિતિ અને મનનીય પ્રવચનો વસ્તી ગણતરી થીમ પર આધારીત કાર્યક્રમ
બપોરે ૧૨.૩૦ કલાકે	ભોજન
બપોરે ૩.૦૦ કલાકે	મહિલા ઉત્કર્ષ થીમ અંતર્ગત મહિલા સંઘ કાર્યક્રમ
સાંજે ૫.૦૦ કલાકે	થીમ આધારીત બિઝનેસ અને કેરીયર કાર્યક્રમ
સાંજે ૭.૦૦ કલાકે	રાત્રી ભોજન
રાત્રે ૮.૩૦ કલાકે	સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સન્માનોનો કાર્યક્રમ બાળકો અને યુવા દ્વારા કલા આધારીત સાંસ્કૃત્તિક કાર્યક્રમ - ઝોન દ્વારા

તા. ૧૧-૫-૨૦૧૦, મંગળવાર

સવારે ૦૮.૩૦ કલાકે	થીમ આધારિત કૃષિ અને પર્યાવરણ કાર્યક્રમ
સવારે ૧૦.૧૫ કલાકે	થીમ આધારિત પ્રતિભા શોધ સન્માન
સવારે ૧૧.૦૦ કલાકે	થીમ આધારિત સામાજીક નેતૃત્વ અને રાજકીય જાગૃતિ કાર્યક્રમ
બપોરે ૧૨.૩૦ કલાકે	ભોજન
બપોરે ૦૩.૦૦ કલાકે	દાતાશ્રીઓનું સન્માન
બપોરે ૦૩.૩૦ કલાકે	યુવા મંથન - યુવાસંઘ દ્વારા
સાંજે ૦૫.૩૦ કલાકે	દાતાશ્રીઓનું સન્માન
સાંજે ૦૭.૦૦ કલાકે	રાત્રિ ભોજન
રાત્રે ૦૮.૩૦ કલાકે	સહયોગ નિધિ ડ્રો, સોવિનીયર ચડાવા - ખુલ્લોમંચ

તા. ૧૨-૫-૨૦૧૦ બુધવાર

સવારે ૦૮.૩૦ કલાકે	જ્ઞાતિનું પંચમ્ અધિવેશન
બપોરે ૧૨.૩૦ કલાકે	ભોજન
બપોરે ૦૩.૦૦ કલાકે	સ્વર્ણિમ મહોત્સવ સમાપન સમારોહ

realpatidar.com

https://archive.org/details/bk1396/page/n24/mode/1up

realpatidar.com

હાલો ભેરા પાંજે કચ્છડે પાંજા મલકમાં.....

સ્વર્ણિમ મહોત્સવ સીમાચિન્હરૂપ યાદગાર કાર્યક્રમો (સૂચિત)

સ્વર્ણિમ મહોત્સવ

એકઝીબીશન - લાકડા, કન્ટ્રક્શન અને ખેતી આધારીત
(પ્રદર્શનમાં કોઇપણ સ્ટોલ બુક કરાવી શકશે.)

યુવાઓ માટે જુદા જુદા વર્કશોપ
(સ્પેશ્યલ મંડપમાં)

કચ્છ તેમજ
કડવા પાટીદારોનું
કલા પ્રદર્શન

વિશિષ્ટ પાત્ર
પ્રદર્શન
કલાકાર દ્વારા
(ઇન્ફ્લેટેબલ
કેરેક્ટર)

એમ્યુઝમેન્ટ પાર્ક
(ફનફેર)

સ્કેરી હાઉસ
(ભૂત બંગલો)

મેજીસીયન

ટ્રેડીશનલ લોક દરબાર, લોક ગીતો
(જેમાં ગુજરાતની સેલીબ્રીટીની ઉપસ્થિતિ)

એડવેન્ચર સ્પોર્ટ
(જુદી જુદી જ્ઞાનવર્ધક રમતો)

જોકી ગેમ
(બાળકો, યુવા અને
કપલ માટે)

સ્પોટ કાર
(ખાડા ટેકરામાં
દોડી શકે)

આપણા યુવા અને બાળકો દ્વારા
વિવિધ કલાની પ્રસ્તુતિ (સ્ટેજ પ્રોગ્રામ દ્વારા)

વિશાળ પ્રાંગણમાં ઉપરોક્ત તમામ કાર્યક્રમો સાથે સભા મંડપનો વિશાળ સામીયાણો, બેથી ત્રણ સેમીનાર કોટ, ચાર કક્ષમાં વહેંચાયેલા ભોજન મંડપ, વિશાળ કમાનો, થીમ પ્રદર્શીત પોલ, પાણીના ફુવારા, તળાવ, ગ્રીન લોન, ગરમી રક્ષિત ફુવારા, વાતાનુકુલીત મંડપ, આધુનિક સાઇટ ઓફિસ, ઉતારાની વહેલા તે પહેલાના ધોરણેની સગવડો, માતાજીનું મંદિર વગેરે વગેરે.......

MISSION 2020
SHREE A.B.K.K.P. YUVASANGH
- Education & Health
- Business & Career
- Political & Leadership
- Social & Spiritual

પત્રિકાના સૌજન્ય દાતાશ્રી
માતૃશ્રી મુળબાઈ રતનશીભાઈ રામજીયાણી પરિવાર મુંબઈ - મદનપુરા
હસ્તે : સુપુત્રો શ્રી મોહનભાઈ, શ્રી મગનભાઈ, શ્રી નવીનભાઈ

realpatidar.com

https://archive.org/details/bk1396/page/n25/mode/1up

realpatidar.com

પૃથ્વી પર જેમ પાણીનો મહીમા છે. પાણીથી જીવન અને ઉર્જા મળે છે. તેવી જ રીતે દાન દ્વારા સમાજનો વિકાસ એ જ સમાજની ઉર્જા છે. આવા અનમોલ અવસરે આપ સૌએ સમાજની ઝોળીને હમેશા ભરપૂર રાખી સમાજ માટે ઋણ અદા કર્યું છે. નીચે જણાવેલ વિગતે આપનો આર્થિક સહયોગ આપી સમાજ વિકાસમાં સહભાગી બનશો.

સ્વર્ણિમ મહોત્સવ આયોજનના નોંધાવવાના બાકી વિવિધ દાતાશ્રીઓ

૧	ભોજનના દાતા:-	મુખ્ય ત્રણ દિવસના દાતા	૫૧,૦૦,૦૦૦/-
		સહયોગી એક દિવસના દાતા	૧૧,૦૦,૦૦૦/-
		સહયોગી સવારાના દાતા (અનલીમીટેડ)	૨૫,૦૦૦/-
		સહયોગી બપોરના દાતા (અનલીમીટેડ)	૧,૦૧,૦૦૦/-
		સહયોગી સાંજના દાતા (અનલીમીટેડ)	૫૧,૦૦૦/-
૨	સાઉંડ સિસ્ટમના દાતા		૨,૫૧,૦૦૦/-
3	લાઈટ ડેકોરેશનના દાતા ૨,૫૧,૦૦૦ × ૫ દાતા લેવા (સમાજના બધા સંકુલો સુશોભીત કરવા)		૧૨,૫૫,૦૦૦/-
૪	મંડપના દાતા :-	સભામંડપ ડોમ સાથે (૫ લાખ × 3 દાતા)	૧૫,૦૦,૦૦૦/-
		ભોજનાલય મંડપ (૨,૫૧,૦૦૦ × 3 દાતા)	૭,૫૦,૦૦૦/-
		અતિથિ વિશ્રામ મંડપ (૧,૫૧,૦૦૦ × ૫ દાતા)	૭,૫૦,૦૦૦/-
૫	બિલ્લા સ્ટિકરના દાતા (૧,૫૧,૦૦ × ૫ દાતા) નોંધઃ નામ ફક્ત બે[illegible] આવશે.		૭,૫૫,૦૦૦/-
૬	મોમેન્ટોના દાતા (૨.૫ લાખના ૫ દાતા અથવા ૧૧ લાખના એક દાતા) નોંધઃ નામ ફક્ત બેનરમાં આવશે.		૧૧,૦૦,૦૦૦/-
૭	કેપના દાતા (૨.૫૦ લાખ × ૨)		૫,૦૦,૦૦૦/-
૮	મેઈન ગેટના દાતા (૧.૫૧ લાખ × ૨ દાતા)	૧ ગેટ કોલેજ પાસે	૧,૫૧,૦૦૦/-
		૧ ગેટ વિરાણી રોડ ખોથામાં	૧,૫૧,૦૦૦/-
૯	કમાની ગેટના દાતા (અનલીમીટેડ)		૧૫,૦૦૦/-

નોંધ :- ૧) સુવર્ણ મહોત્સવ નિમિતે થનાર બચતની રકમ ભવિષ્યમાં શૈક્ષણિક હેતુ માટે વપરાશે.
૨) ૫ લાખથી ઉપરના દાતાશ્રીઓના નામ C.D. માં આવશે.
3) ૧ લાખથી ઉપરના દાતાશ્રીઓના નામ પાટીદાર વિદ્યાથી ભવન, નખત્રાણા મધ્યે શીલાલેખમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે.

સ્વર્ણિમ મહોત્સવ આયોજનના નોંધાયેલા દાતાશ્રીઓ

ઉદઘાટક દાતા	માતૃશ્રી મુળબાઈ રતનશીભાઈ રામજીયાણી પરિવાર, મુંબઈ - મદનપુરા
મુખ્યદાતા	સ્વ. માતાજી હિરૂબેન રામજીભાઈ ખીમજીભાઈ ભાવાણી
	સતરાવાળા પરિવાર, સુરત - રસલીયા
	સ્વ. માતૃશ્રી વાલબાઈ હીરાલાલ ગોપાલભાઈ સાંખલા પરિવાર, દિલ્હી - રસલીયા
	પટેલ વુડ પ્રોડક્ટ્સ લી, દિલ્હી - ખોંભડી
	પટેલ ગોલ્ડન ટીમ્બર્સ પ્રા. લી. (પી. જી. ગ્રુપ), દિલ્હી - ખોંભડી
યુવાઓલ્પીયાડ ટાઈટલ	ધનસુખભાઈ હરજીભાઈ લીંબાણી, મસ્કત - માનકુવા
ઓફિસ ઉદ્‌ઘાટક	સીલીકોન પ્રા. લી. હસ્તે મનસુખભાઈ વી. રૂડાણી, અમદાવાદ - કોટડા

ઈતિહાસવિદ ગ્રંથ

ગ્રંથ ટાઈટલ - ૪	મૈત્રી ગ્રુપ મુંબઈ હસ્તે પ્રેમજીભાઈ બી. કેશરાણી, મુંબઈ - નાના અંગીયા
	અબજીભાઈ વી. કાનાણી, મુંબઈ - વિરાણી મોટી
	સામજીભાઈ એન. નાકરાણી, મુંબઈ - રત્નાપર મઉ
ગ્રંથ ટાઈટલ - ૨	શ્રી અંબિકા ગ્રુપ સીંગોટા હસ્તે દેવશીભાઈ એન. રંગાણી, સિંગોટા-રામપર (નેત્રા)
ગ્રંથ ટાઈટલ - 3	શ્રી અંબાલાલભાઈ હરદાસભાઈ ધોળુ, બાકુંડા- નાના અંગીયા
ગ્રંથ ટાઈટલ - 3ની સામેનું પેજ	મૈસુર ટીમ્બર હસ્તે બાબુભાઈ ભગત, બેંગ્લોર - ખોંભડી
	રમેશભાઈ એમ. વાગડીયા, બેંગ્લોર - ખોંભડી
	વાલજીબાપા દિવાણી, સાગર દિલ્હી - લક્ષ્મીપર

તા. ૧૪-૨-૨૦૧૦ના સુર્વણ જયંતિ મહોત્સવ આયોજન અંગેની મળેલી અસાધારણ સભામાં નોંધાયેલા દાતાશ્રીઓની યાદી સાધારણ સભાના અહેવાલમાં અન્યત્ર પ્રકાશિત કરેલ છે.

realpatidar.com

https://archive.org/details/bk1396/page/n26/mode/1up

Sanatan Dharm
Jagruti Karnataka
#History

સમાજની નવી પેઢી જ્ઞાતિ [illegible] ચંબિત થઈ રહી છે

કર્ણાટકમાં સર્વત્ર થઈ રહ્યો છે સનાતન ધર્મનો જયજયકાર

સનાતન ધર્મ જાગૃતિ સમિતિની બેંગલોરમાં યોજાયેલ જાગૃતિ મહાસભા પછી કર્ણાટકના મુખ્ય શહેરો જેવા કે દાવણગેરે, હુબલી અને ટુમકુર મધ્યે સનાતન ધર્મ જાગૃતિ અભિયાનની સભાઓ તા. ૬, ૭ અને ૮ જાન્યુઆરીના યોજવામાં આવેલ.

દાવણગેરે પાટીદાર વાડી ખાતે તા. ૬-૧-૨૦૧૦ના રાત્રે ૯.૦૦ કલાકે સ્થાનિક સમાજના પ્રમુખ શ્રી પ્રેમજીભાઈ લીંબાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સભામાં દાવણગેરે અને આજુબાજુના ગામોમાં વસતા ૩૫૦ જણાની હાજરી હતી. એજ્યુકેશન સીટી ગણાતી દાવણગેરેમાં ઈન્ટેલેક્ચ્યુઅલ માણસોની હાજરી હતી.

સનાતન ધર્મ જાગૃતિ સમિતિના ભાઈઓ સર્વ શ્રી હિંમતભાઈ ખેતાણી (મુંબઈ), રમેશભાઈ વાઘડીયા (બેંગલોર), અબજીભાઈ કાનાણી (મુંબઈ), મણીલાલ ભીમજી પોકાર (બેંગલોર), ધનજીભાઈ મનજી છાભૈયા (બેંગલોર), ખીમજી પોકાર (નેલમંગલા), પ્રેમજી હીરજી પોકાર (રાજાજીનગર), ચંદુભાઈ કરસન દિવાણી (બેંગલોર), લાલજી ડાહ્યા છાભૈયા (ટુમકુર) વગેરે અગ્રણીઓએ સભામાં ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.

ઉપરોક્ત ભાઈઓમાંના શ્રી હિંમતભાઈ, રમેશભાઈ, અબજીભાઈ અને ધનજીભાઈએ આપણી કેન્દ્રીય સમાજના સાચા ઈતિહાસ અને આપણી જ્ઞાતિના સાચા ઈતિહાસ બાબતની સભાજનોને ઝાંખી કરાવી હતી. રમેશભાઈએ સભાજનોને ખાસ પૂછયું હતું કે આપણો સાચો ધર્મ શું છે અને આપણી કેન્દ્રીય સમાજનો સાચો ધર્મ ક્યો છે ત્યારે સભાજનોએ એક સુરમાં જોરથી જવાબ આપ્યો હતો કે "આપણો ધર્મ સનાતન ધર્મ છે અને આપણી કેન્દ્રીય સમાજનો ધર્મ પણ સનાતન ધર્મ છે. આપણી જ્ઞાતિમાં પીર ઈમામશાહ બાવાનું તુત શું છે તે બારામાં ઉંડાણથી સમજણ શ્રી હિંમતભાઈએ આપેલ અને કેન્દ્રીય સમાજના હાલના આગેવાનો સનાતન ધર્મના પ્રચાર કાર્યમાં ક્યાં ઉણા પડે છે તેની વિગતવાર માહિતી સભાજનોને આપેલ."

શ્રી અબજીભાઈ કાનાણી અને ધનજી મનજી છાભૈયાએ યુવા સંઘની કલકતા મધ્યે ૧૯૭૨માં સ્થાપના કરવામાં આવી હતી ત્યારે તેઓની હાજરી હતી અને તે સંઘની સ્થાપનાના મુખ્ય ઉદ્દેશો પૈકીમાંનો એક ઉદ્દેશ એ હતો કે "આ સંઘે સનાતન ધર્મનો પ્રચાર કરવો અને આવા દરેક પ્રકારના પ્રચાર કાર્યમાં સમાજને મદદરૂપ થવું અને સમાજમાં ધાર્મિક (પીરાણા ધર્મ) અંધશ્રધ્ધાઓ દુર કરવી એવું જણાવેલ."

સભાના અંતે પ્રશ્નોત્તરી રાખવામાં આવેલ. તેમાંના અમુક પ્રશ્નો નીચે પ્રમાણેના હતા તેના યોગ્ય જવાબો હિંમતભાઈએ આપેલ હતા. ખાસ કરીને યુવાન ભાઈઓએ આ પ્રશ્નો પુછેલા હતા.

પ્રશ્ન : તમારી પાસેથી સાચો ઈતિહાસ જાણ્યા પછી એટલું તો પુરવાર થાય છે કે આપણી કેન્દ્રીય સમાજની સ્થાપના સનાતની સમાજ તરીકે થઈ હતી. તો પછી સમાજના આગેવાનો તેવું નથી સમજતા તો તેમને તેની જવાબદારી પ્રત્યે ભાન કરાવવા માટે આપણે શું કરવું જોઈએ?

જવાબ : કેન્દ્રીય સમાજના આજના ધુરીણોને તેમની ફરજો અને જવાબદારીઓ પ્રત્યે વાકેફ કરવા હેતુથી જ અમો અત્યારે તમારી સમક્ષ ઉપસ્થિત થયા છીએ અને તેવી ફરજોનું તેમને વાકેફ કરવા માટે તમો તમારી સ્થાનિક સમાજોથી પત્ર લખી જણાવી શકો છો.

(૨) પ્રશ્ન : સમાજનો સાચો ઈતિહાસ તેમજ આપણી જ્ઞાતિનો સાચો ઈતિહાસ બતાવવાનું કામ તો કેન્દ્રીય સમાજનું છે તેઓ આ કામ શા માટે નથી કરતા?

જવાબ : તે વાતનું જ આપણને સૌને દુઃખ છે. આપણી કેન્દ્રીય સમાજ જ્યારે ૫૦ વરસ પુરા કરી સ્વર્ણિમ મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે તે સમાજનો સાચો ઈતિહાસ બતાવવાનું કામ કેન્દ્રીય સમાજે જરૂર કરવું જોઈએ પણ સાચો ઈતિહાસ બતાવતાં અમુક વર્ગોના માણસોને ખરાબ લાગે છે તેના ડરથી તેઓ જ્ઞાતિને સાચા ઈતિહાસ બતાવતા નથી.

પ્રશ્ન : આપણી કેન્દ્રીય સમાજમાં રહીને સતપંથી ભાઈઓ અગર સમાજની રીતી-રિવાજોનું તેમજ ધારા-ધોરણનું પાલન ન કરતા હોય તો તેવા લોકોને સમાજમાં રહેવાની કોઈ જ જરૂરત રહેતી નથી. તો આવા લોકોની સામે કેન્દ્રીય સમાજ કડક પગલાં કેમ લેતી નથી?

જવાબ : સિધ્ધાંતિક દૃષ્ટિએ આ સમાજ સનાતની સમાજ છે અને હિન્દુ વૈદિક સનાતન ધર્મ પાળતા લોકો જ આ સમાજમાં રહી શકે અને તેના રીત-રિવાજો અને ધારા-ધોરણોને ન પાળનારા લોકોની સાથે કડક પગલાં લેવો જોઈએ પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણી કેન્દ્રીય સમાજ આ બાબતે નિષ્ક્રિય છે એટલે જ અમોએ જનજાગૃતિ અભિયાન છેડ્યું છે જેથી જનતા જ એમની પાસે જવાબ લઈ શકે.

પ્રશ્ન : આપણી સાથે જ રહીને સતપંથીઓ આપણને ધાર્મિક બાબતોએ કનડગત કરતા હોય અને સનાતની ભાઈઓ જોડે અડોડાઈ કરતા હોય તો આપણે તેવા લોકોની સાથે કેવું વર્તન કરવું જોઈએ?

જવાબ : જેમ ગાંધીજી અંગ્રેજો સાથે કરતા તેમ (અસહકારનું શસ્ત્ર તેવા લોકોની

realpatidar.com

https://archive.org/details/bk1396/page/n27/mode/1up

2010-03 -Patidar Saurabh (1396)

realpatidar.com

સામે ઉગામવું જોઈએ જેને અંગ્રેજીમાં Non-Co-Operation કહેવાય છે. આ શબ્દનો ઉલ્લેખ આપણા કેન્દ્રીય સમાજની રીત-રિવાજોની કલમોના અંતે પણ કરવામાં આવ્યો છે.

સ્થાનિક આગેવાનોના મંતવ્યો

શ્રી દામોદરભાઈ પ્રેમજી લીંબાણી : યુવા સંઘ ઉપપ્રમુખ કર્ણાટક ઝોન

આજની સભામાં મહેમાનોના વક્તવ્યો સાંભળી આપણી કેન્દ્રીય સમાજની સાચી ઓળખ સનાતની સમાજ તરીકેની છે તેમાં બે મત નથી અને તેથી તે સાચી ઓળખ ટકાવવા માટે અમો યુવાનો સર્વે પ્રકારની મદદ કરશું અને આજે રમેશભાઈ વાઘડીયાએ જે યુવાનોને હાકલ બાબતનો પત્ર આપ્યો છે તેની નકલો કરાવી અમારી સમાજના દરેક યુવાનોને આપશું અને અમારા કેન્દ્રીય યુવા સંઘમાં, પણ પત્ર લખીને આ બાબતોથી તેમને જગાડશું.

શ્રી પ્રેમજીબાપા લીંબાણી– સભા અધ્યક્ષ

સભા અધ્યક્ષે સનાતન ધર્મ જાગૃતિ સમિતિના અત્રે આવેલ સભ્યોને અને ખાસ કરીને હિંમતભાઈને અંત:કરણથી ધન્યવાદ આપ્યા હતા. તેમણે જણાવેલ કે આ કાર્ય ૨૦ વરસ પહેલાં કેન્દ્રીય સમાજે કરવું જોઈતું હતું અને તે તમે કરી રહ્યા છો. ભગવાન લક્ષ્મીનારાયણ તમોને સહાય કરશે. તમો અહીં આવી અમોને આજીજી કરો છો તે બિલકુલ કરતા નહીં. તમે અમોને જુસ્સાભેર આદેશ આપો. આ કામ ફક્ત તમારું નથી. આપણા બધાનું છે. જરૂરત પડે ત્યારે અમોને હાકલ કરજો અમે આવી જશું.

ડૉ. રમેશભાઈ લીંબાણીને આભાર વિધી કરતાં પોતાના મંતવ્યો આપતા જણાવેલ કે સમાજ એવો હોવો જોઈએ કે જ્યાં

અ. એક જ રીત-રિવાજનું પાલન થતું હોય.
બ. એક ધર્મ-સનાતન ધર્મ પળાતો હોય.
ક. લોકોનો જનસમુદાય એક આચાર-વિચારને વરેલો હોય.

તેથી જ તો આપણા વડીલોને સતપંથ ધર્મ મુકીને આ નવી સમાજની સ્થાપના ૧૯૬૦માં કરવી પડી હતી. અમારી ડૉક્ટરની ભાષામાં કહું તો શરીરમાં રોગ પ્રસરે ત્યારે પહેલાં અમે ગોળીઓ આપીએ. ત્યારપછી ઈન્જેક્શનથી સારવાર કરીએ. તેમ કરતાં ન થાય તો જે અંગ ખરાબ થયું હોય તેને સર્જરી કરી કાપી નાખીએ જેથી બાકીનું શરીર સ્વસ્થ રહે. તેવી જ રીતે સમાજમાં પણ વિધર્મી રૂપી દુષણ ઘર કરી જાય ત્યારે દવારૂપી સમજણ આપી શકીએ તેમ કરતાં ન માને તો સર્જરી કરી તે અંગને જુદું કરવું જ પડે.

છેલ્લે ડૉ. રમેશે આવેલ મહેમાનોનો આભાર માન્યો હતો તેની સાથે સાથે દાવણગેરેની આજુબાજુના ગામડાઓમાંથી આવેલ ભાઈ-બહેનો અને યુવાનોનો પણ આભાર માન્યો હતો.

■ કોઈને માટે છાનામાના રડવું એ તો એક એવી ઘટના છે. જેમાં રાધાની વેદના છે અને ગોકુળની પવિત્રતા છે.

ઉત્તમ ધર્મની શોધ

એક રાજા પાસે ધન, સામર્થ્ય, ઐશ્વર્ય એવી તમામ દુન્વયી સંપત્તિ હતી. તેમને ધર્મમય જીવન ગાળવાની લગની લાગી હતી. આ માટે તેમણે સૌથી ઉત્તમ હોય તેવા ધર્મની શોધ કરવા માંડી. તેમણે જુદાં-જુદાં ધર્મશાસ્ત્રો વાંચ્યાં, પણ ક્યો ધર્મ ઉત્તમ એ વિશે એ નિર્ણય કરી શક્યા નહીં. આથી તેમણે જુદા-જુદા ધર્મોના વિદ્વાનો, શાસ્ત્રકારો અને પંડિતોને બોલાવ્યા.

દરેક ધર્મના જ્ઞાનીઓએ પોતાનો જ ધર્મ સર્વોત્તમ છે એવું ભારપૂર્વક કહ્યું. તે માટે તેમણે દાખલાદલીલો કરી. પંડિતો એકબીજા સાથે વાદ-વિવાદમાં ઊતરી પડ્યા. પોતાના ધર્મને શ્રેષ્ઠ ઠરાવવા એમની રજૂઆતો ઉગ્ર થતી ગઈ અને અંતે તેઓ એકબીજા સામે ગાળાગાળી અને મારામારી ઉપર આવી ગયા. રાજાને સમજાયું કે આવા લોકોનો ધર્મ ઉત્તમ હોઈ શકે નહીં. એટલે એમણે પંડિતોને વિદાય કરી દીધા.

નિરાશ વદને રાજા નદીને કિનારે સૂનમૂન બેઠા હતા. ત્યાં એક સાધુ આવી ચડ્યા. સાધુએ રાજાને પૂછ્યું, 'કેમ ગમગીન બેઠા છો?'

રાજાએ સાધુની આંખોમાં નવી જ ચમક નિહાળી. રાજાએ ઉત્તમ ધર્મની શોધ અને તેમાં મળેલી નિષ્ફળતાની પોતાની વાત કહી.

સાધુએ હસીને રાજાને કહ્યું, 'રાજન, તમારી શોધ જ ખોટી હતી. ધર્મ હોય છે, ઉત્તમ ધર્મ જેવું કશું હોતું નથી. બધા ધર્મો સમાન છે. તમે જે બધા પંડિતોને મળ્યા એ સંપ્રદાયના પંડિતો હતા. ધર્મના પંડિતો નહોતા. સંપ્રદાય સંપ્રદાય વચ્ચે તકરાર હોય છે. ધર્મધર્મ વચ્ચે તકરાર નથી હોતી. આપણી પ્રકૃતિની અનુકૂળ આવે તે ધર્મ આપણે માટે ઉત્તમ.'

રાજાએ પૂછ્યું, 'મારે માટે ક્યો ધર્મ ઉત્તમ છે?'

સાધુએ કહ્યું, 'આ નદીને સામે કિનારે જઈએ. ત્યાં તમારો ધર્મ બતાવું.'

સામે કિનારે જવા રાજાએ હોડી મગાવી. સાધુએ તે હોડીમાં ખામી બતાવી. રાજાએ બીજી હોડી મંગાવી, પણ સાધુ દરેક હોડીમાં ખામી બતાવતા ગયા. અંતે રાજાએ કંટાળીને કહ્યું, 'સાધુ મહારાજ, સામો કિનારો એટલો નજીક છે કે આપણે જાતે તરીને જઈ શકીએ, તમે હોડીમાં નકામી ખામીઓ કાઢો છો.'

સાધુએ કહ્યું, 'એ જ સાચી વાત છે. આપણો ધર્મ આપણે જાતે જ શોધવાનો છે. સહાય માટે કોઈ હોડીની જરૂર નથી.'

સંપ્રદાયની વાડાબંધી ત્યજી આપણા અંતરાત્માથી શોધીએ તો સાચો ધર્મ મળી રહે છે.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

realpatidar.com

હુબલી – ધારવાડ સનાતન ધર્મ જાગૃતિ અભિયાન

સ્થળ : હુબલી પાટીદાર વાડી

આ સભાનું આયોજન કચ્છ કડવા પાટીદાર સમાજ હુબલીએ યુવક મંડળને સાથે રાખીને કર્યું હતું. સભા અધ્યક્ષ તરીકે હુબલી સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ નથુ પારસીયા નખત્રાણા વાળાએ મંચ ઉપર સ્થાન ગ્રહણ કરાવેલ સાથે ઉત્તર કર્ણાટક ઝોનના પ્રમુખ શ્રી લધાભાઈ ભાવાણી રસલીયાવાળાએ સ્થાન ગ્રહણ કરેલ. સનાતન ધર્મ જાગૃતિ સમિતિના ભાઈઓમાંથી સર્વ શ્રી હિંમતભાઈ, શ્રી અબજીભાઈ, શ્રી રમેશભાઈ, શ્રી અબજીભાઈ, શ્રી ચંદુભાઈ, શ્રી મણીભાઈ, શ્રી ખીમજીભાઈ, લાલજીભાઈ વગેરે ભાઈઓને પણ મંચ ઉપર સ્થાન ગ્રહણ કરાવેલ.

ક્રમ અનુસાર રમેશભાઈ માવજી વાગડીયાએ સમાજ એવં આપણી જ્ઞાતિના ઈતિહાસ પર પ્રકાશ પાડેલ અને આજના આપણી સમાજના ધુરીણો સનાતન ધર્મ જે આપણી સમાજનો ધર્મ છે તેના પ્રચાર અને બચાવમાં ક્યાં ક્યાં અને કેવી રીતે ઉણા પડે છે તેની માહિતી આપી હતી. આપણી કેન્દ્રીય સમાજ અને સનાતન ધર્મ જુદા નથી અને હોઈ પણ ન શકે એટલા માટે કેન્દ્રીય સમાજના આજના આગેવાનોની પ્રાથમિક ફરજ બને છે કે સમાજમાં સનાતન ધર્મનો પ્રચાર કરે.

ત્યાર પછી અબજીભાઈ વિશ્રામ કાનાણીએ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે પીર ઈમામશાહ બાવા સ્થાપિત પીરાણા સતપંથ ધર્મ એ હિન્દુ ધર્મ નથી તે એક મુસ્લિમ ધર્મનો ફાંટો છે. તેથી જ આપણા સુધારક વડીલોએ તેનો સખત વિરોધ કરી આપણી જ્ઞાતિને પીરાણા સતપંથ ધર્મના દુષણોમાંથી છોડાવી અને મુળ હિન્દુ સનાતની તરીકેની ઓળખ આપણી જ્ઞાતિને પાછી અપાવી હતી. આપણી કેન્દ્રીય સમાજનો ધર્મ સનાતન ધર્મ છે તેનો પુરાવો આપતાં જણાવેલ કે અ.ભા.ક.ક. પાટીદાર યુવા સંઘની કલકતા મુકામે ૧૯૭૨માં સ્થાપના વખતેના ઉદ્દેશોમાં ચોખ્ખું જણાવવામાં આવેલ કે આ યુવા સંઘનો મુખ્ય ઉદ્દેશ એ પણ રહેશે કે યુવાનોમાં સનાતન ધર્મનો પ્રચાર કરવો અને આવા પ્રચાર કાર્યમાં સમાજને દરેક રીતે મદદરૂપ થવું.

ત્યાર પછી મુરબ્બી શ્રી હિંમતભાઈ ખેતાણીએ પોતાના ભાષણમાં આ ઈમામશાહ બાવા તેમજ પીરાણા સતપંથ ધર્મનું તુત શું છે તેના પર વિસ્તૃત માહિતી આપી હતી. ઈમામશાહ બાવા ઈરાનથી ગુજરાત પ્રાંતમાં એકમાત્ર મકસદ લઈને આવ્યા હતા. ને તે મકસદ હતો હિન્દુઓને ઉંધે રવાડે ચડાવી, તરી મુસલમાન ધર્મમાં વટલાવવાનો. તેમાં ચાલતી છેતરપીંડીઓ તેમજ સતપંથ તરીકેનું પીરાણા સતપંથનું નામ પણ એટલું જ છેતરામણું છે તેનો ચિતાર હિંમતભાઈએ સમાજજનોને આપેલ. મુસ્લિમ પીર બાવા ઈમામશાહે તો આપણી જ્ઞાતિને છેતરી ત્યાર પછી પીરાણા સતપંથના કાકા કરસન કાકાએ તો કેન્દ્રીય સમાજના સનાતની ભાઈઓને પણ છેતર્યા. જે વાત આપણા આ.સુ.પુ. નારણજી બાપાએ કરી હતી કે પીરાણા સતપંથ ધર્મ આપણી જ્ઞાતિને લાયક ધર્મ નથી એજ વાત હિંમતભાઈએ સભાજનોને કરી હતી.

ત્યાર પછી સનાતન ધર્મ જાગૃતિ સમિતિના અન્ય ભાઈઓ જેવા કે ચંદુલાલ કરસન દીવાણી તેમજ ખીમજીભાઈ પોકાર નેલ મંગલાવાળાએ પણ પોતાના ભાષણોમાં જણાવેલ કે આપણો મુળ ધર્મ સનાતન હિન્દુ ધર્મ છે અને આજે પીરાણા સતપંથ ધર્મ વાળા લોકો આપણી સમાજમાં રહીને તે ધર્મનો પ્રચાર કરતા હોય તો આપણે સૌએ આજે જાગૃત થઈ જવાની જરૂરત છે અને ખાસ કરીને યુવાન ભાઈ-બહેનોને જાગૃત થવાની જરૂરત છે.

સભાના આખરમાં પ્રશ્નોત્તરી રાખવામાં આવેલ તેમાં અનેક બહેનોએ સમાજમાં સતપંથ અને સનાતન ધર્મ બાબતે પ્રશ્નો પુછતાં સમાજના ધુરીણોને સવાલ કરેલ કે આપણી કેન્દ્રીય સમાજ સનાતની સમાજ છે તો તે સનાતન ધર્મનો પ્રચાર શા માટે નથી કરતી અને આ બાબતે તે નિષ્ક્રિય શા માટે છે? તેમની નિષ્ક્રિયતાને લીધે સમાજમાં અને ખાસ કરીને સમાજની બહેનોમાં એટલી બધી ગેર સમજણ ઉભી થઈ છે કે આપણી કેન્દ્રીય સમાજનો મુળ ધર્મ સનાતન હિન્દુ ધર્મ છે કે પછી ઈસ્લામ ધર્મના પાયા ઉપર રચાયેલ પીરાણા સતપંથ ધર્મ છે. આવા પ્રશ્નોના જવાબ આપતાં શ્રી હિંમતભાઈ ખેતાણીએ જણાવેલ કે આપણી કેન્દ્રીય સમાજની બે-ધારી અને અસ્પષ્ટ નીતિઓને લીધે આજે સમાજના સનાતની કેન્દ્રીય સમાજનો મુળ ધર્મ સનાતન ધર્મ છે તેના અસંખ્ય પુરાવાઓ મોજુદ છે. ફક્ત જરૂરત છે આજની યુવા પેઢીને સમાજનો અને જ્ઞાતિનો સાચો ઈતિહાસ બતાવવાની. પણ તે બતાવવાની જવાબદારી કોની છે? કેન્દ્રીય સમાજની છે પણ તે તેની ફરજ ચુક્યા છે એટલે જ આવી બધી ગેર સમજણો આ સમાજમાં ધર્મ પ્રત્યે ઉભી થઈ છે.

છેલ્લે યુવક મંડળના પ્રમુખ શ્રી પુરસોત્તમ નાનજી સાંખલાએ અને સમાજના સહમંત્રી શ્રી મંગલદાસ મુળજી ભાદાણીએ સનાતન ધર્મ જાગૃતિ સમિતિનો આભાર વ્યક્ત કરતાં જણાવેલ કે આપણી સમાજનો સાચો ધર્મ સનાતન ધર્મ છે અને તેના પ્રચાર કાર્યમાં અમારી જ્યારે પણ જરૂરત પડશે ત્યારે અમોને હાકલ કરજો અમે સર્વ યુવાનો હાજર થઈ જશું.

> હું 'કાય-સ્થ' છું, 'દેહ-સ્થ' પણ છું જ, પરંતુ સૌથી સાચું તો એ છે કે હું 'સ્વ-સ્થ' છું.
>
> - વિનોબા ભાવે

realpatidar.com

https://archive.org/details/bk1396/page/n29/mode/1up

realpatidar.com

તુમકુર સનાતન ધર્મ જાગૃતિ અભિયાન સભા

આ સભાનું આયોજન શ્રી તુમકુર પાટીદાર સનાતન સમાજે અને તેજ સમાજના યુવક મંડળે કર્યું હતું. આ સમાજના પ્રમુખ શ્રી લાલજીભાઈ ડાહ્યા છાભૈયા કોટડાવાળા અને તેજ સમાજના અમુક વડીલો અને યુવાનો બેંગ્લોર મુકામે તા. ૩-૧-૨૦૧૦ના યોજાયેલ સનાતન ધર્મ જાગૃતિ અભિયાન સભામાં હાજરી આપેલ હતી. તેઓને લાગ્યું કે આવી સભા પોતાની સમાજમાં યોજાય તો કેમ? અને તુમકુર પાટીદાર સનાતન સમાજે નિર્ણય લીધો અને તા. ૮-૧-૨૦૧૦ના રાત્રે ૯.૦૦ વાગે શ્રી સિધ્ધિવિનાયક સમુદાય ભવન તુમકુર મધ્યે લગભગ ૩૫૦ ભાઈ-બહેનોની હાજરીમાં બોલાવવામાં આવી. આ સભા સતત ૪.૩૦ કલાક ચાલેલ અને ખૂબ જ ઉત્સાહથી સમાજના દરેક વર્ગે રાત્રીના ૧.૩૦ વાગ્યા સુધી આ સનાતન ધર્મ જાગૃતિ અભિયાન સભાને માણેલ. આપણી કેન્દ્રીય સમાજ તથા આપણી જ્ઞાતિના સાચા ઈતિહાસ જાણવા માટે દરેક સભાજનોને આતુરતા હતી. સનાતન ધર્મ જાગૃતિ સમિતિના શ્રી હિંમતભાઈ ખેતાણીને સાંભળવા માટે લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.

પ્રણાલિકા પ્રમાણે શ્રી રમેશભાઈ માવજીભાઈ વાગડીયાના જુસ્સાદાર ભાષણ પછી અબજીભાઈ વિશ્રામ કાનાણી, ચંદુલાલ કરસન દીવાણી, ખીમજીભાઈ પોકાર નેલમંગલાવાળાનું અને છેલ્લે હિંમતભાઈ ખેતાણીના ભાષણની તુમકુર પાટીદાર સનાતન સમાજના ભાઈ-બહેનોએ મજા માણી હતી.

આપણી કેન્દ્રીય સમાજની સ્થાપના કોણે કરી, શા માટે કરી, સ્થાપના કરનાર વડીલોએ પીરાણા સતપંથ ધર્મનો સદંતરે ત્યાગ શા માટે કર્યો અને ત્યાર પછી કેન્દ્રીય સમાજની સ્થાપના કેવા સંજોગોમાં શા હેતુઓને લઈને કરી અને આજે એજ સમાજના આગેવાનો શું એ હેતુઓ પાર પાડી રહ્યા છે કે નહીં? અને સનાતની તરીકે એ સમાજ પ્રત્યે આપણી શી શી જવાબદારીઓ બને છે તે બાબતનો ચિતાર શ્રી રમેશભાઈએ, શ્રી અબજીભાઈએ અને શ્રી ચંદુભાઈએ આપ્યો હતો.

શ્રી હિંમતભાઈએ પીર ઈમામશાહ સ્થાપિત પીરાણા સતપંથ ધર્મનું તુત શું છે અને તે ધર્મે આપણી જ્ઞાતિને કેવી રીતે ફસાવી તે બાબતની સવિસ્તાર માહિતી આપી હતી. સાથે સાથે પીર ઈમામશાહે અને તેના પિતા પી. કબીરુદ્દીને અને તેના દાદા શ્રી સદરૂદ્દીને હિન્દુ શાસ્ત્રોને કેવી રીતે ભ્રષ્ટ કરી આપણા પૂર્વજોને ફસાવ્યા હતા તે જણાવ્યું હતું. શ્રી હિંમતભાઈએ પુરાવા સહિત રજુઆત કરી હતી કે આપણા હિન્દુ શાસ્ત્રોમાં કયાંય નકળંકીનારાયણનો ઉલ્લેખ નથી છતાં પણ પીરાણા સતપંથી ભાઈઓ આજ કાલ નકળંકી નારાયણની સાથે પીર ઈમામશાહના કહેવાતા ભાઈઓમાં ગેર સમજણ ફેલાવી શ્રધ્ધાનું વિકેન્દ્રીકરણ કરતા રહેલા છે તેની સામે સમાજમાં કોઈ જ કહેવાવાળું નથી. સમજતા હોવા છતાં સમાજના આગેવાનો આ સનાતન ધર્મ બાબતે અકળ ચુપકીદી સેવી રહ્યા છે તેનું કારણ સમજાતું નથી. તેમના કહેવા પ્રમાણે નકળંકી નારાયણ તો બાવા ઈમામશાહના ભેજાની એક માત્ર કપોળ કલ્પિત પેદાસ છે જેનું સમર્થન હિન્દુ શાસ્ત્રોમાં ક્યાંય ઉપલબ્ધ નથી. હા, પીર ઈમામશાહ લખી ગયા તે પ્રમાણે હજરત મહમદ પયગંબરના જમાઈ હજરત અલી જ નકળંકી નારાયણનો અવતાર છે અને તેની પત્ની બીબી ફાતમાએ આપણી આદ્ય શક્તિનો અવતાર છે. આવી અનેક માહિતીઓ પીરાણા સતપંથ ધર્મ બાબતે શ્રી હિંમતભાઈને આપેલ હતી.

શ્રીમાન હિંમતભાઈના વક્તવ્ય પછી પ્રશ્નોત્તરી રાખવામાં આવેલ અને તેના જવાબો સનાતન ધર્મ જાગૃતિ સમિતિએ આપ્યા હતા.

શ્રી શંકરલાલ ડોસાણી

પ્રશ્ન : આપણી કેન્દ્રીય સમાજ સનાતની સમાજ છે તો તેના કાર્યકરો શ્રી સનાતન ધર્મની અને શ્રી લક્ષ્મીનારાયણની જય શા માટે નથી બોલાવતા?

જવાબ :કારણ કે તેઓ એમ સમજે છે કે આ કેન્દ્રીય સમાજને સનાતન ધર્મની સાથે કોઈ જ લેવા દેવા નથી અને કદાચ જય બોલાવે તો સમાજ સનાતની સમાજ છે તેવું પુરવાર થઈ જાય એમ એમને લાગે છે. જે તેઓને કહેવા થવા નથી દેવું એવું જણાઈ આવે છે.

શ્રી કાન્તિભાઈ કરમસી રવાણી - યુવક મંડળના પ્રમુખ

પ્રશ્ન : કેન્દ્રીય સમાજ તેમજ તેની અંતર્ગત ભારતભરની તમામ સમાજોમાં આપણા સુધારક વડીલોના ફોટા શા માટે નથી રખાતા? આપણી અને આપણી કેન્દ્રીય સમાજની સનાતની તરીકેની ઓળખ માટે કોઈ એક પ્રતિક અથવા તો લોગો આજે ૫૦ વરસ પછી પણ શા માટે નથી?

જવાબ : આ બધાય પ્રશ્નોના જવાબો આપણને ભેગા મળીને આપણી કેન્દ્રીય સમાજના આજના આગેવાનોને પુછવા પડશે. એટલા માટે જ થઈને આજે આપણે બધા ભેગા મળીને આ જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છીએ જેથી કરીને સમાજના લોકોમાં સાચી જાગૃતિ આવે.

શ્રી બાબુભાઈ રવાણી ખોંભડીવાળા

પ્રશ્ન : આપણી સમાજને આજે ૫૦ વરસ પુરા થયા પણ આવી રીતે સનાતન ધર્મના પ્રચાર કરી જાગૃતિ અભિયાન અમે પહેલીવાર જોઈ રહ્યા છીએ. તો આપણી સમાજના મુળ સનાતની સમાજ હોવા છતાં આવા ધર્મ પ્રચાર કાર્યો કેન્દ્રીય સમાજ

realpatidar.com

https://archive.org/details/bk1396/page/n30/mode/1up

realpatidar.com

દ્વારા શા માટે નથી થયા? આપણે સૌ પીરાણા સતપંથ ધર્મમાં ભટકાયેલા હતા તેમાંથી વડીલોએ આપણને બહાર કાઢ્યા. સાચો સનાતન ધર્મ અપનાવ્યો. તેના માર્ગદર્શક અને પ્રણેતા પુ. સંત શ્રી ઓધવરામજી મહારાજ હતા. તો શું આપણી કેન્દ્રીય સમાજ સનાતન ધર્મના પ્રચાર માટે કોઈ સાચા સંતને માર્ગદર્શક તરીકે ન નિમિ શકે?

જવાબ : તમારા પહેલા પ્રશ્નનો જવાબ ખરી રીતે તો આપણી કેન્દ્રીય સમાજના આજના ધુરીણોજ આપી શકે. તેમને આ પ્રશ્ન આપણે બધા સાથે મળીને પૂછવાનો છે અને તે સમય હવે આવી ગયો છે. તેઓને તેના જવાબો આપવા જ પડશે. તમારા બીજા પ્રશ્નના જવાબમાં અમારે એ કહેવાનું છે કે યોગ્ય વ્યક્તિ, સજ્જન સંત પુરુષની શોધ ચાલી જ રહી છે પણ આજના જમાનામાં એવા સંત પુરુષો સંત શ્રી ઓધવરામજી મહારાજ જેવા સંત પુરુષો મળવા કઠીન છે. આ સંત પુરુષોમાં અ પરિગ્રહતાની પહેલી જરૂરિયાત પડે છે. કોશિષ ચાલુ છે જરૂર મળશે.

ભારતીબેન રવાણી ખોંભડી

પ્રશ્ન : અમે દીકરીઓ જન્મથી લઈને ૨૦-૨૨ વરસ સુધી અમારા સનાતની પિતાની પાસો રહીને સનાતન વિચારધારામાં ઉછરીને સનાતન ધર્મ જ અમારો મુળ ધર્મ છે તેમ માની લઈએ છીએ પણ જ્યારે અમારા પિતાશ્રીઓ અમારા લગ્ન એવા પરિવાર સાથે કરાવે છે કે જેમણે બહારથી શ્રી લક્ષ્મીનારાયણ સનાતન સમાજમાં સભ્યો થઈને ગામમાં ચીઠ્ઠીઓ ફડાવી આવ્યા હોય છે પણ અંદર ખાનેથી પીરાણા સતપંથ ધર્મમાં ગળેડુબ હોય છે તો આ સમાજની અમારા જેવી દીકરીઓએ શું ગુના કર્યા છે કે લગ્ન પછી અમોને પીરાણા સતપંથ ધર્મ અપનાવવો પડે? આ શું સમાજની બે-ધારી અસ્પષ્ટ નીતિઓનું કારણ નથી? આવી બાબતોએ સમાજના વડીલો આંખ આડા કાન શા માટે કરી રહ્યા છે?

જવાબ : હિંમતભાઈએ અશ્રૃભીની આંખે જવાબ આપેલ કે દીકરી, તારા સવાલોના જવાબમાં હું કબુલ કરું છું કે અમ વડીલો જ તમારા ગુનેગારો છીએ કે સમજતા હોવા છતાં તમારા જેવી દીકરીઓને સનાતન ધર્મના સંસ્કારો આપી લગ્ન પછી પીરાણા મુસ્લિમ સતપંથ ધર્મના અનુયાયીઓમાં વગર વાંકે ધકેલી દેતા હોઈએ છીએ. આજે વડીલોના વાંકે દીકરીઓ ભોગવી રહી છે. તારી વાત બિલકુલ સાચી વાત છે કે કેન્દ્રીય સમાજ તેમજ ગામના સ્થાનિક સમાજોની મવાળ, અસ્પષ્ટ અને બે-ધારી નીતિઓને લીધે આજે આખો સનાતની સમાજ તેનો ભોગ બન્યો છે. અમારા પ્રયત્નો ચાલુ છે અને આપણને જરૂરથી સફળતા મળશે.

મંતવ્યો : શ્રી કાંતિભાઈ કરમશી રવાણી અને અન્ય યુવાનોએ સનાતન જાગૃતિ સમિતિના હિંમતભાઈ ખેતાણી અને તેમની સાથે આપેલ સૌ સહયોગીઓનો આભાર માનેલ અને આ અભિયાન કાર્યમાં તુમકુર પાટીદાર સનાતન સમાજ તેમજ અમ સૌ યુવાનો તન-મન અને ધનથી તમારી સાથે જ છીએ અને સાથે રહેશું. મારા મને આ એક જાગૃતિ અભિયાન છે તેને સતત ચાલુ રાખવું પડશે. જ્યાં સુધી કેન્દ્રીય સમાજ ઉપર સનાતની ઝંડો ન લહેરાવી શકીએ ત્યાં સુધી આ અભિયાન જારી રાખજો અને અમોને હાક મારજો અમો તમારી સાથે જ રહેશું. કાંતિભાઈ સ્થાનીક યુવક મંડળના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.

શ્રી ખીમજીભાઈ પોકાર નેલમંગલા

તુમકુર ગામની નજીકમાં નેલમંગલા શ્રી લક્ષ્મીનારાયણ સનાતન સમાજના પ્રમુખશ્રીએ તેમના મંતવ્યો આપતાં જણાવેલ કે ભાઈઓ અને બહેનો તમો તમારી જાતને એક પ્રશ્ન જરૂર પૂછજો કે તમો હિન્દુ સનાતની છો કે પછી મુસ્લિમ સતપંથી છો? આપણી જ્ઞાતિ કદાચ અણસમજમાં પીર ઈમામશાહ દ્વારા શરમજનક રીતે ઠગાણી પણ અત્યારે પીરાણા સતપંથીઓ દ્વારા આપવામાં આવતા છેતરામણા અને લોભામણા પ્રલોભનોમાં છેતરાજો નહીં.

શ્રી લાલજીંભાઈ ડાહ્યા છાભૈયા : તુમતુક પાટીદાર સનાતન સમાજના પ્રમુખ તેમજ આજની સભાના અધ્યક્ષે છેલ્લે તેમના મંતવ્યો આપતાં જણાવેલ કે આપણે ધાર્યુ નોતું તેવી સભા આજે થઈ. મારી વિનંતીને માન આપી સનાતન ધર્મ જાગૃતિ સમિતિવાળા ભાઈઓ આજે આપણી પાસે આવી આપણી કેન્દ્રીય સમાજ અને જ્ઞાતિનો સાચો ઈતિહાસ બતાવ્યો. આજે હવે સમય આવી ગયો છે. કેરી રૂપી સમાજના હથરામાં ચાંદી પડે તો આખો હથરો ખરાબ થઈ જાય. તેમ થાય તે પહેલાં ફેંકી દેજો ચાંદીવાળી કેરીને નહીં તો આખો હથરો ખરાબ થઈ જશે. આ સમાજમાં આજે સતપંથ રૂપી કુહાડાઓ ફરી રહ્યા છે. આપણે તેના હાથા બનશું તો આપણે સનાતનીઓ કપાઈ જઈશું. ચેતજો સનાતની ભાઈઓ ચેતજો. સભા અધ્યક્ષે ફરી પાછા સર્વેનો આભાર માની સૅભાની પૂર્ણાહુતી કરી હતી.

કચ્છ ભાજપના ઉપાધ્યક્ષપદે દેવજી માવજી લીંબાણી

ભુજ : પાલનપુર (બાડી) ના શ્રી દેવજી માવજી લીંબાણીની કચ્છ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ તરીકે વરણી થતાં તેમને ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

કેન્દ્રીય સમાજના ટ્રસ્ટી, ન્યાય સમિતિના ભૂતપૂર્વ ચેરમેન શ્રી દેવજીભાઈ લીંબાણી ભાજપ સાથે વરસોથી સંકળાયેલા છે અને નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખપદે પણ અગાઉ રહી ચૂક્યા છે. ભાજપના અધ્યક્ષ તરીકે અબડાસાના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ ભાનુશાળીની વરણી થયા બાદ જિલ્લા ભાજપની નવી ટીમમાં દેવજીભાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે.

realpatidar.com

realpatidar.com
Introducing a new era of business Hub in Gandhidham
SUZUKI
SUZUKI
If you have the will you have the deal
kutch|arcade
The Business Centre
ORGANIZER
RAMSONS PROPERTIES PVT.LTD.
Kutch Timbor Plot, National Highway No. 8A, Near Railway Crossing,
Gandhidham (Kutch) Phone No. : 99092 03030, 99092 08080 www.kutcharcade.com
realpatidar.com

https://archive.org/details/bk1396/page/n32/mode/1up

2010-03 -Patidar Saurabh (1396)

realpatidar.com

Madurai #History - Sanatan Dharm Jagruti

મદુરાઈની ગુજરાતી સમાજમાં પીરાણ[illegible] અપાતું નથી

મદુરાઈની જાગૃતિ સભામાં જૂઠાણાંઓનો પર્દાફાશ કરતા સનાતનીઓ

કર્ણાટકમાં સર્વત્ર સનાતન ધર્મ જાગૃતિ અભિયાનના જય જયકાર બાદ તામીલનાડુના મંદિરોની નગરી મદુરાઈ મુકામે મદુરાઈ ઝોન દ્વારા તા. ૧૦-૧-૧૦ના શ્રી સનાતન ધર્મ જાગૃતિ અભિયાન સભાનું આયોજન કરવામાં આવેલ જેમાં મદુરાઈ, સેંગોટા, રાજપાલ્યમ, ત્રીચી, ડીંડીગલ અને તેની આજુબાજુના ગામડાઓમાંથી પાટીદાર ભાઈ-બહેનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી.

શ્રી રવજીભાઈ હંસરાજ છાભૈયા (ડીંડીગલ)ના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સભામાં રાજપાલ્યમવાળા શ્રી ભવાનભાઈ મૈયાત વડીલ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

દરેક સભાની જેમ સનાતન ધર્મ જાગૃતિના સર્વ શ્રી રમેશભાઈ વાગડીયા (બેંગલોર), અબજીભાઈ કાનાણી (મુંબઈ), મોહનભાઈ વાગડીયા (બેંગલોર), રમેશભાઈ મુળજી ગોરાણી (બેંગલોર) અને હિંમતલાલ રતનશી ખેતાણી (મુંબઈ) એ તેમના ભાષણમાં આપણી કેન્દ્રીય સમાજના ઈતિહાસ, આપણી જ્ઞાતિના ઈતિહાસ તેમજ પીરાણા સતપંથ ધર્મ શું છે અને તેના જુઠાણા બાબતે વિચારો આપ્યા હતા. તદુપરાંત આપણી કેન્દ્રીય સમાજ સનાતન ધર્મ પ્રત્યે નિષ્ક્રિય શા માટે રહે છે તે પણ જણાવ્યું હતું.

આ સભામાં સતપંથ ભાઈ શ્રી મેઘજીભાઈ છાભૈયાએ પણ હાજરી આપી હતી અને સભામાં વિક્ષેપ નાખવાનો પ્રયાસ કર્યો હતો પણ સ્થાનિક ભાઈઓની સતર્કતાને લઈને એ ભાઈ વધારે કાંઈ કરી નોતા શક્યા અંતે તેમણે સભામાં જણાવ્યું હતું કે શરૂઆતમાં પુ. નારણજી રામજી લીંબાણીએ આપણી જ્ઞાતિને સુધારવા પ્રયત્નો કર્યા પછી ઘણા વરસે તમો આવો છો તો વચ્ચેના વરસોમાં તમે શા માટે ન આવ્યા અને તમે લોકો સનાતન ધર્મ જાગૃતિ માટે સતત આવ્યા હોત તો આપણી જ્ઞાતિ એક થઈને સનાતન ધર્મ પાળવા લાગી ગઈ હોત.

સતત ૩.૩૦ કલાક ચાલેલી સભાના અંતમાં પ્રશ્નોત્તરી રાખવામાં આવેલ તેમાં પુછાયેલ પ્રશ્નો અને તેના જવાબો નીચે પ્રમાણેના હતા. તેમના મંતવ્યો પણ સાથે આપેલા છે.

શ્રી કીશોરભાઈ દેવજી પોકાર ગડુલી – મદુરાઈ

તેમના મંતવ્યો આપતાં જણાવેલ કે થોડા વરસ અગાઉ શ્રી લક્ષ્મીનારાયણ ધર્મ પ્રચાર સમિતીવાળા સાથે કેન્દ્રીય સમાજના ભાઈઓ પણ અહીં આવેલા હતા ત્યારે તેમણે જે વાતો કરી હતી તે ખોટી હતી. આજે તમે આવ્યા છો ને આપણી સમાજના તેમજ જ્ઞાતિના ઈતિહાસ બાબતમાં વાતો કરીને અમારી આંખો ખોલી નાખી છે. અત્રે જે સભા ચાલી રહી છે તે મદુરાઈ સંયુક્ત ગુજરાતી સમાજનું મકાન છે. આ સમાજમાં પણ પીરાણા સતપંથ ધર્મ પાળતા હોય તેમને સભ્યપદ માટે પ્રવેશ નથી કારણ કે તેમને (અન્ય ગુજરાતીઓને) પણ ખબર છે કે પિરાણા સતપંથ ધર્મ એક મુસ્લીમ ધર્મનો ફાંટો છે.

શ્રી પુરસોત્તમ હંસરાજ છાભૈયા – કાદીયાનાના – ડીંડીગલ

પ્રશ્ન : ઈન્ટરનેટ બાબતે જે તમે માહિતી આપી તે વિસ્તારથી સમજાવો.

જવાબ : રમેશભાઈ માવજી વાગડીયાએ તેનો જવાબ આપતાં જણાવેલ કે તે એક અમેરિકામાં વસતા ગુજરાતીઓએ વિકસાવેલ સાઈટ છે. તે તમે www.gujaratilexicon.com ટાઈપ કરીને પીરાણા સતપંથ ધર્મ બાબતે માહિતી મેળવી શકો છો. તે સાઈટમાં જઈને આપ પીરાણા, સતપંથી, મુમના, મતિયા, ઈમામશાહ, સમાજ વગેરે શબ્દોની સાચી વ્યાખ્યા મેળવી શકો છો.

શ્રી મેઘજીભાઈ છાભૈયા – તિરપુર લક્ષ્મીપુર – સતપંથી

પ્રશ્ન : તમે જે કામ લઈને આવ્યા છો તે કામને અધુરું મુકશો નહીં, મુકી દેશો તો જે રેશે તેઓ મટી જશે. ઢીલા ન પડજો, જાલી રાખજો, દરેકને ગમે તે ધર્મ પાળવાની છુટ છે.

જવાબ : તેના જવાબમાં હિંમતભાઈએ ખુલાસો કરેલ કે સતપંથ ધર્મ એક મુસ્લિમ ધર્મ છે જેને પાળવો હોય તે પાળે પણ તે અમારા ભેગા રહીને નહીં.

શ્રી ખીમજીભાઈ માવજી ગોરાણી : રવાપર–મદુરાઈ

પ્રશ્ન : આજે ઘણી બધી માહિતી જાણવા મળી જે અમોને ખબર નોતી. નથી અમોને અમારી સ્થાનિક સમાજે જણાવેલ ન તો કેન્દ્રીય સમાજે આ બાબતે પ્રકાશ પાડેલ છે. અત્યારે કેન્દ્રીય સમાજનો ધર્મ શું છે, સભ્યપદ શું છે તે વાતથી અમો અજાણ છીએ. હવે પછી સનાતન ધર્મ બાબતે અમારા પર શું જવાબદારી નાખો છો?

જવાબ : આના જવાબમાં રમેશભાઈ માવજી વાગડીયાએ જણાવેલ કે આ એક સમાજમાં ધર્મ જાગૃતિ અભિયાન છે. જે સનાતન ધર્મનો પ્રચાર સમાજમાં કેન્દ્રીય સમાજના ધુરીણોને કરવો હતો તે કામ આજે અમે કરી રહ્યા છીએ. આ બાબતે કેન્દ્રીય સમાજ કાંઈજ સાંભળતી નથી. જે સતપંથ ધર્મનો ત્યાગ કરી આપણા વડીલોએ કેન્દ્રીય સમાજની સ્થાપના કરી હતી તેને આ સમાજમાં ફરી પાછા (સતપંથ ધર્મીઓને) છાવરવામાં આવે તો તે ક્યાંનો ન્યાય કહેવાય. સતપંથીઓ પાસે તો ૪૫૦ વરસ જુની સતપંથ સમાજ છે તે તેમને મુબારક પણ સનાતની ભાઈઓના પ્રશ્નો

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1396/page/n33/mode/1up

realpatidar.com

અને તેમના હિતોની રક્ષા તો આપણી કેન્દ્રીય સમાજને જ કરવી પડે. તે નથી કરતા તે માટે જ. અમો સમાજના જનસમુદાય પાસે આવ્યા છીએ. હવે તમે સાચી હકીકતો સાંભળી અને તમોને એમ લાગે કે અમો સાચા છીએ તો તમે સ્થાનીક લેવલે સનાતન ધર્મ બાબતે જાગૃત બનો અને કેન્દ્રીય સમાજને પણ જણાવી દો કે આપણી સમાજ સનાતની સમાજ છે અને તેનો પ્રચાર કરવો કેન્દ્રીય સમાજની ફરજમાં છે.

કીશોરભાઈ દેવજી પોકાર :

પ્રશ્ન : આટલા દિવસ સુધી તો અમે એમ સમજતા હતા કે આપણે બધા એક છીએ પણ આજે હકીકતો જાણ્યા પછી એમ થાય છે કે આપણે એક કેમ થઈ શકીએ?

જવાબ : સ્થાનીક વડીલ શ્રી વિસનજી બાપાએ જવાબ આપ્યો કે કેન્દ્રીય સમાજની ઢીલી, બે-ધારી નીતિઓને લીધે ધર્મ બાબતે આપણી આજની પેઢી અજાણ રહી ગઈ. રાજકારણમાં જેમ વોટીંગ રાજકારણ ચાલે છે તેમ આપણી સમાજમાં લઘુમતીઓને છાવરવાનું આપણી કેન્દ્રીય સમાજમાં પણ બન્યું છે. આપણે જાગૃત નહીં થઈએ તો સનાતની સમાજ તરીકે સ્થાપના થયેલ આપણી કેન્દ્રીય સમાજની મૂળ સનાતની તરીકેની ઓળખ પણ મટી જશે અને સતપંથીઓ તે સમાજ ઉપર ચડી બેસશે.

શ્રી દિક્ષિતભાઈ શીવજી ઉકાણી - ખોંભડી - ત્રીચીના પલ્લી

પ્રશ્ન :સમાજની કલમ ૧૮ અને ૧૯ શું છે અને તેનો સમાવેશ સમાજના બંધારણમાં શા માટે કરવામાં આવેલ?

જવાબ : રમેશભાઈ માવજી વાગડીયાએ જવાબ આપતાં જણાવેલ કે આપણે આ સમાજની સ્થાપના પહેલાં પીરાણા સતપંથ ધર્મ પાળતા હતા અને અન્ય જ્ઞાતિઓમાં આપણી છાપ મુમના મુસલમાન તરીકેની જ હતી. તેને ભુંસવા માટે કલમ ૧૮મીનો સમાવેશ કરવામાં આવેલ. તે અન્યવે આ સમાજના સભ્યનું બાહ્ય આચરણ જન્મથી મરણોત્તર સુધીનું હિન્દુનું રહેશે એવું સ્પષ્ટ લખાયેલું છે. તેથી આ સમાજનો કોઈ પણ સભ્ય મુસ્લિમ પીર ઈમામશાહના નામે ઉભા થતા મંદિરોમાં જાય તો તેનું બાહ્ય આચરણ હિન્દુનું નથી રહેતું તેવી જ રીતે આપણી સમાજના કોઈપણ સભ્યનું મરણ થાય ત્યાર પછી તેને અગ્નિદાહ દેવાને બદલે દફનાવવામાં આવે તો તેનું બાહ્ય આચરણ હિન્દુનું નહીં પણ મુસ્લિમનું થાય તેમ પુરવાર થાય. તે પ્રમાણે કલમ ૧૮ અંતર્ગત તે સભ્ય ગુનેગાર ઠરે છે અને ગુનેગાર તરીકે તેના પર સામાજિક કાર્યવાહી થવી જોઈએ તે નથી થતી. તેનું આ સમાજના સનાતની ભાઈઓને પારાવર દુઃખ છે.

તેજ પ્રમાણે કલમ ૧૯ એમ કહે છે કે જે ભાઈઓને ધાર્મિક અથવા તો સામાજિક પ્રશ્નો હોય તેઓને કોર્ટનો આશરો ન લેતાં પહેલાં સમાજને ઘાં નાખવી જોઈએ પણ તેમ ન કરતાં સતપંથી ભાઈઓ આડેધડ ખોટા કોર્ટ કેસો સમાજના સનાતની ભાઈઓ ઉપર કરી રહ્યા છે. અરે... આપણી કેન્દ્રીય સમાજના પ્રમુખ અને ટ્રસ્ટીઓ ઉપર પણ મનઘડીત કોર્ટ કેસો થયેલા છે.

શ્રી રવજીભાઈ હંસરાજ છાભૈયા - ડીંડીગલ - કાદીયાનાના

આજની સભાના અધ્યક્ષ અને મદુરાઈ ઝોનના અધ્યક્ષ

પ્રશ્ન : આપણી સમાજના અમુક ભાઈઓ સનાતની ભાઈઓની સાથે સગપણ કરતી વખતે પોતે સતપંથી હોવા છતાં મંદિરમાંથી ચિઠ્ઠીઓ ફડાવી આવે છે.

આવી બાબતો પર પ્રકાશ પાડશો.

જવાબ : રમેશભાઈ માવજી વાગડીયાએ તેનો જવાબ આપતાં જણાવેલ કે આવા માણસો તદ્દન જુઠા કહેવાય. જુઠ કી બુનીયાદ પર ખડા કીયા ગયા સતપંથ સમાજને પણ તેમના નિજી સ્વાર્થને માટે લઈને સગપણ -સાંતરાંમાં જુઠું બોલીને સનાતન ધર્મ (મંદિરવાળા) સમાજની ચિઠ્ઠીઓ ફડાવવી પડે છે અને આપણે તેઓ ફાડી દઈએ છીએં. આપણી આડસમાં રહીને તેંઓ પોતાને હિન્દુ કહેડાવે છે. તાકાત હોય તો આપણી સનાતની સમાજથી અલગ થઈ બતાવે કે પછી તેમની ઓળખ અન્ય જ્ઞાતિઓમાં હિન્દુની રહે છે કે મુમના મુસલમાન તરીકે રહે છે?

શ્રી પુરસોત્તમભાઈ હંસરાજ ડીંડીગલ

પ્રશ્ન : કેન્દ્રીય સમાજમાં ૧૮મી કલમનો અમલ ન થતો હોય તો અમારે શું કરવું?

જવાબ : ઓછામાં ઓછા ૧૦૦ માણસો (સભ્યોની)ની સહીઓ કરાવી કેન્દ્રીય સમાજને આ પ્રશ્ન પુછી શકો છો અને સામાન્ય સભામાં તેનો જવાબ લઈ શકાય.

શ્રી રવજીભાઈ હંસરાજ છાભૈયા - કાદીયા નાના - ડીંડીગલ

પ્રશ્ન : આજે અમારા કાદીઆ નાના ગામમાં ૨૫-૨૫ વરસથી કેસો ચાલે છે જેનું આજ દિવસ સુધી નિરાકરણ નથી આવ્યું તો આપણી સનાતની ઓળખ ધરાવતી કેન્દ્રીય સમાજ શું કરે છે?

જવાબ : કોટડા ગામના ૯ કેસો થયેલ. તેમાં કેન્દ્રીય સમાજે મધ્યસ્થી કરીને સમાધાન કરાવ્યું ત્યારે ભારતભરના તમામ કેસો સતપંથી ભાઈઓ ખેંચી લેશે એવી બાંહેધરી આપવામાં આવેલ પણ મધ્યસ્થી કરવા આવેલ કેન્દ્રીય સમાજે આજ દિવસ સુધી કોઈ પગલાં લીધા નથી. આજે જનજાગૃતિ કરીને કેન્દ્રીય સમાજ ઉપર કેસો પાછા ખેંચવાનું દબાણ કરવાની જરૂર છે.

શ્રીમતી રમીલાબેન લાલજી પોકાર - ડીંડીગલ - કાદીયાનાના

પ્રશ્ન : પીરાણા જઈએ છીએ ત્યારે મહિલાઓને માત્ર એક કલાક જ જવાની છુટ છે જ્યારે પુરુષોને આખો દિવસ માટે જવાની છુટ છે આવું શું કામ?

જવાબ : હીંમતભાઈ - બહેન આ તો પીરાણાવાળા જ જવાબ આપી શકે. આ તેમનો અંગત મામલો છે તમે તેની પાસેથી જ જવાબ લેશો તો સાચો જવાબ મળશે.

realpatidar.com

https://archive.org/details/bk1396/page/n34/mode/1up

realpatidar.com

જયશ્રીબેન શીવજી રામાણી – ડીંડીગલ

પ્રશ્ન : અમો એ પીરાણા સતપંથમાં વગર વિચાર્યે અજાણતાં દીકરી દઈ દીધી છે પણ અમે સનાતની છીએ. હવે શું કરવું?

જવાબ : હિંમતભાઈ હવેથી ચેતીને ચાલજો. ભવિષ્યમાં ધ્યાન રાખજો. જિંદગીનો સોદો કરી લીધો છે હવે શું થાય? હવે પછી ભવિષ્યમાં આવી ભુલો ન થાય તેનો ખ્યાલ રાખજો. દિકરીને જન્મથી લગ્ન સુધી ૨૦-૨૨ વરસ સુધી સનાતની સંસ્કૃતિમાં ઉછેરીને આપણે જ આપણા હાથે વિધર્મીઓને હવાલે કરી દઈએ તો આપણા જેવા અણસમજુ માણસો કેટલા?

શ્રી પુરસોત્તમ હંસરાજ છાભૈયા – ડીંડીગલ – કાદીયાનાના

પ્રશ્ન : અંધશ્રધ્ધાને હિસાબે સતપંથીઓ પીરાણાની માનતા રખાવે છે. ઘણી વખત અંધશ્રધ્ધાથી માનતા માનવા માટે પ્રચાર કરવામાં આવે છે અને જો માનતા ફળે તો મંદિર વાળામાંથી સતપંથી બની જાય છે તો શું કરવું?

જવાબ : હિંમતભાઈ શ્રધ્ધા વસ્તુ જ એવી છે. તમે પ્રાણ પ્રતિષ્ઠા કરેલા આપણી ઉમિયા માતાજી અથવા તો ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની ખરા ભાવથી માનતા માનસો તો તે પણ ફળશે જ અને ઘણા બધાને ફળતી પણ હશે પણ તેનો પ્રચાર કોણ કરે? પીરાણા સતપંથમાં આનો સુયોજીત પ્રચાર ચાલે છે જેથી કરીને વધારેમાં વધારે આપણા સનાતની ભાઈઓ પીરાણા તરફ આકર્ષાય અને વખત જતાં દર્શોદ-વિર્શોદના ચુંગલમાં ફસાઈ જાય.

શ્રી અશ્વિનકુમાર પ્રેમજી – મદુરાઈ ઝોનના મંત્રી શ્રી

પ્રશ્ન : કેન્દ્રીય સમાજ કોઈ પણ પ્રશ્નોના જવાબ ન આપે અને બે જવાબદારીભર્યું વર્તન કરે તો શું કરવું?

જવાબ : સામાન્ય સભામાં ટેકેદારો ઉભા કરીને આ પ્રશ્નો પુછી શકાય અને તેના ખુલાસાઓ કેન્દ્રીય સમાજ પાસે માગી શકાય.

છેલ્લે મદુરાઈ ઝોનના વડીલ શ્રી ભવનજી લખમશી મૈયાતે પોતાનું મંતવ્ય આપતાં જણાવ્યું કે આજે હું બે વાત તમોને કહેવા માંગું છું. પહેલી વાત એ કે આપણા વડીલો સતપંથ ધર્મ મુકીને સનાતન ધર્મ અંગીકાર શું કામ કર્યો? કારણ કે તેઓએ પિરાણા સતપંથ મતમાં જે જે જોયું તે આપણી જ્ઞાતિના હિતમાં નથી એમ તેઓને લાગ્યું એટલે તેને સદાયને માટે તિલાંજલી આપી સનાતન ધર્મનો અંગીકાર કર્યો.

બીજી વાત એ કહેવા માગું છું કે હું જ્યારે નાનો હતો ત્યારે પીરાણેથી કાકા કચ્છમાં આવ્યા હતા ત્યારે તેના ગાડાનો એક બળદ મરી ગયો. તેને આપણા લોકો મારફત દટાવ્યો અને તેની કબર કરવામાં આવી અને આપણી વહુ-દીકરીઓને તેની માનતા મનાવા લાગ્યા. આ બીજું કાંઈ નહીં પણ અંધશ્રધ્ધાની પારાકાષ્ટા જ હતી.

સભા અંતે યુવાન બહેનો સનાતન ધર્મ જાગૃતિ સમિતિના ભાઈઓને મળીને આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે આજે તમોએ અમારી આંખો ખોલી છે. હવેથી અમો પ્રેમદાસ બાપુની કહેવાતી શિબિરોમાં જોડાવવા અમોને મોકલવામાં આવતી તેમાં હવે પછી નહીં જઈએ. એવો આત્મવિશ્વાસ તેઓમાં આ સભા પછી નિર્માણ થયો હતો.

❖

નડીઆદમાં વસંત પંચમીના ૪૮ નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડયા

નડીઆદ મુકામે સ્થાનિક સમાજ દ્વારા વસંત પંચમીના યોજાયેલ દસમા સમૂહલગ્ન સમારોહમાં ૪૮ નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.

૪૮ વરરાજાઓને ૧૨ બગીમાં બેસાડીને સવારના નડીઆદના રાજમાર્ગ પર કાઢવામાં આવેલ શોભાયાત્રા (વરઘોડો) એ ભારે આકર્ષણ જમાવ્યું હતું. સંતરામ મંદિરથી પધારેલ સંતશ્રી નિર્ગુણદાસજી મહારાજે નવદંપતિઓને શુભાશિષ પાઠવી સૌથી ઉત્તમ ગૃહસ્થાશ્રમનું મહત્વ સમજાવેલ.

આયોજન સમિતિ પ્રમુખ શ્રી ધનજીભાઈ સાંખલાએ સ્વાગત પ્રવચન કરેલ. કેન્દ્રીય સમાજના ટ્રસ્ટી શ્રી વાલજી શીવજી વાડીયા, સત્સંગ સમાજના પ્રમુખ શ્રી ખીમજીભાઈ પોકાર સહિતના સમાજના અગ્રણીઓએ આ પ્રસંગે ખાસ હાજરી આપી આયોજકોનો ઉત્સાહ વધાર્યો હતો.

realpatidar.com

https://archive.org/details/bk1396/page/n35/mode/1up

realpatidar.com

પાટીદાર દર્શન

શ્રી અખિલ ભારત કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના આંખે દેખ્યા સમાચારોનું માસિક માધ્યમ

પરિવર્તન એ સંસારનો નિયમ છે. બદલાતા સમયમાં પાટીદાર સમાજ જ્યારે દરેક ક્ષેત્રમાં હાઈટેક થવા જઈ રહ્યો છે. ત્યારે અમો પણ બદલાતા સમય સાથે કદમ મિલાવીને શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના સમાચાર ક્ષેત્રે ઈલેક્ટ્રોનિક મિડીયા (આંખે દેખ્યો અહેવાલ) ની આપના સહકારથી શુભ શરૂઆત નાગપુર બાદ હવે પછી મહાનગરી મુંબઈથી દર મહિને નિયમિત રીતે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ.

ઈલેક્ટ્રોનિક્સ મિડીયા : પાટીદાર દર્શન અખિલ ભારતભરની સમાજોમાં બનતા બનાવો, આપણી પાટીદાર જ્ઞાતિમાં પરંપરાગત રીતે ઉજવાતા તહેવારો, સમાજમાં યોજાતા ધાર્મિક પ્રસંગો, પાટીદારોની જુની સાંસ્કૃતિક રીતે ઉજવાતા કચ્છમાં સાતમ-આઠમના તહેવારો, કેન્દ્રીય સમાજ, યુવા સંઘ અને મહિલા સંઘના સમાચારો કવરેજ કરી દર મહિને તેની ડી.વી.ડી. બનાવીને સમાચાર સ્વરૂપે (ઝી.ન્યુઝ, આજતક ટી.વી. ન્યુઝ, સહારા સમાચાર ચેનલ જેવીજ પાટીદાર સમાજના સમાચારોની ચેનલ સ્વરૂપે) પ્રસ્તુત કરવામાં આવે છે.

વિશિષ્ટાતા : સમાજમાં ઉજવાતા પ્રસંગો તેમજ બનતી દરેક ઘટના આપણે વાંચી હોય - સાંભળી હોય પણ આમાં પ્રત્યક્ષ જોઈ શકાશે. - ગુજરાત બહાર વસતા પરિવારના બાળકો આપણી માતૃભાષા ગુજરાતી વાંચી નથી શકતા તેવા બાળકો માટે આશીર્વાદ સમાન છે. - સહ પરિવાર સાથે બેસી જોવાનો અનેરો આનંદ માણી શકાય છે. - ઉચ્ચ ગુણવત્તા ડી.વી.ડી. હોવાથી સ્ક્રેચ થવાનો કે બગડવાનો ભય રહેતો નથી, તેથી આપણી ભાવી પેઢી માટે ઈતિહાસ તરીકે વર્ષોના વર્ષ સાચવી શકાય અને જોઈ શકાય.

વધારે માહિતી માટે મળો અથવા ફોનથી સંપર્ક કરો : જયંતિ એમ. પારસીયા,
પાટીદાર દર્શન. હાઈવે આશીર્વાદ કો.ઓ. હાઉસીંગ સોસાયટી. બેસમેન્ટ-૨, નિતિન કંપની સર્કલ,
હોટલ રોયલ ચેલેન્જની બાજુમાં, થાણા (વે.) મુંબઈ-૪૦૦૬૦૪
Ph. 022-25432821 Mob. 09422146606, 09595524585, e-mail - patidardarshan@gmail.com.

|| શ્રી ગણેશાય નમ: || || OM SAI RAM || || શ્રી ઉમિયાયે નમ: ||

શ્રી પાટીદાર ડેવલોપર્સ–નખત્રાણા આયોજીત

પાટીદાર નગર – દસમો ડ્રો તા. ૧૪/૦૨/૧૦

Reg. No. Guj-Rjt 63241

મુખ્ય ઈનામ : ટેનામેન્ટ બંગલો, ટોકન નં. ૯૩૮

:: આશ્વાસન ઈનામો ::

નો. કલર મોબાઈલ	૯૩૭/૯૩૯	ડીવીડ પ્લેયર	૯૩૦	ટેબલ ફેન	૨૭૫
કોમ્પ્યુટર સેટ	૩૨૨	ડ્રેસીંગ ટેબલ	૭૫૬	સોનાનો પેન્ડલ	૨૫૧
૨૧ ઈંચ કલર ટીવી	૫૨	સેટી પલંગ	૯૨૯	એર કુલર	૬૭૮
૧૮૫ લી. ફ્રીઝ	૭૩૫	મીક્ષ્ચર	૧૫૪		

ટ્રોલી બેગ-૧૫	: ૧૭૭, ૫૪૦, ૩૧૦, ૫૪૨, ૩૮૬, ૫૩૩, ૪૧૪, ૮૬, ૬૯, ૬૧૪, ૭૫૧, ૮૧૦, ૩૪૦, ૬૫, ૬૯૩
ઈલેક્ટ્રીક પ્રેસ-૧૫	: ૫૨૩,૭૬૫,૩૨૧,૧૧૦,૧૬૯, ૯૪૧, ૬૬૧, ૪૪૮, ૪૫૦, ૩૪૮, ૭૦૮, ૪૬૨, ૯૭૯, ૨૮૩, ૨૩૩
સોડા મેકર-૧૫	: ૧૯૪, ૫૮૨, ૪૧૨, ૪૮૧, ૬૮૬, ૬૧૯, ૯૭૧, ૫૨૪, ૭૮, ૧૬, ૫૩૧, ૨૫૨, ૩૪, ૬૪૮, ૧૬૫
ટોસ્ટર-૧૫	: ૨૧,૧૪૧,૮૯૬, ૯૨૮, ૫૩૫, ૩૨૬, ૫૪૯, ૪૭૧, ૯૨૬, ૪૪૧, ૪૯૯, ૨૫૬, ૫૮૧, ૧૬૭, ૬૧૮
ડીનર સેટ-૧૫	: ૪૯૧,૯૯૨,૮૮૧,૧૧૭,૨૬૧, ૪૭૦, ૨૧૦, ૫૫૨, ૮૧૫, ૬૯૭, ૯૦૧, ૩૮૧, ૩૮૯, ૪૩૭, ૩૯૭
હેન્ડ બ્લેન્ડર-૧૫	: ૯૮૫, ૭૦૦, ૩૦૩, ૯૦૨, ૩૧, ૪૭૯, ૬૭૪, ૯૪૫, ૭૪૬, ૨૬૨, ૩૨૦, ૫૮૯, ૩૩૫, ૬૨૯, ૩૩
વોટર જગ-૧૫	: ૭૨૮,૩૪૯,૭૧૨, ૯૭૬, ૫૦૪, ૪૭૪, ૬૭, ૧૭૬, ૩૦૦, ૧૫૨, ૨૪૩, ૩૭૯, ૩૯૬, ૨૯૯, ૯૪૬

realpatidar.com

realpatidar.com

Joravarnagar
Sanatan Dharm
Jagruti #History

સંતો અને [illegible]ષ્ટ્રમાં પ્રથમ સભા યોજાઈ

જોરાવરનગરમાં સનાતન ધર્મ જાગૃતિનો શંખનાદ ફુંકાયો

દક્ષિણ ભારતમાં સનાતન ધર્મ જાગૃતિનો શંખનાદ કર્યા બાદ શૂરા અને સંતોની ભૂમિ સૌરાષ્ટ્રના જોરાવરનગર ખાતે સનાતન ધર્મ પ્રચાર સમિતિ દ્વારા સભાનું આયોજન કરવામાં આવેલ જેમાં સમગ્ર સૌરાષ્ટ્રના ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.

ગાંધીધામવાળા શ્રી કરસનભાઈ પ્રેમજી મેઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ જાગૃતિ સભામાં સર્વ શ્રી હિંમતભાઈ ખેતાણી (મુંબઈ), રમેશભાઈ વાગડીયા (બેંગલોર), ડૉ. પ્રેમજીભાઈ પટેલ (ગાંધીધામ), ચંદુભાઈ પોકાર (મોરબી), મનસુખભાઈ (ધનસુરા), ખીમજીભાઈ ધોળુ (મોડાસા), રેવાલાલ પાટીદાર (મુન્દ્રા), ચંદ્રકાન્તભાઈ (જસદણ), ભીમજીભાઈ (રાજકોટ), હરીભાઈ ભગત (મોરબી), પ્રેમજીભાઈ કેશરાણી (મુંબઈ), વસ્તાભાઈ (મોરબી) સહિતના અગ્રણીઓએ ભાગ લીધો હતો અને માર્ગદર્શન આપ્યું હતું.

સભાની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી. ત્યારબાદ જોરાવરનગરની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. સ્વાગત પ્રવચન ધીરજભાઈ ડાયાણીએ કર્યું હતું.

રમેશભાઈ વાગડીયાએ સભાનો હેતુ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે આજે સમાજ ૫૦ વરસની થઈ પણ તે પહેલાં પણ સમાજ હતો. સમાજની સ્થાપનાની જરૂર શા માટે પડી? ક્યા ઉદ્દેશો, ક્યા હેતુથી સમાજની સ્થાપના થઈ? કેન્દ્રીય સમાજ આ ઉદ્દેશોનું પાલન કરે છે?

નખત્રાણા ખાતેની તા. ૭-૮-૨૦૦૯ની સભાની ચિનગારીના ફલસ્વરૂપે આવી જાગૃતિ સભાનું આયોજન થઈ રહ્યું છે. તેમનો કહેવાનો સારાંશ એવો હતો કે આપણી જ્ઞાતિ આપણે જાણીએ છીએ

જોરાવરનગરની સભામાં સનાતની આગેવાનોને સાંભળવા સૌરાષ્ટ્રભરમાંથી સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા

તેમ પંજાબથી ગુજરાત અને ગુજરાતથી પીરાણાપંથ અપનાવવાથી હિન્દુઓથી હડધૂત થઈને કચ્છના વેરાન પ્રદેશમાં જવું પડ્યું. પીરાણાપંથના ચુંગાલમાં ફસાતા ગયા, દશાંસ, વિશાંસ ભરીને વડવાઓ તૂટી મર્યા. આપણી જ્ઞાતિ મુમનાઓ તરીકે ઓળખાવા લાગી.

ધર્મની જાગૃતિ ૧૮૩૨માં પ્રાગજી કાકા તેમજ નેત્રાના કેશરા પરમેશ્વએ આપી. પછીથી ૧૯૩૨માં નારણજી બાપા વિરાણીવાળાનો જન્મ થયો અને તેઓ સમાજમાં ધર્મની જાગૃતિ લાવ્યા. તેનાથી આપણે સૌ વિદિત છીએ. કચ્છ છોડીને કમાવવા બહાર નીકળ્યા પછી જ ધર્મ સમજમાં આવ્યો અને ધર્મ જ જાગૃતિ થઈ. ૧૯૨૦માં યુવા મંડળની સ્થાપના થઈ. કરાંચીમાં પહેલી પરિષદ, ૧૯૨૧માં દિલ્હીમાં બીજી પરિષદ અને ત્રીજી પરિષદ ઘાટકોપરમાં થઈ. આના ઘણા સારા પરિણામો આવ્યા. પણ સંપૂર્ણ સફળતા મળી નહીં.

સમાજની સ્થાપનાને ૫૦ વર્ષ થયા, તેના શરૂઆતના વર્ષના સમાજના કર્ણધારો કે આગેવાનો પીરાણાપંથના પ્રસંગો કે ઉત્સવોમાં ગયા ન હતા, પણ છેલ્લા ૧૫ વર્ષમાં સમાજની સ્થાપના સનાતન સમાજે કરી છે તે ભૂલાઈ ગયું. તેથી કેન્દ્રીય સમિતીની નીતિ સ્પષ્ટ થતી નથી. કેન્દ્રીય સમાજ જાગૃત કરવાની આ સભા છે. મૂળભૂત બંધારણનું પાલન એટલે કલમ ૧૮ અને ૧૯નું પાલન થવું જોઈએ.

સમાજનો અર્થ સમજાવતાં તેણે કહ્યું હતું કે વૈદિક તેમજ સમાજ સ્તરે - સમાજ એટલે વ્યવસ્થિત લોકોનો જન સમુદાય

- એક જ ધર્મ, એક જ રીત રિવાજ
- એક જ આચાર-વિચારમાં માનતો હોય.

આ ત્રણે શરતો જરૂરી છે. આ બાબત કેન્દ્રીય સમાજની નીતિ સ્પષ્ટ કરે તેવી એમની માંગણી હતી. બીજું પીરાણા દ્વારા ખોટા કોર્ટ કેસો કરવામાં આવ્યા છે તે સત્વરે પાછા ખેંચવામાં આવે.

ત્યારબાદ ધનસુખભાઈ રંગાણી ધનસુરાવાળાએ પોતાના વક્તવ્યમાં કહ્યું

realpatidar.com

realpatidar.com

હતું કે ૧૯૭૭ પછી આપણી સમાજને લૂણો લાગ્યો છે. હિન્દુ ધર્મનો અવિભાજ્ય શબ્દ "સનાતન" કાઢવાની વાત થઈ, જે લાંછનરૂપ છે. સતપંથીઓ સમાજને જાણ કર્યા વગર કેસો કરે છે જે સમાજના બંધારણ વિરુધ્ધ છે.

ડૉ. પ્રેમજીભાઈ ઘોઘારીએ કહ્યું હતું કે આજની સભા સમાજની સુષુપ્ત અવસ્થાથી જાગૃતિ માટેની છે. કેન્દ્રીય સમજ દહીં-દૂધમાં પગ રાખવા માગે છે.

અબજીભાઈ કાનાણીએ વક્તવ્યમાં પ્રશ્ન કર્યો હતો કે શું સમાજ ધર્મથી અલગ છે? બંધારણમાં સ્પષ્ટ છે કે સમાજથી ધર્મ અલગ નથી, છતાં જન જાગૃતિ કરવી પડે છે. સમાજના હોદ્દેદારોને અંદરથી ડર છે.

પ્રેમજીભાઈ કેશરાણી (મુંબઈ) એ પોતાના મંતવ્યમાં જણાવેલ કે "સનાતન ધર્મ" પાંડવ કાળથી એટલે કે પાંચ હજાર વર્ષથી ચાલ્યો આવે છે. સતપંથની સ્થાપના ૧૪૫૯માં ઈમામશા બાવાએ કરી. પણ હવે જાણવાની જરૂર છે. ૫૦૦ વર્ષના વિચારો ભૂસાતાં વાર લાગે. સતપંથ ધર્મની ખૂબ ઉંડાણથી સમજણ આપી છે.

ખીમજીભાઈ ધોળુ (મોડાસા)એ રૂપાલ કંપામાં સંતો પર થયેલા કેસો માટે સંગઠીત થઈ લડવું જોઈએ. એવો ભાવ વ્યક્ત કર્યો હતો.

ચંદુભાઈ પોકાર (મોરબી) એ પોતાનું મંતવ્ય આપતા જણાવ્યું હતું કે નારણબાપા અંધારામાંથી અજવાળામાં લાવ્યા, મંદિરો બનાવ્યાથી પુરું થતું નથી. જાગવાની જરૂર છે. હળવદ ગામના બનાવતીજાણ થતાં તેણે સખ્ત શબ્દોમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો. હળવદમાં એક સતપંથ ભાઈએ આજની સભામાં એટલે કે જોરાવરનગરની સભામાં કોઈએ જવાનું નથી અને જશે તેને હું જોઈ લઈશ, એવી ધાક-ધમકી આપી હતી. આવું સમાજમાં કેમ ચલાવી લેવાય? હળવદના એક પણ વ્યક્તિએ સભામાં હાજરી આપી નહીં.

ચંદ્રકાંત સેંઘાણી (જસદણ)એ જણાવ્યું હતું કે ૨૦ ટકા સતપંથી સમાજને સમજાવીને ડાયવર્ટ કરવા જરૂરી છે. નહીં તો ભવિષ્યમાં સમાજના ભાગલા પડતા વાર નહીં લાગે.

ભીમજીભાઈ (રાજકોટ)એ પોતાના વક્તવ્યમાં ઈતિહાસને દોહરાવતાં જણાવેલ હતું કે, હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે શીવાજી મહારાજે જીવન રેડી દીધું. નારણજી બાપા, કેશરા પરમેશ્વરાએ જાગૃતિ લાવી. સ્વર્ણિમ મહોત્સવ આવતો હોઈ, સનાતની ઉપરના કેસોનો તાત્કાલિક નિકાલ આવવો જોઈએ.

હરીભાઈ ભગત (મોરબી)એ સમાજને જાગૃત કરવાની વાત કરી, સતપંથવાળાને વિકલ્પ આપવાની વાત કરી, કામ કરી બતાવો તો તે સનાતન તરફ આપ મેળે ખેંચાશે...

આ સિવાય પુનમભાઈ ધોળુ, રેવાલાલભાઈ પાટીદાર, પ્રેમજીભાઈ તથા દેવજીભાઈએ પોતાનાં મંતવ્યો આપ્યા હતા.

અંતમાં પ્રમુખ સ્થાનેથી કરશનભાઈ (ગાંધીધામ)એ મીટીંગના ઠરાવો કેન્દ્રમાં રજૂ કરવાનું સૂચન કર્યું હતું. છેલ્લા ૧૦ વર્ષની એક નીતિ ઉપર શંકા વ્યક્ત કરી હતી. સમાજના નીતિ નિયમો પળાય તો તે સમાજનો સભ્ય ગણાય તેમ જણાવ્યું હતું. ટુંકમાં સમાજ બંધારણના કલમ ૧૮-૧૯નું પાલન થવું જોઈએ અને સતપંથીઓ દ્વારા થયેલા કેસો તાત્કાલિક પાછા ખેંચાવા જોઈએ. સવાલ પણ કર્યો હતો કે કેસો પાછા ન ખેંચાય અને મોડાસા માતાજીની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા ન દે તો શું કરવું? આ માટે વિચારવું જરૂરી છે.

અંતમાં આભાર વિધી રામજીભાઈ ભીમજી ડાયાણીએ કરી હતી. આ સભાના ભોજનના દાતા "આશાપુરા ટીમ્બર માર્ટ" જોરાવરનગરનો આભાર માન્યો હતો.

આ સમગ્ર સભાનું સફળ સંચાલન સમાજના મંત્રી બાબુલાલ લખમશી વાસાણી અને ધીરજ ડાયાણીએ કર્યું હતું.

■ એક ગ્રાહકે દુકાનદાર પાસે મચ્છર મારવાની ગોળી માગી.
દુકાનદારે એને ગોળી આપી.
ગ્રાહક : આ ગોળીનો ઉપયોગ કેવી રીતે કરવાનો?
દુકાનદાર : મચ્છરને પકડીને આ ગોળી તેના મોંમાં નાખવાની એટલે મચ્છર મરી જશે.



realpatidar.com

https://archive.org/details/bk1396/page/n38/mode/1up

ચિંતન

realpatidar.com

પરિસ્થિતિની લાચારીથી ઘણી વાર માણસને ન ગમતું પગલું પણ ભરવું પડતું હોય છે...

■ સ્વામી સચ્ચિદાનંદ

એક ઔદીચ્ય બ્રાહ્મણ તલાટીની સરકારી નોકરી કરે. આ ભાઈ એક તુરીબાઈના સંપર્કમાં આવ્યા અને પ્રેમમાં પડ્યા. બંનેએ લગ્ન કર્યાં. હાહાકાર થઈ ગયો. બ્રાહ્મણ થઈને તુરી (અછૂત) કન્યાને પરણે તે કેમે કરીને લોકો સહન ન કરી શક્યા. બધાએ તેનો બહિષ્કાર કર્યો. માણસ સમાજ વિનાનો રહી ન શકે. આ ભાઈએ કંટાળીને થાકીને ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો. તેનું નામ શેખ અબ્દુલ્લા રાખ્યું. બાપનું નામ અણદાભાઈ હતું તેથી અબ્દુલ્લા અણદા નામથી બધા ઓળખે. જેમ જિન્ના સાહેબના પિતા પૂજાભાઈ ઝીણાભાઈ હતા તેથી ઝીણા અટક થઈ ગઈ. ઉર્દૂવાળાએ તેને જિન્ના બનાવી દીધું. શેખ અબ્દુલ્લાના ધર્મપરિવર્તનની ખબર નવાબ સાહેબને પડી. ત્યારે આવું ધર્મપરિવર્તન થતું નહિ. તેમાં પણ બ્રાહ્મણ મુસલમાન થાય તે તો આકાશ તૂટવા જેવું લાગે. નવાબે તરત જ હુકમ કરીને તેને તલાટીમાંથી સર્કલ ઈન્સ્પેક્ટર બનાવી દીધો. હવે તેનું માનપાન વધી ગયું. મુસ્લિમ સમાજે તેને પૂરેપૂરો સ્વીકારી લીધો. પેલી બાઈ ગુજરી ગઈ અને ભાઈ વિધુર થઈ ગયા. ઊંડે ઊંડે બ્રાહ્મણના સંસ્કાર ખરા. પરિસ્થિતિની લાચારીથી ઘણી વાર માણસને ન ગમતું પગલું પણ ભરવું પડતું હોય છે. વિધુર થયા પછી તેની ઈચ્છા ખરી કે હિન્દુઓ ખાસ કરીને બ્રાહ્મણો મને પાછો અપનાવી લે. પણ હિન્દુપ્રજા પાસે એક્ઝિટ તો છે, એન્ટ્રી નથી. તે નિરાશ થઈ ગયો. પાછલી જિંદગીમાં તેને ઈચ્છા થઈ હનુમાનજીનું મંદિર બનાવવાની. નજીકના જ એક નાના ગામમાં તેનું આયોજન થયું. સ્થાપનાની વિધિ કરવા માટે ગટાગોરને બોલાવ્યા. ગટાગોર મને સાથે લઈ ગયા. અમે બધી વિધિ કરતા હતા ત્યારે થોડે દૂર શેખ અબ્દુલ્લા અણદા ખાટલા પર બેઠા હતા. આજે પણ મને તે દૃશ્ય યાદ છે. કેટલી કરૂણતા, કેટલી નિરાશા, આવો ધર્મ અને આવો સમાજ હજી પણ ટકી રહ્યો છે તે જ નવાઈની વાત કહેવાય. ત્યારે તો મને કશી સમજણ ન હતી પણ હવે બધું સમજાય છે કે હિન્દુપ્રજા ગુલામ કેમ બની.

રામલીલા

ગામમાં કોઈ કોઈ વાર રામલીલા કરવા તરગાળાની મંડળી આવતી. પહેલાં મામલતદારની રજા લે પછી ચોરા આગળ વાંસડા ખોડી પડદા લગાવે. મોટા ભાગે ધાર્મિક કે પછી ઐતિહાસિક નાટકો ભજવે. ૧-૨ પેટ્રોમેક્સના અજવાળામાં નાટક થાય. પુરુષો જ સ્ત્રીપાત્ર થાય. આખું ગામ નાટક જોવા ઉમટી પડે. નાટક શરૂ થયા પછી તરત જ આવતીકાલનું સીધું બોલવામાં આવે. કોઈ લોટ બોલે, કોઈ ગોળ બોલે, કોઈ ઘી-તેલ બોલે. જલદી સીધું બોલાય નહિ. શ્રીમંત લોકો નાટક જોવા આવે નહિ. તેમને કલા ને બલા બધું સરખું લાગે. તે ભલે ને તેમનો વ્યાપાર ભલો. થોડી નાનમ પણ લાગે. અરે, શેઠ, તમે પણ જોવા આવ્યા !! લોકોને નવાઈ લાગે. જે આવે તે મધ્યમવર્ગ કે ગરીબ વર્ગના આવે. તેમના પોતાના જ સીધાનું પૂરું ઠેકાણું ન હોય. કેટલાક લોકો રામભરોસે બોલે પણ જરૂર આવી જાય. કલાક દોઢ કલાક સીધું બોલવામાં જ વીતી જાય. પછી નાટક શરૂ થાય. લોકોને બહુ મજા પડે. મનોરંજનનું બીજું કોઈ સાધન જ ન હતું. વચ્ચે ગીતો આવે. તેમાં જે ગીત લોકોને ગમે તેની "વન્સમોર" બોલાય. અર્થાત્ ફરીથી ગાવ. ફરીથી ગવડાવા માટે રૂમાલમાં પૈસા બાંધીને ચોકમાં ફેંકવા પડે. કેટલીક વાર બે પક્ષો પડી જાય. "કટ" કરાવનારા પણ નીકળે. તે પણ રૂમાલમાં પૈસા બાંધીને ફેંકે. ચડસાચડસી થાય. નાટકવાળાને સારી કમાણી થાય. આ તરગાળા કલાકારોમાં કેટલાક ખરેખર અદ્ભુત કલાકારો રહેતા. પણ કલાની કદર કરનારા ક્યાં રહેતા ! આખી જિંદગી સીધું માગી માગીને પૂરી થતી. પશ્ચિમે નાટકોની ટિકિટ લગાવી. તેમન ત્યાં કશું મફત નહિ. આપણે ત્યાં બધું મફત. ટિકિટના કારણે કલાકારોને મોટી રકમ મળતી થઈ. નાટક કંપની પણ કમાતી થઈ અને દર્શકોની કક્ષા પણ ઊંચી થઈ. આઠ-દસ દિવસ નાટક કર્યા પછી ઉઘરાણું શરૂ થાય. જે મળે તેમાં સંતોષ કરીને વિદાય થાય.

માતાજીનો ઓટલો

એક વાર એવું બન્યું કે હું મારી બાથી રિસાઈને માતાજીના ઓટલે બેઠો હતો. માતાજીનો ઓટલો બહુ મોટો ત્યાં સૌને જગ્યા મળે. સવારથી સાંજ સુધી કોઈનું કોઈ બેઠું જ હોય. આપણે ત્યાં ઓટલો બનાવવાની પ્રથા હતી તે "સીટિંગરૂમ"ની ગરજ સારે. ઘરના માણસો નવરાં થાય કે તરત જ ઓટલે જઈને બેસે. આડોશપાડોશના લોકો પણ બેસવા આવે. ગપ્પાં ચાલે. ચર્ચા ચાલે. માણસે એક ગપ્પાં મારવાની પણ જગ્યા રાખવી જોઈએ. જગ્યા એટલે માત્ર ભૌતિક જગ્યા જ નહિ, પણ તમારી કક્ષાનો માણસ. એવો માણસ જેની આગળ તમારી બુધ્ધિનો વિકાસ થાય. પણ હા, આ ઓટલા માટે કહેવત પણ પડેલી હતી - "ચાર મળે ચોટલા તો કોઈના ઉખાડે ઓટલા." અર્થાત્ ચાર સ્ત્રીઓ ભેગી થાય. તો કોઈનું ઘર ઉજ્જડ કરી નાખે. ત્યારે સ્ત્રીઓએ કામ એટલું બધું રહેતું કે વાત કરવાનો સમય ન મળતો. સંયુક્ત કુટુંબના જીવનમાં વાતો ઘણી હોય. ક્યાં કરવી? કોને કરવી? વાત કર્યા વિના મન અશાંત થઈ જાય. સ્ત્રીઓ વાત કર્યા વિના રહી ન શકે એટલે તે માટેની ત્રણ જગ્યાઓ હતી : ૧. પાણી ભરતાં, ૨. દેવદર્શન

realpatidar.com

https://archive.org/details/bk1396/page/n39/mode/1up

realpatidar.com

કરતાં અને ૩. ઓટલા પર બેસીને. સ્ત્રીઓ પાછી અભણ અને લાગણીશીલ. સ્ત્રીઓની રાગાત્મક લાગણીઓ ઘણી. એ કોઈના પ્રત્યે ઢળે તો આંખ બંધ કરીને ઢળી પડે. પછી જુએ નહિ કે આ કૂવો છે - તેમાં ન પડાય. સ્ત્રીઓની દ્વેષાત્મક લાગણીઓ તો તેથી પણ વધુ તીવ્ર. જેના પ્રત્યે દ્વેષ થઈ જાય તેના પ્રત્યે ગમે તે પગલાં ભરી બેસે. સંયુક્ત કુટુંબમાં રાગ થવા કરતાં દ્વેષ થવાના કારણો વધુ હોય. અહીંથી ભડકા થાય અને ઘર બળીને ખાખ થઈ જાય. એટલે આવી કહેવત પડી હશે.

હાં, તો હું રિસાઈને માતાજીના ઓટલે બેઠો હતો. હું જ્યારે જ્યારે મારી બાથી રિસાતો ત્યારે ત્યારે આ ઓટલે આવીને બેસતો. થોડી વાર પછી મારી બા મને મનાવવા આવતી અને લઈ જતી. તેના મૃત્યુ પછી હું કદી રિસાયો નથી. રિસાવાની જગ્યા હોય તો જ માણસ રિસાય. જેને મનાવનારું જ કોઈ ન હોય તે કોની પાસે રિસાય? લડવું-ઝઘડવું અને રિસાવું એ જુદી વસ્તુ છે. લડાઈ-ઝઘડાથી સંબંધ તૂટે, રિસાવાથી સંબંધ ન તૂટે. કારણ કે બંને તરફ પ્રેમ તો હોય. સમય જતાં બંને એકનાં એક થઈ જાય. હા, એક કરનારું કોઈ હોય તો. પહેલા પત્ની રુસણે બેસતી. દિવસો નહિ, મહિનાઓ નીકળી જતા પણ અંતે ઘીના ઠામમાં ઘી પડીને એકતા થઈ જતી. સમય વીતતાં બંનેને એક થવાની ગરજ રહેતી અને પ્રેમ તો રહેતો જ. રીસમાંથી ધૃણા ન પ્રગટતી. માત્ર પોતાની અપેક્ષા પૂરી ન થવાનું દુઃખ રહેતું અને તેમાંથી 'ઈગો' પ્રગટતો. સમય જતાં 'ઈગો' ઠંડો પડી જતો. હા, કોઈ સારું મધ્યસ્થ મળ્યું હોય તો. જો ભડકા કરાવનારું મધ્યસ્થ મળે તો રીસ ભડકામાં બદલાઈ શકે છે. હવે રીસ, ભડકામાં બદલાય છે. કારણ કે બંને પક્ષે બહુ ગરજ રહેતી નથી. સારા મધ્યસ્થો પણ મળતા નથી. તેથી થોડો ઈગો અંતે છૂટાછેડામાં પરિણત થઈ જાય છે. પહેલાં આવું ન થતું. બાર-બાર વર્ષના રૂસણાં પછી પાછું ઘર ધબકતું થયું હોય તેવા પણ દાખલા જોવા મળે છે.

કોર્ટમાં સાક્ષી બન્યો

હાં, તો હું રિસાઈને બેઠો હતો ત્યાં ભાવસારોની ખડકીમાંથી બે કાંસકીઓ વેચનારી સ્ત્રીઓ એક પોટકું ઉપાડીને બહાર નીકળી. ઘટના સામાન્ય હતી. પણ થોડી જ વાર પછી ખડકીમાં કોલાહલ થવા લાગ્યો. વાતાવરણ ઉગ્ર થવા લાગ્યું. બધાં બહાર નીકળ્યાં. બન્યું એવું હતું કે મોહનલાલ ભાવસાર, અનાજ વેચવાનો ધંધો કરતા, કાંસકીઓ વેચનારું ટોળું અનાજ ખરીદવા આવ્યું હતું. નજર ચૂકવીને અનાજનું એક પોટકું ચોરી લીધું હતું. જે લઈને પેલી બે બહેનો નીકળી હતી, કેટલાક લોકો આજે પણ દુકાનોમાં ખરીદવાને બહાને જાય છે અને ચોરીઓ કરે છે, મોહનલાલે મને પૂછ્યું કે કોઈને પોટકું લઈ જતાં તેં જોયું? મેં કહ્યું કે હા, હમણાં જ એક બાઈ પોટકું ઉપાડીને ગઈ છે. તરત જ પોલીસને ફરિયાદ કરી. ત્યારે સ્ટેટની પોલીસ બહુ જબરી, તેની છાપ સારી. મોટા ભાગના મુસ્લિમ અમલદારો રહેતા. ક્રાઈમ બહુ જ ઓછા થાય. અમલદારો ઓછું ભણેલા, કેટલાક તો અભણ પણ હોય. અભણ જમાદારે તરત જ સપાટો બોલાવ્યો અને અનાજ સાથે પેલી બાઈને પકડી પાડી, બધુ કબૂલ કરાવ્યું. તે જ દિવસે કેસ ચાલ્યો. ત્યાં માંકડ સાહેબ મેજિસ્ટ્રેટ. સમી રહે પણ અઠવાડિયામાં એક દિવસ કેસ ચલાવવા મુજપુર આવે. માંકડ સાહેબ બહુ કડક. બધા તેમનાથી ડરે. તે દિવસે તેમની કોર્ટ ચાલુ હતી. મને સાક્ષી તરીકે બોલાવ્યો, મેં સાક્ષી આપી. તરત જ નિર્ણય થઈ ગયો. અનાજ પાછું મળ્યું અને સ્ત્રી સમજીને પેલી બાઈને થોડી સજા કરી. વાત પૂરી થઈ.

જો આ જ ઘટના આજે ઘટે તો વર્ષો લાગી જાય. કેટલી બધી પ્રક્રિયાઓ ઊભી કરી છે આપણે ! ન્યાયતંત્ર ગૂંચવાઈ ગયું છે અને તેમાં ન્યાય ખોવાઈ ગયો છે. ત્યારે મારી ઉંમર બારેક વર્ષની હશે. મેં પહેલી વાર કોર્ટ જઈ અને પહેલી વાર સાક્ષી તરીકે જુબાની આપી. હા, બંને પક્ષે વકીલ હતો જ નહિ. જેથી કેસ સરળ થઈ ગયો.

લાલ લીટી ચાલુ રહી

પૂર્વે કહ્યું તેમ અમારે થોડીક ખેતીની જમીન હતી અને તે લાલ લીટીની એટલે કે મહેસૂલમાફીની હતી. ત્યારે રાજા-રજવાડાં-નવાબો વગેરે અમુક પ્રકારની ઉદારતા દાખવતા. મંદિર-મહાદેવ કે મસ્જિદ-દરગાહ વગેરે પાસેથી કર ન લેતા, તેમજ બ્રાહ્મણો કે ફકીરો પાસે પણ કર ન લેતા. આ હિસાબે અમારી જમીન લાલ લીટીની હતી પણ પછી ખબર નહિ ક્યા કારણસર તેની લાલ લીટી રદ થઈ અને સામાન્ય મહેસૂલ ભરવાનું થયું. કદાચ માતા-પિતાના અવસાન પછી તે જમીન મારે નામે ચઢાવાનો પ્રસંગ હશે. જે હોય તે પણ કેસ ચાલ્યો. ફર પાછા એ જ માંકડસાહેબની કોર્ટમાં રાધનપુર જવાનું થયું. શ્રી રેવાશંકરકાકને પણ રાધનપુર કાંઈક કામ હતું. તેમનું ગાડું જતું હતું. મને પણ સાથે લઈ લીધો. ત્યારે બીજું કોઈ વાહન ન હતું. આખી રાત ગાડું ચાલ્યું. સવારના નવેક વાગ્યે અમે રાધનપુર પહોંચ્યા. ત્યારે ગાડાં છોડવાની એક ખાસ જગ્યા હતી. સેંકડો ગાડાંની અવરજવર રહેતી. આ બધા ગાડાં એક મોટા વાડામાં છૂટતાં. એક કે બે આના ચાર્જ લેવાતો. ચોકીદાર ચોકી કરે. કોઈનું કશું ચોરાય નહિ. બળદને સાથે લાવેલી ચાર નાખીને ગાડાવાળા પોતાનું કામ પતાવવા શહેરમાં જતા. અમે બ્રાહ્મણ, અમારાથી કોઈનું ખવાય નહિ. કપડાં ભલે મેલાંઘેલાં હોય પણ આભડછેટ બહુ જબરી. અમે તો સીધા કોર્ટમાં પહોંચી ગયા. શ્રી ધરણીધર વૈષ્ણવને વકીલ રાખ્યા. તેમણે અરજી લખીને મારી સહી કરાવી. કેસ શરૂ કર્યો. ધરણીધરભાઈએ દલીલો કરી. માંકડસાહેબે મને તો કાંઈ પૂછ્યું નહિ. માત્ર મારી હાજરી જ હતી. તરત જ જજમેન્ટ આવી ગયું. અમારી લાલ લીટી ચાલુ રહી. ધરણીધરભાઈની દલીલોએ કામ

realpatidar.com

https://archive.org/details/bk1396/page/n40/mode/1up

realpatidar.com

કર્યું કે પછી મારી અનાથ બાલ્યાવસ્થાએ માંકડસાહેબનું હૃદય પીગળાવ્યું હશે. વકીલે ફી ન લીધી. અમે હરખાતા બહાર નીકળ્યા. બજારમાંથી રેવાશંકરકાકાએ થોડી બરફી લીધી. ગાડા ઉપર જઈને અમે ખાધી, બરફીને આભડછેટ ન લાગે. અમે પાછા નીકળ્યા અને બીજા દિવસે મુજપુર આવી ગયા.

નાડોદા પટેલ અને એમન

અમારા પ્રદેશને વઢિયાર કહેવાય છે. વઢિયારમાં એક કોમ નાડોદા રહે છે. લગભગ બધા જ ખેડૂતો. પહેલાં બધાને પટેલો કહેવાતા પણ પછી આ કોમ પોતાને રાજપૂત બતાવતી થઈ છે. આ લોકો બહુ સારી ખેતી કરે તેથી ખાધેપીધે સુખી પણ ખરી. જ્યારે કોઈ સુખી માણસ મરી જતો ત્યારે તેની પાછળ 'એમન' થતું. એમન એટલે મૃત્યુ પછીના નિશ્ચિત દિવસે, બધા બ્રાહ્મણોને કાંઈક દાન-પુણ્ય થતું. ગામની ભાગોળે ગાડું ભરીને ઘઉં લવાતા. એક પાલી ઘઉંને સાથે એક શેરનો મોટો સુખડીનો લાડુ તથા ચાર આના જેવી દક્ષિણા અપાતી. આ એમન લેવા દૂર દૂરથી બ્રાહ્મણો આવતા. હું પણ એક વાર ગયેલો. પાંચ-દસ ગાઉ સુધી તો લોકો ચાલીને જતા પણ તેથી દૂર હોય તો કોઈ બ્રાહ્મણ પોતાનું ગાડું જોડી લેતો. જે દક્ષિણા મળતી તે ગાડાવાળો લઈ લેતો, બાકીનું બધું પોતાનું. આ ઉપરથી ગરીબાઈનો ખ્યાલ આવશે.

ત્યારે બળદથી ખેતી થતી. સૌને પોતપોતાના બળદો રહેતા, નાડોદાના બળદો બહુ ભલ્લા. જોયા જ કરો તેવા. ચોમાસામાં મચ્છરો બહુ થાય, મોટા મોટા ડાંસ પડે, બળદોને લોહીલુહાણ કરી નાખે. અમે બધા બળદો લઈને બે-ત્રણ જગ્યાએ ફરતા. પણ મચ્છરોથી છુટકારો ન થતો. ન બળદોને શાંતિ, ન અમને શાંતિ. કેવા દિવસો હતા!

બાવાઓનો ત્રાસ

ત્યારે બાવાઓનો બહુ ત્રાસ, રોજ બેચાર તો આવ્યા જ હોય. દુકાને દુકાને ફરીને અને ઘરે ઘરે ફરીને ઉઘરાણાં કરે. હઠ કરે. ગાળો પણ આપે. લોકો ડરે. "ચીડિયા બના દૂંગા" તેવો શાપ આપે. તેથી ડરીને લોકો મને કે કમને કાંઈનું કાંઈ આપે. મારા વિચારો સુધારાવાદી થઈ ગયેલા. લોકો આવા બાવાઓને મારી પાસે લઈ આવતા અને કહેતા કે ચાલો મહારાજ, તમને મોટી દક્ષિણા અપાવીએ. હું તેમની સાથે બાખડી પડતો અને અંતે ગામ છોડીને ભગાડી મૂકતો. એક વાર આવું ટોળું આવેલું અને ઝઘડો કરીને ગયેલું પછી ખબર પડી કે તળાવની પાળે આ ટોળું બાળ-બચ્ચાં સાથે ઊતરેલું છે. સવારે ટીલાંટપકાં કરીને પુરુષો ગામમાં નીકળી પડતા, રાત્રે બાળબચ્ચાં સાથે રહેતા. અમે તો આઠ-દસ છોકરાઓ રાત્રે તળાવ પર પહોંચી ગયા. અને બધાને સારો એવો મેથીપાક ચખાડ્યો. પછી તો આવા લોકો ગામમાં આવતાં ડરવા લાગ્યા. શાંતિ થઈ ગઈ.

❖

રેડ સ્વસ્તિકનો એવોર્ડ મેળવતા મહેન્દ્ર સેંઘાણી

મમાયમોરા તા. માંડવીના વતની અને હાલમાં કર્મભૂમિ ઘાટકોપર-મુંબઈના નિષ્ઠાવાન સેવાભાવી શ્રી મહેન્દ્ર જીવરાજ સેંઘાણી સામાજિક, ધાર્મિક અને આરોગ્યક્ષેત્રે નોંધપાત્ર સેવા આપી રહેલ છે. તેઓ પાટીદાર યુવક મંડળ, મુંબઈના ભૂતપૂર્વ પ્રમુખ છે અને હાલમાં રેડ સ્વસ્તિકના વાઈસ પ્રેસીડેન્ટ તરીકે સેવા આપે છે. અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘના પ્રભારી મંત્રી છે. હેલ્થ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટના કન્વીનર છે અને અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના સ્વર્ણિમ મહોત્સવના આરોગ્ય સમિતિના કન્વીનર છે.

તા. ૧૨-૧-૨૦૧૦ના રોજ નહેરૂ સેન્ટર વરલી, મુંબઈ ખાતે રેડ સ્વસ્તિક સોસાયટી દ્વારા આયોજિત ભવ્ય એવોર્ડ સમારોહમાં શ્રી મહેન્દ્ર જીવરાજ સેંઘાણીને રેડ સ્વસ્તિકના મેને. ડાયરેક્ટર શ્રી ભાલસાહેબ (આઈ.પી.એસ.)ના હસ્તે વિશિષ્ઠ સેવા પ્રદાન કરનાર શ્રેષ્ઠ કાર્યકર્તા તરીકેનો એવોર્ડ અર્પણ કરી બહુમાન કરવામાં આવેલ, રેડ સ્વસ્તિક દ્વારા કોઈ પણ નાત-જાતના ભેદભાવ વગર આરોગ્યક્ષેત્રે, સામાજિકક્ષેત્રે તેમજ ભૂકંપ, પૂર જેવી કુદરતી આફતોમાં રાહત સેવાના કાર્યો તેમજ એમ્બ્યુલન્સ સેવા, કેન્સર કેપો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા કાર્યક્રમોના આયોજનો કરી માનવતાની મહેક પ્રસરાવી રહેલ છે. રેડ સ્વસ્તિકના સેક્રેટરીપદે શ્રી બિપીનભાઈ લધાભાઈ પોકાર, વાઈસ પ્રેસીડેન્ટ શ્રી મણીલાલ ધોળુ અને જોઈન્ટ સેક્રેટરી શ્રી રવિલાલ પારસીયા સેવા આપી રહ્યા છે.

❖

realpatidar.com

https://archive.org/details/bk1396/page/n41/mode/1up

realpatidar.com

શ્રધ્ધાંજલિ

સ્વ. માવજીભાઈ પ્રેમજીભાઈ સાંખલા

સ્વ. તા. ૧૧-૧-૨૦૧૦, સોમવાર

જન્મ : તા. ૨૧-૯-૧૯૪૯ - ઉંમર : ૬૦ વર્ષ

કચ્છમાં : ઘડુલી - હાલે : રાજકોટ

જીવન એવું જીવી ગયા કદી ભુલાશે નહિ. વિદાય એવી લીધી કદી વિસરાશે નહિ. જીવન પંથ આમ તે છોડી જવાય નહિ, પણ મોક્ષ પંથે જનારને કોઈથી રોકી શકાય નહિ. મોક્ષ, પિતૃતર્પણ એવું સ્થાન (બોધ ગયા, મુકામે) પરમાત્મામાં આત્માલીન થઈ ગયો.

લી. આપનો શોકાતુર પરિવાર

માતા-પિતા : સ્વ. પુરીબેન પ્રેમજીભાઈ રામજીભાઈ સાંખલા

ધર્મપત્ની : ગં.સ્વ. તુલસીબેન માવજીભાઈ સાંખલા

નાનાભાઈ-પત્ની : મણિબેન જીવાભાઈ પ્રેમજીભાઈ સાંખલા - કમળાબેન મહેશભાઈ પ્રેમજીભાઈ સાંખલા
ગુણવંતીબેન કમલેશભાઈ પ્રેમજીભાઈ સાંખલા

પુત્ર-પુત્રવધૂ : મીનાબેન વિરેન્દ્રભાઈ માવજીભાઈ સાંખલા - ભૂમિકાબેન રાહુલભાઈ જીવાભાઈ સાંખલા
રાધાબેન અશોકભાઈ માવજીભાઈ સાંખલા - રીનાબેન પરેશભાઈ મહેશભાઈ સાંખલા
પુનિતાબેન રાજેશભાઈ કમલેશભાઈ સાંખલા - વૈશાલીબેન કલ્પેશભાઈ મહેશભાઈ સાંખલા

કાકા-કાકી : સવિતાબેન હરિવદન સાંખલા - દેવકીબેન મુળજીભાઈ સાંખલા

પૌત્ર-પૌત્રી : પારસ વિરેન્દ્રભાઈ સાંખલા - ઋત્વી રાજેશભાઈ સાંખલા
પૂજા વિરેન્દ્રભાઈ સાંખલા - સ્તુતિ પરેશભાઈ સાંખલા
ધરતી વિરેન્દ્રભાઈ સાંખલા - શ્રીના કલ્પેશભાઈ સાંખલા
દિવ્ય રાજેશભાઈ સાંખલા

બહેન-બનેવી : શાંતાબેન વીરજીભાઈ ભાવાણી (રાજકોટ) - ભાનુબેન રતિલાલ જબુવાણી (આષ્ટા)
પાર્વતાબેન દામજીભાઈ હળપાણી (વિરાણી) - લીલાબેન રમેશભાઈ ઘોઘારી (મહેસાણા)
દમયંતીબેન પ્રેમજીભાઈ વાડીયા (ભરૂચ) - રસિલાબેન ભવનભાઈ પોકાર (વિરાર)
ગંગાબેન છગનભાઈ સેંઘાણી (સાવલી)

દિકરી-જમાઈ : વનિતાબેન કિશોરભાઈ લીંબાણી (રાજકોટ) - જ્યોતિબેન કેતનભાઈ માવાણી (ગોંડલ)

દોહિત્રા ; દેવ, ઓમ, કાવ્ય

તથા સમસ્ત સાંખલા પરિવાર

ફર્મ : ગાયત્રી ટીમ્બર્સ, ૧૭સ કેવડાવાડી, રાજકોટ. મો. : ૯૪૨૮૧ ૫૮૬૮૧, ૯૪૨૮૧ ૫૮૬૮૨
ગાયત્રી વુડ વર્કસ : સંત કબીર મેન રોડ, રાજકોટ. મો. : ૯૯૨૫૦ ૩૧૦૭૪, ૯૮૭૯૬ ૧૧૦૭૮
ઉમિયા વિજય સો મીલ, ગળ પાદર રોડ, ગાંધીધામ. મો. : ૯૪૨૬૨ ૪૫૦૧૦, ૯૮૨૫૮ ૦૩૦૭૮

realpatidar.com

realpatidar.com

શબ્દસૌરભ

નીતા પટેલ

૧		૨	*	૩	*	૪		૫	૬
	*		*	૭			*	૮	
૯	૧૦		૧૧	*	*	૧૨		*	
૧૩		*	૧૪		૧૫		*	૧૬	
*	૧૭	૧૮		*		*	૧૯	*	
૨૦	*		*	૨૧	*	૨૨		૨૩	*
૨૪		*	૨૫				*	૨૬	૨૭
	*	૨૮		*	*	૨૯	૩૦		
૩૧	૩૨	*	૩૩		૩૪	*		*	
૩૫				*		*	૩૬		

આડી ચાવી

૧. કૃષ્ણની એક પટરાણી, યમુના. ૩.
૪. અટકળ. ૪.
૭. આંખ, રતન, લોચન. ૩.
૮. નવું, એક આંકડો. ૨.
૯. ઘાસ કાપવાનું ઓજાર. ૪.
૧૨. લાશ. ૨.
૧૩. સ્ત્રી, નારી. ૨.
૧૪. ખિન્ન, ઉદાસ. ૪.
૧૬. ગરીબ, દીન. ૨.
૧૭. ચારે તરફ. ૩.
૨૨. એક નીલા રંગનો કિંમતી પથ્થર. ૩.
૨૪. પ્રાપ્તિ, સિધ્ધ. ૨.
૨૫. ધર્મનો ફાંટો. ૪.
૨૬. ઉપાધી, પીડા, વ્યાધિ. ૨.
૨૮. વાણી, બોલી. ૨.
૨૯. આરોપ, આળ. ૪.
૩૧. દ્વિપ. ૨.
૩૩. બોલવાની એક ઢબ. ૩.
૩૫. ગૂંચવાડો, કોયડો, મૂંઝવણ. ૪.
૩૬. સિલાઈ કર્યા વગરનું વસ્ત્ર, કપડું. ૩.

ઊભી ચાવી

૧. છળપ્રપંચ, કપટબાજી. ૪.
૨. આરબ દેશનું ચલણી નાણું. ૩.
૩. જીવ, પ્રાણ. ૨.
૪. ઉપવાસ, આહાર બંધ કરવો તે. ૪.
૫. આબરૂ, પ્રતિષ્ઠા, આદર. ૨.
૬. ગદ્યમાં લખેલી કાલ્પનિક વાર્તા. ૫.
૧૦.લાફો, થપ્પડ. ૩.
૧૧.પર્વત, નગ. ૩.
૧૫.એક મોટું માંસાહારી પક્ષી. ૨.
૧૮.વરસાદ, વાદળ. ૨.
૧૯.તર્ક, વિચાર, કલ્પના. ૨.
૨૦. વરણાગિયો, લહેરી જુવાન. ૫.
૨૧.બ્રાહ્મણ. ૨.
૨૨.દાનત. ૩.
૨૩.ગડ-ગૂંમડ પર ચોપડવાનો લેપ. ૩.
૨૫.ચલાવવું - વ્યવસ્થા કરવી તે. ૪.
૨૭.પાનખર ઋતુ. ૪.
૩૦.હોળી. ૩.
૩૨. સેતુ, બ્રીજ. ૨.
૩૪.નાળિયેરીની જાતનું એક ઝાડ જેના બીજનો પીણાં તરીકે ઉપયોગ થાય છે. ૨.

ગતાંકનો ઊકેલ

આડીચાવી

૧. આરંભ. ૪. ચક્રવાત. ૭. ઠપકો. ૮. મમ. ૯. તીવ્ર. ૧૧. મામા. ૧૨. રતન. ૧૪. તમા. ૧૬. ઠગ. ૨૦. યાદ. ૨૨. ચોરસ. ૨૪. લજ્જા. ૨૫. સતલજ. ૨૭. ઈલા. ૨૮. તલબ. ૩૦. તર્ક. ૩૧. ખડ. ૩૩. ઉમા. ૩૫. રજા. ૩૭. દામ. ૩૮. સખાવત. ૩૯. નસીબદાર.

ઊભી ચાવી

૧. આરતી. ૨. ભથ્થું. ૩. ઠાઠમાઠ. ૪. ચક્રો. ૫. વામન. ૬. તમ. ૧૦. વ્રત. ૧૩. તમંચો. ૧૫. માયા. ૧૭. ગફલત. ૧૮. ત્રાસ. ૧૯. ઉલટતપાસ. ૨૧. દસ લાખ. ૨૩. રક્ષા. ૨૬. જલધિ. ૨૯. વામા. ૩૨. ડર. ૩૩. ઉમદા. ૩૪. દાવ. ૩૬. જાન. ૩૭. દાબ.

realpatidar.com

https://archive.org/details/bk1396/page/n43/mode/1up

realpatidar.com



realpatidar.com

realpatidar.com
Fresh
Fresh
all the time!
SILICON®
ZERO MAINTENANCE LAMINATE
STERLING
LAM LIMITED
(An ISO 9001:2000 Certified Company)
Distributors for Silicon: Ahmedabad: 079-65249176; Aurangabad : 0240-2344751; Bangalore : 080-26684496, 080-25436570; Baroda : 0265-2339107; Chennai : 044-42825577; Coimbatore : 0422-4370860; Dhulia : 0256-230542; Gandhidham : 02836-233424; Himatnagar : 09327665432; Hubli (Karnataka) : 0836-2369066; Hyderabad : 040-64512121; Indore : 0731-4225479; Jaipur : 0141-2332394; Jalgaon : 0257-2240751; Ludhiana : 0161-2443917; Mumbai (Andheri) : 022-28398433; Mumbai (Thane) : 022-25303858; New Delhi : 011-41420969, 011-41420278; Nasik : 0253-2411475; Pune : 020-26456942; Rajkot : 0281-2467498; Rajpura (Punjab) : 01762-645179; Raipur : 0771-2983182; Surat : 0261-2231405
Works: Block No. 123, At Mahiyal, Taluka Talod Distt. Sabarkantha 383 215, Gujarat, INDIA. Mob.:+91-9375021700
Email: sterlinglam1@rediffmail.com, www.siliconlam.com | Customer Care: Tel: (02770) 220300/ 500
realpatidar.com

https://archive.org/details/bk1396/page/n45/mode/1up

PATIDAR SAURABH (Monthly)
Regd. No. GKCH / 88-A / 2009-2011
RNI No. GUJGUJ / 2001 / 6356

realpatidar.com

Printed, Published and owned by Neeta Patel and printed at Allied Offset, Gomtipur - Ahmmedabad and Published at Nakhatrana (Kachchh). Editor : C.K. Patel.

Sweta Offset Pvt. Ltd. Ph. : 22940375

realpatidar.com